


# માબાપ થવું આકરું છે.



લે. સ્વા. ગિણુભાઈ

સંકાર સાહિત્ય મંદિર

પો. ઓ. નં. ૩૪ દરમારગઢ, ભાવનગર-૩૬૪ ૦૦૧







# માયાપ થવું આકું છે

દેખક  
મિનુભાઈ

સંરક્ષણ સાહિત્ય મંદિર

શે. બો. નં. ૩૪ : લાખનગર (સૌરાષ્ટ્ર)

પહેલી વાર : એપ્રિલ ૧૯૩૫  
ત્રીજી વાર : માર્ચ ૧૯૪૬  
પુનર્મુદ્રણ : ઓગસ્ટ ૧૯૮૩

રૂ. ૧૩/-

નાનાશાહ :

દીપકુમાર શાહ, સંસ્કાર સાહિત્ય મંદિર  
પો. બો. નં. ૩૪, દરાધારગઢ, ભાવનગર

નાનાશાહ :

રાધેશ્યામ પ્રિન્ટિંગ પ્રેસ, લોખંડ બજર, ભાવનગર

પ્રસ્તાવ

માણાપ થલું આકૃતું છે.

૧-૪-૩૫

જાવનગર

ગિજુભાઈ

## બીજુ આવૃત્તિનું નિવેદન

પ્રસ્તુત પુસ્તક મુ. સ્વ. શ્રી ગિજુભાઈના શિક્ષણવિપયક પુસ્તકોમાંનું એક છે. શ્રીદક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર બંધ થવાની સાથે જ ડેટલાંએક પુસ્તકો અપ્રાપ્ય થઈ ગયાં તેમાંનું આ એક છે. હવે, અમે એવો વિચાર કર્યો છે કે કે મુ. સ્વ. શ્રી ગિજુભાઈના શિક્ષણવિપયક તથા શિક્ષકો તેમ જ માબાપોને ઉપયોગી એવાં બધાં પુસ્તકોનું ધીમેધીમે પુનર્મુદ્રણ કરવું.

જ જમાનામાં આ પુસ્તક લખાયું તેમાં અને આજના જમાનામાં બાળકો સાથે વર્તન કરવાની દિશિમાં હજુ બહુ કાંઈ મોટા ફેર પણો હોય તેમ લાગતું નથી. શિક્ષણવિપયક ચર્ચાઓ ઘણી થતી હશે તેમ જ નવાં પુસ્તકો પણ લખાતાં હશે. પણ માબાપોને તેમનાં રોચિંદા જીવનબ્યવહારમાં બાળકો સાથે કામ પાડવા અંગેની સરળ અને સચ્ચોટ શૈલીમાં અપાયેલાં સૂચનેનાની પુસ્તકાએ હજુ ચુધી બહાર પડેલી જોઈ નથી.

માનસશાખાની અધરી જડબાતાડ પુસ્તકાએમાંથી સામાન્ય જનતા કથું જ્યોટ માર્ગદર્શન ન મેળવી શકે. બાળકની અનેકવિધ વર્તણુંદાની સાથે કામ પાડવાની બાબતમાં માબાપો પાસે સ્પષ્ટ અને સુદૂસરની સૂચનાએ આપેલી પુસ્તિકાએ હોવી જોઈએ; અને એમાં પણ પ્રસંગો, ભાષા અને લખાણની શૈલીમાં લોકભોગ્ય અને છદ્યંગમ પદ્ધતિમાં રજૂ કરવાનું કામ મારી નથી માન્યતા મુજબ મુ. સ્વ. શ્રી ગિજુભાઈ સિવાય બીજુ કોઈએ કથું જણ્યું નથી.

આજની આપણા દેશની સર્વતોમુખી પુનરૂર્થનામાં આવાં પુસ્તકો જનસમાજને ખૂબ જ ઉપકારક થઈ શકે તેવા સ્પષ્ટ સમજણું સાથે આ પુસ્તક બહાર પાડવાની જરૂરિયાત જોઉં છું. આશા છે કે મારી આ છંચા પૂણ થશે.

## અનુ કે મણ્ણુ કા

---

ક્રમ	વિષય	પૃષ્ઠ
૧	મારી સાથે ડેમ નહિ ?	૧
૨	બાપાને કચારે મળશું ?	૬
૩	અડધો દિવસ બગડચો !	૧૧
૪	સાચો બનાવ	૧૫
૫	એટલો બધો કયા કામમાં હતો ?	૧૮
૬	પણ એ મારું કચાં માને છે ?	૨૨
૭	એ તો રાયો નીંબરો છે	૨૪
૮	આનું તે કરવું શું ?	૨૭
૯	હમણાં ગોળા ફેડરી ...	૨૯
૧૦	માનતો નથી તે મરી જઈશ ?	૩૧
૧૧	નહાવાની ના પાડી છે	૩૫
૧૨	લાગી જત	૪૦
૧૩	બાળકમાં અશ્વા	૪૨
૧૪	ટેકણી	૪૫
૧૫	અપાની દે	૪૮
૧૬	તેડકાં બાળકો	૫૪
૧૭	વહેમનું શિક્ષણ	૫૮
૧૮	બાળકે બીકણું ડેમ થાય છે	૬૨
૧૯	ભૂખલણું	૬૭
૨૦	કાકી ઘરમાં બોલાવે છે	૭૪

ક્રમ	વિષય	પૃષ્ઠ
૨૧	શામળભાઈને ઘેર ...	૭૬
૨૨	તું સાંભળતી નથી ...	૮૨
૨૩	આપણી વાતો ...	૮૮
૨૪	છોકરાંએને કાન છે ...	૮૯
૨૫	આપણા હુકમો ...	૯૫
૨૬	વાણીમાં અતિશયોક્તિ ...	૯૭
૨૭	આપણને બોલતાં આવડે છે ? ...	૯૯
૨૮	ખાનગી વાતો ...	૧૦૨
૨૯	બાળકનું દશ્ચિંદ્રિદુ ...	૧૦૬
૩૦	બાળકોને શૂં ગમે છે ? ...	૧૦૮
૩૧	આગળ યુતાન ...	૧૧૧
૩૨	પહેલાં અને ઉમણું ...	૧૧૪
૩૩	આને બદલે આ કરું ...	૧૧૭
૩૪	બચ્ચી ...	૧૨૦
૩૫	બાળકો અને મહેમાનો ...	૧૨૫
૩૬	ચંદ્રકાંત પિતા હતો ...	૧૩૧
૩૭	અમીદદિલિ ...	૧૩૩

[ કુલ પૃષ્ઠ ૧૪૦+૮=૧૪૮ ]

—————\*

માણાપ થવું આકરું છે

## સ્વ. ગિજુભાઈનું સાહિત્ય

મોન્ટેસોરી પદ્ધતિ  
 દિવા સ્વર્ણ  
 આ તે શી માથાછોડ ?  
 માખાપ થવું આકરૂં છે  
 વાર્તાનું શાસ્ત્ર  
 માખાપોના પ્રશ્નો  
 નવા આચારો  
 બાલ કીડાંગણ્ણો  
 પ્રાસંગિક મનન  
 શાંત પળોમાં  
 કેમ શીખવવું ?  
 ચાલો વાંચીએ



મેળવવા માટે જણુાવો  
 સંસ્કાર સાહિત્ય મંદિર  
 પો. એ. નં. ૩૪, ભાવનગર.

[ ૧ ]

## મારી સાથે કેમ નહિ ?

વાત કરતાં ગજનને કહ્યું : “ રમણુલાલ ! આ તારાં છોકરાં તારી સાથે અટપટ વાતો કરે છે ને પૂછવું હોય તો પૂછે છે; તારી આસપાસ ફૂદે છે ને નાચે છે, ને તને આ બતાવે છે ને તે બતાવે છે. ને મારાં છોકરાં તો એવાં જરા ચે નથી. નથી મારી સાથે છૂટથી બોલતાં કે નથી કંઈ સવાલો પૂછતાં; નથી તેઓ કહેતાં કે પોતે શું વાંચે છે કે શું લખે છે, ને રમે છે કે ભરે છે. આનું કારણ શું હશે ? ”

રમણુલાલે કહ્યું : “ ખરું કારણ કયું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય ? પણ કંઈ જોઉ છું, જાણું છું તે ઉપરથી કહીશ. મને એમ લાગે છે કે એમાં છોકરાંઓનો વાંક નથી. વાંક કહીએ તો તારો છે. અને એક રીતે એ વાંક પણ અણુસમજ કે અણુઆવડત છે. ”

ગજનન કહે : “ કઈ ? કહે જોઈએ ? ”

રમણુલાલ : “ એ તારી છોકરાંઓ સાથે પહેલેથી ન ભળવાની ટેવ. તું જાણે અમલદાર. નોકર, ચાકર વગેરે ય તારાથી ફર ને ફર. બીજા નીચેના અમલદારો. પણ ફર ને ફર. તારો સ્વભાવ પણ અમલદારશાહી. આમ મોહું ગંભીર રાખીને એસી રહેવાનો. પણ છોકરાંઓને એવો સ્વભાવ નથી ગમતો; તેઓ એવા માણુસથી ફર લાગે છે. ”

ગજનન : “ પણ એમ તો હું એમની સાથે બોલું છું; નિશાળના અને રમતના સવાલો પૂછું છું; વખતે કંજિયા થાય છે તો પતાવું છું. એમ કાંઈ સાવ અછુડ થઈને એસી નથી રહેતો. એમ તો હું એમનો બાપ છું, ને તે મારાં છોકરાં છે. ”

રમણુલાલ : “ પણ એમ તો ખરું ના કે તું એમને પૂછે છે માત્ર ? તું એમનો ન્યાયાધીશ થાય છે માત્ર ? તું એમનો કાંઈ ભિત્ર થોડો થાય છે ? ”

ગજનન : “ એટલે ? ભિત્ર થવું એટલે ? એ બાપથી કેમ ખની શકે ? ”

રમણુલાલ : “ એમાં જ ખૂબી છે, ને ત્યાં જ બાળકોના અંતઃકરણની ચાવી છે. એ ચાવી હાથમાં આવી એટલે બધાં તાળાં ઊંઘડે છે. પછી તો તેઓ આપણી પાછળ ફરવાનાં; નવા નવા સવાલો પૂછવાનાં; આપણી આગળ નાચવા-કૂદવાનાં, અને કહીએ તે વેગે વેગે ને હેંશે હેંશે કરવાનાં. ”

ગજનન : “ પણ ભિત્ર થવું શી રીતે ? ”

રમણુલાલ : “ એ તને કહું. છોકરાંના ભિત્ર તેમનાં કાર્યોમાં રસ લઈને થવાય. નિશાળે કેટલામો નંબર આવ્યો. તે પૂછીને ભિત્ર નથી થવાતું; પણ નિશાળમાં તેઓને કેવું ગમે છે, માસ્તર ડેવા છે, તેને વિષે તેઓ શું ધારે છે, તેની ગર્ભત તેઓ કેમ ઉડાવે છે, એવું એવું બધું તેમની પાસેથી જયારે જાણવા એસીએ લારે તેઓ આપણી નજીક આવે છે. તેમને પોતાની શાળા વિષે ને ત્યાં ચાલતા કાર્ય વિષે કોઈકને કહેવાતું મન તો હોય જ છે; પણ કોઈ સાંભળનાર ન મળો એટલે પડચાં રહે છે. આપણે જરા કાન ધરીએ તો તેઓ આપણી પાસે પણ ખીલે છે. ”

ગજનન : “ત્યારે એમ કરી જોઈશ. પણ આ એક જ બાબતમાં મિત્ર થઈ જવાય ? ”

રમણુલાલ : “ના; આ તો હાખલો આપયો. ભાગકોના જીવનમાં નાનીમાટી અનેક બાબતો હોય છે; તેના વિષે આપણે ધણી વાતો કરી શકીએ છીએ. ભાગકોને ગમતું-અણ-ગમતું, શોખતું-અશોખતું, ભાવતું-નહિ ભાવતું, રૂપાળું-અરૂપાળું, એવું ધણું હોય છે. તેના ઉપર તેઓના અલિ-પ્રાયો, પસંદગી-નાપસંદગીનાં કારણો વગેરે હોય છે. તે જાણવામાં આપણે રસ લઈએ, તેમનાં નાનાં સુખહૃદાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, તેમની નાનીમાટી પ્રવૃત્તિઓની કદર કરીએ, તો તેઓ આપણું મિત્ર તરીકે અનુભવે છે; અને ત્યારે જ તેઓનું અંતઃકરણ કેળે છે ને જિધડે છે. ”

ગજનન : “વાત તો સાચી લાગે છે. તારો અનુભવ ઊડો લાગે છે. ”

રમણુલાલ : “હા, છે તો અનુભવની જ વાત. એકએ મારા હાખલા તાજેતરના જ આપું. મારો હીકરો હમણાં સિદ્ધાંતો અને રિટિક્ટો એકઠી કરે છે. મને એ ખખર પડી કે તુરત જ હું તેને મદદ કરવા લાગ્યો. છું. મારા મિત્રને મેં કાગળો લખી તેની એણખાણું કરાવી છે મારી પાસે જ્યારે જ્યારે નવી જતની રિટિક્ટો આવે છે ત્યારે તેને માટે સાચવી રાખું છું. તેને મેં સ્ટેન્પ કલેક્ટિંગ કેમ કરાય તેની કેટલીએક સૂચનાઓ કરી ત્યારે તે ખુશી ખુશી થઈ ગયો. મારી મદદ તેને બહુ ગમી છે; અને એક જોડ જોડા કે ટોપી લઈ હઉ છું ત્યારે ખુશી થાય છે તેના કરતાં એકણે સ્ટેન્પથી તે વધુ પ્રસન્ન થાય છે. અમે સ્ટેન્પ અને તેના દ્વારા વિષે વાતો કરવામાં ખૂબ રસ લઈએ છીએ. તે વખતે તે ખીલે છે; તેના

સ્વભાવની મને ત્યારે પરીક્ષા થાય છે; ને તે વખતે તે મને વધારે પૂજ્યભાવથી જુચે છે.”

ગજનન : “ તું તો ભારે કરે છે ! મારે આમ કરતાં શીખવું જેઠશે. ખરેખર, હું તો અમલદાર તે અમલદાર જ. મોઢવા જેમ બેસતાં અને દુઃખાબ છાંટતાં આવડે, પણ છોકરાંઓના મિત્ર થતાં ન આવડે. મારે તે શીખવું પડશે.”

રમણલાલ : “ ન આવડે એવું કંઈ નથી. અને એમાં શીખવા જેવું કશું નથી. પણ આપણું ધ્યાન તે તરફ જવું જેઠાં. આ અમારા પાડોશમાં ત્રિવેણીએન છે, એનામાં બાળકોના મિત્ર થવાની સુંદર આવડત છે. અને એમ કંઈ બાળકો સાથે એ કાલાં કાઢતાં નથી. પોતે બાળકોના રસના વિષયેને સારી રીતે જાણે છે. પોતે સારું ભણુલાં છે ને પાંચમાં પુછાય પણ છે; પણ બાળકો સાથે બેસે છે ત્યારે બાળકોને જરા ચે ભારે નથી લાગતાં. અને છતાં ખૂબ સારાં અને જાચાં લાગે છે. તેઓ તો ત્યાંથી વાત કરશે : ‘તમને વડાં ભાવે કે નહિ ? કહેણ ત્યારે, આપણે કાલે કરશું ? હાળ કોણ વાટશે ? કોથમરી કોણ વીષશે ? તળવા કોણ બેસશે ?’ બીજી વાત કાઢશે : ‘ આ ચૂંઢીનો કસબ કિમતી છે ખરું ? અમે નાનાં હતાં ત્યારે ભૂરા રંગની ચૂંઢી પહેરતાં; તે વખતે ખાદી નહોંતી મળતી, પણ અમે સૌ મિલનું કાપડ વાપરતાં. તારી ચૂંઢી ખાદીની લાગે છે, ખરું ?’ વળી બીજી વાત નીકળશે : ‘ તમને અંધારામાં જિંધ આવે કે નહિ ? મને નાની હતી ત્યારે ઓટી ઓટી બીક લાગતી. પણ એક વાર બાપુએ મને અંધારામાં સુવાડી ને બીક ન લાગી, એટલે પછી બીતી મરી ગઈ.’

ગજનન : “ એ ત્રિવેણીએન તો ભારે વાતો કરે છે. બાળકોને સ્વભાવ એ બરાબર જાણતાં લાગે છે.”

રમણુલાલ : “ એ તો આપણે જરા એ તરફ મન કરીએ તો આપણુને પણ ધીરે ધીરે સૂઝે. આપણે એ બાબતમાં આંધળા રહીએ છીએ તેથી બધું બગડે છે.”

ગજનન : “ વારુ, રમણુલાલ ! આજ તો મને ખૂબ નવું મળ્યું. એમ તો ભારે હરસુખ અને ચંદ્ર સાથે કેટલી ચે વાતો થઈ શકે તેમ છે. તેઓ કિકેટ રમે છે, સિનેમા જુએ છે, નાની નાની વાર્તાએ વાચે છે.”

રમણુલાલ : “ હું, હવે બરાબર નજર પહોંચી. એમાં જ એમની સાથે વાત કરવાનું કેટલું ચે છે. ને મજા તો એ છે કે એમના જ વિષયની વાતો કરતાં કરતાં આપણે તેઓને ખબર ન પડે તેમ કેટલાં ચે નવાં દિશિબિંદુએ બતાવી શકીએ છીએ. અને એમ ઉપરેશથી કે હુકમથી તેઓને ગળે ન જિતરે તેવું આવી આવી વાત વાતમાં તૈઓ કેટલું ચે લઈ વે છે.”

ગજનન : “ સાચી વાત; સાચી વાત.”

રમણુલાલ : “ વારુ ત્યારે, આથી વધારે હવે જીજ વાર મળીએ ત્યારે વિચારશું.”

ગજનન : “ વારુ. રામરામ ! ”



લક્ષ્મીદાસ ડોક્ટર હતા. ધીકતી પ્રેહટીસ હતી; એક ઘડીની કુરસદ ન હતી. સવારે જોડે ત્યાં તો કોઈ ને કોઈ મોલાવવા આનયું જ હોય । તેમને આ જ કારણે બાળકો જોડે તે પહેલાં નાહીયોઈ, ફુધ પી તૈયાર થઈ જવું પડતું.

એકવાર સવારે ધરમાંથી બહાર નીકળ્યા પછી તેઓ ખાર-સાડાખાર વાગે માંડ માંડ પાછા આવતા. દરહીઓની તપાસ કરતાં કરતાં તે પોતાના ખાનગી દ્વારાને દસ વાગે પહોંચતા, અને ત્યાં પહોંચતા ત્યારે દરહીઓ કચારના કંટાળતા એઠા હોય.

દસથી એ અઠી કલાક કયાં જાય તેની લક્ષ્મીદાસને ખખર જ ન રહેતી; એટલું બધું કામ રહેતું.

ખાર સાડાખાર વાગે તેઓ ઘેર આવતા. તેમને માટે જમવાનું ખાસ જિનું રાખવામાં આવતું. ધરનાં બાળકોને અગિયાર વાગે બાલમંહિરે જવું પડતું.

ખપોરે એ અઠી કલાક લક્ષ્મીદાસ વિશ્રાંત લેતા; પણ ચાર વાગ્યા પછી તો તે ભાગ્યે જ ધરમાં ભણે. વળી પાછી દરહીઓની તપાસ કરવા આવવાની માગણી; વળી પાછું સાંજે પાંચથી છ સુધી પોતાનું દ્વારાનું.

લક્ષ્મીદાસ કલખના શોખીન હતા. દરહીને ભૂલે પણ કલખને ન ભૂલે. બ્રીજ અને બિલિયડ તે કઢી પણ પડવા ન હે. રમવામાં અને રમવામાં રોજ તો રાત્રિના નવ વાગે જ; પણ કોઈ કોઈ વાર તો દશ પણ થઈ જાય !

લક્ષ્મીદાસભાઈનો સાંજનો જમવાનો વખત સૌથી છેલ્લો અને મોડો રહેતો. સાંજે પણ રસોઈ ઢાંકી રાખવી પડતી. નાનાં છોકરાંને ઊંઘ આવતી હોય ને મોટાંઓને ભૂખ લાગી હોય એટલે ઘરમાં રસોઈ તો વહેલી થઈ જતી.

આ પ્રમાણે લક્ષ્મીદાસભાઈનો હૈનિક કાર્યક્રમ હતો.

પણ લક્ષ્મીદાસભાઈ રવિવાર પાળતા; તે દિવસે સાંજે દવાખાનું બંધ રાખતા, ને કલખમાં પણ ન જતા. પણ ખાળોને તથા કુટુંબને લઈ ધણું ખરું ફરવા જતા, અથવા ઘરમાં કંઈ કંઈ જતની ગમતો રમતો ચલાવતા.

ઘરમાં સૌથી નાનો રસિક હતો. લક્ષ્મીદાસને તે બહુ વહાલો હતો. લક્ષ્મીદાસ રાત્રે આવે ત્યારે તે સૂતો હોય અને જાય ત્યારે પણ ઊંઘતો હોય; એટલે લક્ષ્મીદાસ તેના પર હમેશ હાથ ફેરવે, તેને બચી લે, તેની કાલીધિલી વાતો તેની બા પાસેથી સાંભળી સાંતોષ લે. બીજાં નાનાંમોટાં છોકરાં તો કોઈ કોઈ સવારે વહેલાં જેઠે, કોઈ કોઈ મોડાં સૂચે એટલે લક્ષ્મીદાસની સાથે વાતો કરવાનું, ગમત કરવાનું તેમને મળતું. લક્ષ્મીદાસ ખરેખરા આનંદી સ્વભાવના હતા; ઘરમાં આવતા ત્યારે તો દવાખાનું અને પ્રેર્ણીસ, બધું ભૂલી જતા.

રવિવારની સાંજ હતી. અગારીમાં બેઠાં બેઠાં સૌ ગમત કરતાં હતાં. નાનો રસિક પણ લક્ષ્મીદાસના ઓળામાં બેઠો હતો. તેને ત્રણ વર્ષ થયાં હતાં. તે ધણો ચાલાક હતો; બહુ ઓલકો હતો. માન્યીસોદી શાળામાં તેની મારી એન સાથે કંજિયા કરીને રોજ જતો, ને ત્યાંના શિક્ષકોને પણ પ્રિય થઈ પડ્યો હતો.

રમતાં રમતાં બાપાની દાઢીએ હાથ ફેરવી રસિકે લક્ષ્મીદાસને પૂછ્યું : “ લખુલાઈ ! તમે કોઈક કોઈક વાર જ

કેમ આવો છો ? તમે અમારા બાળમંદિરમાં સોમવારે રજા હોય છે તે દિવસે સવારથી આવતા હો, તો કેવી મજા પડે ? તો તો આએ દિવસ ગર્ભમત થાય.”

લક્ષ્મીદાસ : “હે, ગાંડા ! હું તો રોજ અહીં જ છું; અહીં જ રહું છું.”

રસિક : “ના ના, ઓટી વાત; ઓઠું ઓલો છો. તો તો હું તમને દેખું ના !”

લક્ષ્મીદાસ : “એ તો તું રોજ સૂતો હોય છે તે પહેલાં મારે બહાર જવું પડે છે.”

રસિક : “એટલું બધું વહેલું ?”

લક્ષ્મીદાસ : “હાસ્તો : દરર્દીએને તપાસવા સારુ વહેલાં જવું પડે છે.”

રસિક : “ઠીક; પણ તમે અહીં રહેતા હો તો પાછા કયારે આવો છો ?”

લક્ષ્મીદાસ : “બ્યોરે જમવા આવું છું, પણ તે વખતે તમે બધાં નિશાળે ગયાં હો છો.”

રસિકે બા તરફ જેઈને પૂછ્યું : “હે ! બા ! સાચી વાત ?”

બા કંઈ ઓલી નહિ

રસિક કહે : “એ તો કોણું જાણો. એકવાર બાળમંદિરમાં નહિ જાઉં એટલે બખર પડશો.”

લક્ષ્મીદાસ : “પણ સોમવારે તારે રજા હોય જ છે ના ? તે દિવસે હું બ્યોરે ઘેર જ હોઉં છું ના ?”

રસિક : “ મારે હવે જેવું જોઈશે ગયા સોમવારે અમે સવારથી સાંજ સુધી મારીને ત્યાં ગયા હતા; અને પહેલાંના સોમવારે અમારે બાલમંહિર હતું.”

વર્ચ્યે બાએ કહું : “ તે પહેલાંના એ સોમવારે તો તમારે જ બહારગામ જવાનું બન્યું હતું. રસિકનું કહેવું ખરું છે; લગભગ દોઢ એ માસથી સોમવારે બપોરે તમે કોઈ લેગા થયા જ નથી.”

લક્ષ્મીદાસે ભવાં ચડાવી ડોકું ધુણાવ્યું.

રસિક કહે : “ પણ રાતે ય તમે નથી હેખાતા. કાકા, મોટા ભાઈ, મોટીબેન, બધાં ય અમે સાથે જ જમીએ છીએ; પણ તમે નથી હોતા.”

બાએ જરા કટાક્ષમાં કહું : “ એ તો રાતે રોજ કલબમાં જય છે. તું ઉધી જય ત્યારે આવે છે; કોઈ વાર તો ખરું મોડા આવે છે.”

બાને કલબ નહોતી ગમતી. આએ દિવસ પ્રેરીસ માટે બહાર રહેવું પડે એ તો ઠીક, પણ મોડી રાત સુધી પાછું કલબમાં રહેવું તેને સાંનું નહોતું લાગતું. બાએ આ પ્રસંગે લાગ જોઈને આઠબો કટાક્ષ કુચો.

પણ લક્ષ્મીદાસને માટે આઠબો કટાક્ષ પણ બસ હતો; અગર તેટલાની પણ તેને જરૂર ન હતી. રસિકે પહેલો પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ તેણે અંતરમાં વિચાર કરવા માંડ્યો જ હતો; તેની આંખ આગળ તેનું આખા દિવસનું કાર્ય તથું. એક વાત તેને સ્પષ્ટ હેખાઈ; જે બાળકો માટે ચેતે આએ દિવસ કમાયા કરે છે, તેમને પૂરું મળાતું પણ નથી ! રસિક સૂતો હોય ત્યારે બહાર જવાનું અને ઊંઘતો હોય ત્યારે ઘેર

આવવાનું; એ સ્થિતિ કેવી શોચનીય અને ભયાંકર! “આમાં કચાં હું એના જિછળતા બાલજીવનમાં આનંદ અને રસ ભરી શકું? મારાં પ્રિય ઝેરજાંહાની સાથે રમવા—ઘેલવા અને તેમની સાથે આનંદ અનુભવવાનો લહોવો હું હાથે કરીને જ છોડી ફરજ છું!”

રસિકે ઝરી વાર બાપાની ઢાડીએ હાથ ઝેરવી કહ્યું: “બાપુ! કેમ બોલતા નથી? ચાંડો એક ગમ્મત કરી હસાવો. પાછા તમે તો કેટલા યે દિવસે હેખાશો.”

રસિકના છેદ્વા ઓડે લાગેલું તીર લક્ષ્મીદાસની છાતીમાં વધારે ઊડું જિતથું, ને અંતરને લેદી નાખ્યું.

લક્ષ્મીદાસે કહ્યું: “લારે હું રોજ સાંજે આવું ને રોજ આપણે ગમ્મત કરીએ, તો કા?

રસિકના ગાલ લાલ થઈ ગયા. તેણે ગળે બાજી પડી કહ્યું: “તો હું તમને રોજ રોજ એક એક ટીકડી આપીશ !”

સૌ હસી પણ્યાં

લાગળીથી વેરાચેલું વાતાવરણ એ હાસ્યથી જરા હળવું થયું.

લક્ષ્મીદાસે કહ્યું: “ને, રસિક! હવેથી હું કલખમાં નહિ જાઉ, અને દવાખાનેથી સાથે વેર જ આવીશ. પછી આપણે સૌ સાંજે ઝરવા જઈશું. હવે છે કાંઈ?”

રસિકને સારું લાગ્યું; રસિકની બાને તો મનમાં હાશ થયું.

તે દિવસથી જ લક્ષ્મીદાસભાઈએ કલખમાં જવાનું બંધ કહ્યું; એટલું જ નહિ પણ પ્રેર્ણીસને બહુ વિશાળ કરવાનું

માંડી વાળી કંઈક ઘરમાં રહેવું, ખાળખચ્ચાંએ સાથે આનંદ લેવો, એ તરફ જવાનું શરૂ કર્યું.

\*

[ ૩ ]

### અડધો દિવસ બગડચો !

કંઈક તહેવારનો દિવસ હતો. અત્યારે બરાબર યાદ નથી. તેની આગલી રાત્રે મણિલાલના ઘરમાં પૂબ ઉત્સાહ હતો. છોકરાંએ કૃદતાં હતાં ને કહેતાં હતાં : “હૈયા, કાલે મજા પડશે !” મણિલાલ અને રેવાયેન બધી ગોઠવણું વિચારતાં હતા.

મણિલાલ મારા પાડોશી ને એક રીતે મિત્ર.

સવાર પડયું ને મણિલાલ ગામમાં શાક લેવા ગયા. રેવાયેન જિક્યાં ને છોકરાંએને અટપટ નવરાવવા-ધીરવરાવવા મંડચ્ચાં. રેવાયેનને ધાણું યે કામ કરવાનું હતું.

પાડોશણું આવીને કહે : “રેવાયેન ! જરા આવો તો, આ મારા ભાણુને પેટમાં હુંઘે છે તે ? ”

સાપે છછુંદર ગળ્યા જેવું થયું. જય તો વખત જય, ને ન જય તો માહું લાગે !

કીકાને નવરાવી લઈ રેવાયેન ભાણુને જેઠ આવ્યાં. પાછાં વળતાં બબડ્યાં : “એમાં બતાવવું”તું શું ? જરાક કંઈક થયું કે આ મને યોલાવી જ છે ? અમારે તે કંઈક કામબામ હશે કે નહિ ? જય નહિ વૈધ પાસે ! ”

રેવાયેન જરા મનમાં એંસાચાં. નવરાવેલો! કીકો ઘરમાં કપડાં હાથે કાઢી પહેરતો હતો; કીકાએ કપડાની ટ્રેંક આખી ફેંદી નાખી હતી!

રેવાયેન જીવી હીકરી પર જરાક જિતર્યાં : “નેતી નથી એલી જીવલી! આ કીકાએ બધું ફેંદી નાખ્યું તે? કર કીકાને કોરા, ને મૂકી હે આ બધાં કપડાં !”

કીકો રડવા લાગ્યો; જીવીનું મેં ચડયું. તે કહે : “એમાં હું શું કરું? કીકો એવો છે એમાં?”

રેવાયેન કહે : “લારે કપડાં રખડવા હે. જો, આજે ગડખડ કરવી છે ને? અને તારા ભાઈ હમણાં આવશે ને કહેશે, આ ગડખડ શી છે?”

જીવી મેં નીચું ધાલી એંસાતી એંસાતી કામ કરવા લાગ્યી, રેવાયેન પપડતાં હતાં.

રેવાયેને જમુને નાહવા એલાવ્યો, પણ જમુ પાઠીમાં એકડા લખતો હતો. તે કહે : “આવું છું, બા હમણાં આવ્યો.”

રેવાયેન કહે : “મારે એઠી કયાં સુધી થવું? હજુ તો શારો કરવો છે ને શાક તો હજુ આવ્યું ચે નથી! જો, ખાઈપીને સૌને બાગમાં જવું છે.”

જમુ કહે : “એ...આવ્યો.”

પણ ત્યાં તો રેવાયેન આવ્યાં ને પાઠી ફેંકી હીધી! પાઠીના કટકા થયા ને જમુ રડવા લાગ્યો. “ચાલ, રડે છે શું? કયારની કહું છું તે સારતો નથી?” રેવાયેન શુસે થયાં.

ત્યાં મોટો હીકરો ચંપક આવ્યો. રેવાયેન કહે : “અલ્યા અલ્યારમાં કચાં ગયો હતો?”

ચંપક કહે : “ રામજીને કહેવા ગયો હતો કે સાંજે ઘેર આવીને જાહુના એલ કરે.”

રેવાણેન તાડુકચાં : “ તે અત્યારમાંથી ત્યાં શું કહેલુંતું ? ખ્યોર આખી નોંતી પડી ? ”

ચંપક કહે : “ પણ બા.....”

“ જા, જા, ઘરમાં પગ જ ટકતો નથી ! ”

ચંપક કહે : “ પણ બા.....”

રેવાણેન કહે : “ લે હવે અટઅટ કપડાં સંકેલી નાખ. જો પણે ખંડું એવું ને એવું પડયું ! ને આ તારો ઢંગ તો જો, હજી નાયો પણ નથી ? ”

ચંપકનું મેં ચડયું ; તે કામ કરવા લાગ્યો.

કીકા રડતો હતો; જીવી મેં ભયડોડીને ચાખા વીણું હતી; ચંપકનું ટીચકું ચડેલું હતું; રેવાણેનનું માથું ગરમ થઈ ગયું હતું.

ઘડિયાળમાં સાડાદશનો ટકોરો થયો.

હજી ભણ્ણિલાલ આવ્યા ન હતા. રેવાણેન તલપાપડ થતાં હતાં, પપડતાં હતાં : “ કયારે શાક આવશો, કયારે રવે આવશો ને કચારે ખંડું થશો ? એ વાગે તો રુક્ષિમાણીએનને ત્યાં જવું છે ! એમની ટેવ તો એની એ રહી ! મજ્યો હશો કોઈ લાઈબંધ એટલે એઠા હશો વાતો હાંકવા ! ”

ત્યાં જોડા ખખડચા અને ભણ્ણિલાલે હસતા અવાને કહ્યું : “ કાં કીકા, જીવી. ચંપક ! તૈયાર થવા માંડચાં છો ને ? કાં, રસોાઈ કેટલે પહોંચ્યો ? ”

રેવાણેનાં ભવાં ચડચાં. ચિડાઈને તાડુકચાં : “ તૈયાર તે ખંડાં કયાંથી થતાં હતાં ? આ જસુડો ને તમારો કીકા ને

જીવી ને ચંપક : એકેમાં વેતા કયાં બળ્યા છે ? ને તમારે તો હજુ યે મોડા આવવું તું ને ? રવા વિના શીરો કચાંથી કરવાની હતી ? ને શાકને તે કચાંઈ અગિયાર વાગતા હશે ?”

મણિલાલ કહે : “ એમે આજે પેદો....”

“ એ, મારે એ બધું નથી સાંભળવું. અટ શાક સુધારે કે ચૂલાસેણું કરું.”

મણિલાલ ડાવકું મેં રાખી શાક સુધારવા એઠા. ત્યાં કીડો આવ્યો ને કહે : “ બા અમને આમ કરતી હતી.” જીવી કહે : “ બાપુ ! બાએ જગુની પાટી ઘા કરીને તોડી નાખી.”

મણિલાલ કહે : “ હશે, આજે કોઈએ રેવાય નહિં; આજે મોઢું યે ન ચડાવાય. આજે તો આપણે ત્યાં ઉત્સવ છે ને ? ચાલો જેઠાએ, હું બતાવું તે કરવા માડો જેઠાએ !”

રેવાયેન તાડુકયાં : “ એ હવે ડાહી ડાહી વાતો કરશે. અત્યાર સુધી થઈતી એ જેવા તો આવવું તું ? જે ને કીડો જઈને ઝરિયાદ કરે છે, બા આમ કરતીતી ને તેમ કરતીતી ! ને જીવલી તો જીવલી છે ! ભૂડું નવરોણું મેં !”

છાકરાં પાછાં હેબતાઈ ગયાં.

મણિલાલે શાક સુધારી આપ્યુ એટલે રેવાયેને ધખધખ ડામ પછાડતાં પછાડતાં વધારી હીધું.

રેવાયેનનો મિજાજ ડેકાણું ન હતો.

રેવાયેન કહે : “ આવશો મા કોઈ રસોડામાં ; હું મારે એકલી બધું કરી નાખીશ. મારે તમારું યે ( મણિલાલતું ) કામ નથી.”

સૌ ઘરમાં ચૂપાચૂપ બેસી રહ્યાં.

બાર ઉપર એક વાગે ખાવાનું થયું. રેવાએને બધું તૈયાર કર્યું ને સૌને જમવા આપાવ્યા.

કીકો, જીવી, ચંપક, નીચાં મો લઈને જમવા આવ્યાં; મણિલાલ પણ અણોલ આવીને બેઠા. રેવાએન પણ કોણી સાથે બાલે ને કોને આપાવે?

બધાં મૂંગાં મૂંગાં જેવુંતેવું જમ્યાં. કોઈનાં મન હરખમાં ન હતાં; મણિલાલનો જીવ તો બળી બળીને ખાખ થઈ ગયો!

જમી ઉભ્યાં, સૌચે ગજયું ખાવાનું ખાધું; પણ કાલે વાતો કરી હતી એટલો યે સ્વાદ એમાં ન આવ્યો. બધાંએ પાનમાન પણ ખાધાં પણ કંઈક રીસમાં, કંઈક અણુઉમંગમાં.

મણિલાલને થયું કે હવે કંઈક સુધારું તો ટીક. પણ રેવાએનની નાડ હજી જેરથી વહેતી હતી. તેણે ય કંઈક ખાધું ખરું, પણ એવું સરખું.

આમ સૌનો અડધો દિવસ બગઝ્યો!



[ ૪ ]

સાચો બનાવ

ધારો કે એ દવા તો આખરે નિર્દોષ નીવડી ને રંભાને કંઈ ન થયું. પણ એ શીશીમાં જેર જ હોત, અને અનેક ઉપચારો કર્યા છતાં રંભા મરણુશરણું થઈ હોત, તો? અગર ભયંકર માંદગીની લોગ થઈ પડી હોત, તો?

તો તે દિવસની એદરકારી એ ગુનાઈત કૃત્ય ન ગણ્યાત ? અને ન ગણ્યાત કે ગણ્યાત એનો ગ્રશ જ કયાં છે ? એ કૃત્ય ગુનાઈત જ ગણ્યાય. કારણું એમાં કેટલું ખંડું જોખમ લાયું હતું તે તો અદ્યો કલાક થઈ રહેલી મૂંબણું જ કહી ખતાવે છે.

એ શરમાવનારી અને ગુનાઈત હડીકિત આ પ્રમાણે બનેલી : રંભાને તાવ આવતો હતો; મેલેરિયા હતો. રંભાની ખા પુષ્પાએને રમાનાથને કહ્યું : “આને પણ રંભા એચેન છે. એક કિવનાઈનનો ડેઝ આપો જોઈએ ?” પુષ્પાએને તાજું આવેલું માસિક પત્ર ઉઘાડ્યું હતું; ને તે ઉપર તે નજર નાખતા હતાં; રમાનાથ ઉતાવળમાં હતા; નોકરી પર જવાનો વખત થઈ જવા આવ્યો હતો. તેઓ કિવનાઈનના ડેઝની શીશી જ્યાંલાં શોધવા લાગ્યા. આ ઓારડીમાં, પેલી ઓારડીમાં, સૂવાના ખંડમાં, વાચનાલયમાં, બધે ય અટઅટ આંટા મારી આવ્યા; બાટલી ન જડી. રમાનાથ કહે : “જુઓ તો જરા, બાટલી કયાં હશે ? મને તો નથી જડતી.”

પુષ્પાએને રસોડામાં જતાં જતાં કહ્યું : “જરા ફરી વખત જુઓ ને ? હું કામમાં છું.”

રમાનાથ અધીરો થઈ ગયો હતો. ઉતાવળમાં બીજી વાર ચક્કર માયું ; એક બાટલી હાથ લાગી. રંભાને પરાણે મેં ઝડપી દવા રેડી.

રંભા કહે : “હાશ, આજ તો જરા યે કડલું ન લાગ્યું. આજ તો સોચારી યે નહિ ખાવું પડે ને પાણી યે નહિ પીવું પડે.”

રમાનાથ ચમક્યો : “અરે ! આ શું ! કિવનાઈન નહિ ? ત્યારે મેં શું ખાયું ?”

રમાનાથ વિચારમાં પદ્ધો ને ગલરાયો.

પુષ્પાયેન કહે : “ હ્યો હોડો હવે દવાખાને ! એટલી બધી શી ઉતાવળ હતી કે અટ અટ જે શીરી આવી તે ઉપાડી ? ”

રમાનાથને સામે ચિડાવાની નવરાશ ન હતી. તે તો દવાખાને હોડ્યો. પુષ્પાયેન ઉતાવળની નિંદા કરતાં બેઠાં, ને “ હાય, હાય ! હવે રંભાને શું થશે ? ” એમ રહવા લાગ્યાં.

“ કેમ, રમાનાથ ! હોડતા કેમ આવ્યા ? ”

“ બ્યારે આ શીરી તો જુઓ ? એમાં શી દવા છે ? ભૂલથી એકને બફલે આ અપાઈ છે.”

ડોકટર કહે : “ કોણે આપી ? ”

રમાનાથ કહે : “ મેં મારે હાથે આપી. ”

ડોકટર કહે : “ ઠીક, એ તો પછી પણ અટ દરકીને લાવો. દવાને જેઠને શું કરવું છે ? દરકીની સ્થિતિ જેવી જેઠશે. ”

રમાનાથ જોખે પગે હોડ્યો. વરસાદ વરસતો હતો, પણ હોડ્યો. દરકીને તેણને હોડતો હોડતો પાછો આવ્યો. મનમાં થતું હતું કે કોણું જાણે શું ચે થયું ને શું ચે થશે !

ડોકટરે રંભાને તપાસી. આંખો જેઠ; પેટ જેયું; હાથ, નખ, બધું જેયું. તેખાં નાખી દવા તપાસી જેઠ; રંગ જેયો, સ્વાદ જેયો, બધું જેયું.

ડોકટર કહે : “ બરાબર બરાબર નથી પડતી કે શી દવા છે; પણ જેર તો નથી જણ્ણાતું. દરકીને પણ કરી બરાબ અસર નથી. ”

રમાનાથને હાશ થયું; તેના મોં પર જરા હોંશ આવી.

ડોક્ટર કહે : “જુએઓ, રમાનાથ ! આ તો જણે થઈ ગયું. પણ તમારા જેવા ભણેલાને શો કપકો આપવો ? તમે એટલું પણ ન કરો કે દ્વારાની શીશી પર દરદીનું નામ રાખો ? તમે સમજુ છો, વાંચનાર છો, ભાષણ કરો છો, લેખ લખો છો ને આઠલી સાઢી વાત ન કરો ? પુષ્પાભેન પણ ભણેલાંગણેલાં છે; એ પણ એટલું ન કરે ? આ તો જણે ઠીક થયું; પણ આવામાં તો મરણ થાય ને બાળક હાથમાંથી જાય !

રમાનાથ શરમાઈ ગયા. ડોક્ટરનું કહેવું સાચું હતું.



[ ૫ ]

એટલો બધો કયા કામમાં હતો ?

ચંદ્ન તાવને લીધે પથારીમાં તરફડિયાં મારતી હતી. ૧૦૫ ડિચ્યી તાવ છે એમ સાંભળી એની બા ચિંતાથી જિલ્લી હતી શંકર પટાવાળો હોડતો હોડતો બરક લેવા જિપડી ગયો હતો. જીવનભાઈ દાક્ટરને બોલાવવા કચારના ગયા હતા.

ચંદ્નનું માથું દાખતાં દાખતાં હું મારા મનમાં ગણગણ્યો : “આ ચંદ્નને તાવ કેમે કરી જિતરતો જ નથી. એપાંચ દિવસ થાય છે ને આવીને જિલ્લો જ રહે છે. દ્વા તો કેટલા યે દિવસથી ચાલે છે પણ કારી ફાવતી નથી.”

ચંદ્ન ઝૂબ ગભરાતી હતી; માથા ઉપર હાથ પછાડતી હતી. તેના માથાનો ફુખાવો અત્યંત હતો. એની બા બોલી :

“ ઘરમાં છે કોઈ કાળજ રાખનાર ? રોજ એને દવાખાને  
લઈ જવી જોઈએ; આ દાક્તર નહિ તો બીજાને બતાવવી  
જોઈએ; અહીં નહિ તો બીજે ગામ જવું જોઈએ. પણ ચંદન-  
ની કચાં કોઈને પડી છે ? ”

મારા મનમાં ચંદન માટે હુઃખ થતું હતું, તેમાં તેની  
આએ વધારો કર્યો. ચંદન પણ અસ્વસ્થ હતી; તેમાં  
આ શર્ષફોએ અસ્વસ્થતા અને ગડખડ વધાર્યા સિવાય બીજું  
શું કર્યું હશે ?

ખરદું આવ્યો ને મેં તે ચંદનને માથે મૂક્યો. ચંદનને  
કંઈક ઠીક લાગતું હતું; તાવ જરા એછો થતો જતો હતો.

એટલામાં દાક્તર કાકા આવ્યા.

“ કેમ, ચંદનને વળી પાછો તાવ આવ્યો કે ? કેટલો  
છે ? ”

“ તમે ઉતારો લારે ના ? અત્યારે સાડાત્રણ છે. ”

“ તમારે દવા જ કચાં કરવી છે ? પાણીના દૂવા આપો  
છો; પણ એમ છે, કે કંઈક સારી દવા આપીએ તો કૃતી  
તાવ આવે જ નહિ ? ” ચંદનની બા દાક્તર પર જિતરી  
પદ્ધાં.

દાક્તર જાણે કે ઘરના જેવા હતા; ઘણું ધીરજવાળા  
હતા. જાણે કે કશું સાંભળતા ન હોય તેમ તે બોલ્યા :  
“ આજની ચંદનની દવા લાવો જોઈએ ? કેટલા ટંક પીધી  
છે ? ”

હું શીશી લેવા જિઝ્યો. પણ શીશી લાવું તે પહેલાં જ  
ચંદનની બા બોલી : “ દવા પીધી છે જ કોણે ? છેદકરી પણ

એવી છે કે દવા પીવાના કજિયા ! એ આવી છે એટલી ને એટલી પડી ! એક ટીપું યે પીધી નથી.”

ચંદને સાચે જ દવા પીધી ન હતી.

દાક્તર જરા બિનાઈને જોવ્યા : “ત્યારે તાવ કેમ અરુંકે ? આ આજની દવા તાવ અટકાવવાની હતી પણ ચંદને તો પીધી જ નથી ! પાવી હતી તો ખરી ?”

ચંદનની બા લભક્યાં : “ધરમાં કોણ છે જે દવા પાય ? હું આ ધરતું કામકાજ કરું, રસોઈ કરું, નાનાં છોકરાને નવડાવું—ધોવરાવું કે દવા પાઉ ? હવે તો હું હરવાળી છું, ને ચંદને તો માથું ફેરવી હીધું છે. દવા પીવી નહિ ને માંદાં પડવું !”

ડાયા દાક્તરે કહ્યું : “આપણે જરા બહાર એસીએ; ચંદનને ગડખડ થાય છે. ચંદન માટે આ દવા આળી છે તે પાઈ ઘો; હમણાં તાવ જિતરશો.”

મોઢું ચડાવીને એની બા ચંદન પાસે એઠાં, અને દાક્તર અને હું બહાર આવ્યા. દાક્તરે મને કહ્યું : “લલા માણસ ! ચંદનની બા તો એવાં છે, પણ તમે પણ એવા કેવા કે દવા પાવાની જ આળસ ! છોકરાં કાંઈ એની મેળે દવા થોડીક જ પીએ છે ?”

મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો : “પણ દાક્તર સાહેબ ! હું જરા કામમાં હતો.”

દાક્તર મિત્રભાવે ચિડાઈને જોવ્યા : “એટલા બધા તે ક્યા કામમાં હતા ? દિવસમાં ત્રણ વખત દવા પાવાની, એમાં તે કેટલાક કલાક જતા હશે ? કેટલુંક કામ જોઈ થઈ જતું

હશે ! એમ કહેને કે દવા પાવાનો સૌને કંઠાળો ને સૌને આગસ ! અને પછી ‘ દાક્તર દવા નથી આપતા, સારી દવા નથી આપતા, બીજે ગામ જવું જોઈએ .’ એવું બીજને માથે નાખી હવું ? તમારી બધાની - અને સમજુ છો છતાં આવી કુટેવ તે કેવી ? ”

હું સડક થઈ ગયો; કંઈ જ જોઈયો. નહિ. દાક્તર મારી શરમ જાણી ગયા તે ‘ સાહેબજી ’ કહી સૂચનાઓ આપીને વીર ગયા.

ચંદનનું માથું ચાંપતો ચાંપતો હું વિચાર કરવા લાગ્યો. વારંવાર હું જાતને પૂછવા લાગ્યો : “ એટલા બધા ક્યા કામમાં હતો ? સવારમાં જીઠીને છાપું વાંચ્યું એ એટલું બધું કામ કહેવાય ? છાપું વાંચી હાથે હજમત કરી ચા પીધી એ એટલું બધું કામ કહેવાય ? ચા પીને ટપાલ વાંચી એ એટલું બધું કામ કહેવાય ? ટપાલ વાંચીને મિત્રો આવ્યા તેમની સાથે ફડાકા માર્યા એ એટલું બધું કામ કહેવાય ? એમાં અગિયાર વાગી ગયા ને નવ વાગ્યાનો પહેલો ટંક દવા ન અપાઈ, તે શું એટલા બધા કામને કારણે ? અગિયાર વાગે જર્ઝ્યા ને જરા આરામ લીધ્યા; સાડા બારે જિઠયા ને જરા ચાપડી ફેરવી; એટલામાં બીજે ટંક ચાલ્યો ગયો. એટલા કામને કારણે બીજા ટંકની દવા રહી ગઈ ! અને ચંદન તો છોકરાં. કંડવું કિવનાઈન પીવું કેમ ગમે ? શું કામ દવાનું સંભારે ? અને એની બાને તો હું જાણું છું. દાક્તરને કેવું સંભળાવતી હતી ? બીજા ટંકની દવા અપાય તે પહેલાં તો તાવ આવ્યો ને ફોડાફોડ થઈ રહી. દાક્તર ખરું કહે છે કે મારો જ વાંક છે. દવા આપ્યા વિના સાંજ થવાની વાત

કરનાર મારો જ વાંક છે. એટા એટા એટલા બધાં કામમાં  
રહેનાર મારો જ વાંક છે ! ”

\*

[ ૬ ]

પણું એ મારું કયાં માને છે ?

એકવાર મા અને બાપ બંનેએ સાથે પોતાનાં બાળકો  
વિષે ફરિયાદ રજૂ કરી : “ બાળકો અમારું માનતાં નથી. ”  
બા કહે : “ મારું માનતાં નથી. ” બાપા કહે : “ મારું  
માનતાં નથી. આતું શું કરવું ? ”

મેં જવાબ આપ્યો : “ મારો તમને એક સામે સવાલ  
છે. તમે એકખીલનું માનો છો ? ”

માબાપો જખવાણું પડી ગયાં.

બા કહે : “ હું તો એતું માતું છું પણ એ કયાં મારું  
માને છે ? ”

બાપ કહે : “ મારું કહેવું પણ એ જ છે; હું એતું  
કહેવું માતું છું, પણ એ મારું કહેવું કયાં માને છે ? ”

મેં તુરત જ કહ્યું : “ આ સ્થિત જ તમારાં બાળકોને  
અનાજીંકિત કરે છે. ”

બાળકો ઘણાં જુદાં જુદાં કારણે અનાજીંકિત બને છે.  
તેમાંનું એક કારણ એ છે કે માબાપો ઘરમાં એકખીલાં  
એકખીલાંનું માનતાં નથી એવું બાળકોને હેખાયા કરે છે.

બાળકો નાનાં છે; તેમનો આદર્શ આપણે મોટાં છીએ. તેઓ આપણા પ્રમાણે આચરે તો હોથ કોનો ?

જે ખીપુરુષ હમેશાં એકખીલાંતું ન માનતાં હોય તો હુનિયા ચાલે જ નહિ. એકખીલાં એકખીલાંતું માને છે એમાંથી જ આ સંસાર ચાલે છે. પણ એટલું છે કે વારંવાર તેઓ અથડાઈ પડે છે. આ અથડામણુ પરસ્પર વધારે નજીક આવવા માટે પણ હોય છે; એકખીલાંનો વધારે મજબૂત સાથ અને ટેકો મેળવવા માટે પણ હોય છે. ઘણી વાર એક અથવા બીજાનું અજ્ઞાન, ટૂંકી ખુદ્ધિ, વગેરે કારણો પણ અથડામણુની પાછળ હોય છે. અથડામણુ એ સ્વાભાવિક છે; પણ તેનો ગેરવાલ બાળકોને ન મળવો જેઠાએ.

માબાપોના બધા વ્યવહારો બાળકોને જણાવવા જેઠાએ, એ બાળકેળવણીનું સૂત્ર નથી અગર સત્યની ઉપાસનાનું તરત્વ નથી. ઘણી બાબતો એવી છે કે ને બાળકો યથાકાળે જ જાણે. માબાપોની અથડામણુ પણ માબાપો જ જાણે; પોતાની અથડામણુ બાળકો ન જાણે એમ થવું જેઠાએ; અર્થાતું બાળકો સમક્ષ માબાપોએ ઉતાવળાં થઈ મતલેદને કારણે કે ગમે તે કારણે સામસામે લડી પડવું ન જેઠાએ, અગર એકખીલાંથી વિસુખ થઈ એસવું ન જેઠાએ, અગર એકખીલાંનો તિરસ્કાર કરી એકખીલાંને અનાજ્ઞાંકિત ન બનવું જેઠાએ કેમકે માબાપોના મનમાં જીમા થયેલા વિસંવાદનાં કારણો ઘેરાયેલા આકાશનાં વાદળાંની જેમ ગમે ત્યારે વીખાઈલય છે, અને આખરે તો પરસ્પરમાં રહેલો નિર્મળ આકાશ જેવો ગ્રેમ જીધડે છે; પણ બાળકો તો તેમને પેલાં વાદળાંના અંધકાર અને ગડગડાટથી જ એળાએ છે, અને તે રીતે તેમનો ન્યાય તોળે છે. આથી ઘણી વાર ગેરસમજણુને કારણે બાળકો મા-

ખાપો પ્રત્યેથી વિસુખ થાય છે, ધળી વાર તેમને ઘિજારતાં બને છે, અને તેમના પરત્વે અનાજ્ઞાંકિત બને છે. માભાપોએ પોતાની અથડામણું સાચવી લેવી એ ઢાંગ નથી પણ વાજભી-પણું છે. એમ સાચવતાં સાચવતાં કદાચ માભાપો એવી અથડામણુમાંથી મુક્ત પણ થઈ જશે. અર્થાતું બાળકો આગળ તો માભાપનાં જે સાચાં પ્રેમાળ અંતઃકરણું છે, જે શુદ્ધ આકાશ છે, તે જ આખરે આવવું જોઈએ-કારણું કે તે સત્ય છે, શાખત છે, જ્યારે વાદળાં તો ક્ષણિક છે.

\*

[ ૭ ]

એ તો રોયો નીલરો છે

: ૧ :

“ એકા ખાવા જોઠે છે કે ? આ ખાવાનું ઠરી જય છે. કયારની કહું છું તે સારતો નથી, રોયા ! ”

“ એ બાડી ! આ ઘડીએ આવ્યો આ એક છેલ્દો ખાડો ખાદવો છે. ”

“ એ તારો ખાડો ખાડામાં પડ્યો. જમવા જોઠે છે કે નહિ ? મારે તે એસી કયાં સુધી રહેવું ? ”

“ લે, આ આવ્યો બા ! આ ખાડો ખાદાઈ રહેવા આવ્યો છે. ”

“ હવે જોઠે છે કે નહિ ? નીકર આ એંડા હાથે આવીને ધઢ્યાડી નાખીશ. રોયા નીલરા ! કહી કહીને જીબના ઝૂચા વળી ગયા તો ય તે તારે તો ગગનમાં ગાજે છે ! ”

“ બાડી ! આ હાથ ધોઈને આવ્યો. ”

“ આ રોયા નીખરાનું કરવું શું ? ”

: ૨ :

“ આ છનકાને આજ એ સોટી મારો. ”

“ છે શું ? એલા છનકા ! આમ આવ જોઈએ. ”

“ એ માર્યાના જ લાગનો છે. આજ તો એ સોટી સાયાડો; એ વિના મારું નહિ માને. ”

“ પણ હતું શું ? ”

“ રોયો નીખરો થઈ ગયો છે. ”

“ પણ હવે પાણી લાવ; જરા તરસ લાગી છે. આ પાઘડી તો ઉતારવા હે ! ”

“ પાઘડી પછી ઉતારલે. એકવાર આ છનકાનું કરો. જુઓ કેવો ગરીબગોલો થઈને મિયાની મીંદડી જેમ જલો છે ! ”

“ એલા છનકા ! શું કણ્ણું ? ”

“ બાપુ ! કાંઈ નથી કણ્ણું. એ તો હું કોડીએ હાટવા રૂળિયામાં ખાડો ગાળતો તો. બાએ કણ્ણું કે જટ જમવા ચાલ; હરી જશે. મેં કહું, આ ખાડો ગાળીને આવું છું. ત્યાં તો ખા ખિંજાઈ ગઈ ! ”

“ જરાક ખમવું તું. એમાં કેટલી વાર ? ”

“ તે હું કચાં સુધી રસોડામાં એસી રહું ? ત્યાં ઉનાળામાં ચૂલા પાસે એસી જુઓ. તો ખબર પડે ! ”

“ તો જરાક ઢાંકી મૂકવું તું; ખાઈ લેત એની ભેણો. ”

“ પણ એમ તો બધું ઠરીને સાવ ઠીકરું થઈ જાય,  
એનું શું ? ”

છનકો કહે : “ પણ મને કચાં કોઈ દિવસ ભિનું ભાવે  
છે ? ”

“ જુઓ. સાંભળો છો. ને ? કેવો બરખરિયાં કરે છે ! હવે  
તો એને બદ્લે ચાર સોટી મારો. ”

: ૩ :

માએ છોકરાની હેખતાં ફરિયાદ ન કરી હોત તો ચાલી  
શકત. પોતાની સામેની ફરિયાદો ને ઠપકાએ સાંભળી  
બાળક નીલિનું નથી થતું ? ઓફિસમાંથી થાક્યા-પાક્યા  
આવનાર છોકરાના બાપને જરા મેડી ફરિયાદ કરી હોત  
તો સારું નહોતું ? નીલરો થઈ ગયેલો છોકરો એ સોટી  
ખવરાવવાથી કાંઈ થાડોક ઠેકાણે આવી જવાનો ? છોકરા માટે  
આવાનું ઢાંકીને બા રસોડામાંથી નીકળી ગઈ હોત તો ન  
ચાલી શકત ? અને પાછળથી બાળકને પાસે બેસાડી વહાલથી  
‘ આપણો આવાનો વખત તો ફ્લાણો ફ્લાણો છે.’ ‘ કોઈ  
મેડું આવ્યા કરે તો પછી આવાનું આજો દિવસ ચાલ્યા  
કરે અને બીજું કામ જ ન થાય.’ એમ બાળકને સમજાવની  
ન શકત ? અંગ્રેજુમાં કહેવત છે કે એક ઓંસની સમજાવટ  
એક શેર મારની બરાબર છે.

\*

સુમતિબાઈએ લક્ષ્મીખેનને કહ્યું : “ એન ! મારે આનું તે કરવું શું ? જ્યારે પાટલો નાખશે ત્યારે પછાડીને નાખશે. દસ વારમાં નવ વાર તો એમ કરશે જ કરશે. આ સવિતાથી તો કંટાળી ગઈ ! ”

લક્ષ્મીખેને પૂછ્યું : “ છે એન ! તે કોઈ વાર એને ધીમેથી, પછાડચા વિના પાટલો નાખવાનું કહું છે ? ”

સુમતિબાઈએ જવાબ આપ્યો : “ એક વાર નહિ પણ અનેક વાર કહું છે. જ્યારે જ્યારે પાટલો પછાડાય છે ત્યારે ત્યારે કહેલું જ છે. ”

“ પણ એન ! કોઈ એકાદ વાર જ્યારે પાટલો ધીમેથી મૂકે છે ત્યારે તે કહેલું છે કે ‘ હા, આજ તો ઠીક થયું ને પાટલો ધીમેથી નાખ્યો ! ’ ”

“ ના, બા ! એમ તો નથી કહું. ને એમ તે શાનું કહે ? કોઈવાર ભૂલેચૂકે ધીમેથી પાટલો નાખે એમાં શું વળ્યું ? ”

“ નહિ એન ! તું ભૂલે છે. તું જ ભૂલે છે એમ નહિ, પણ આપણે સૌ ભૂલીએ છીએ. બાળકોથી જે ભૂલ થઈ જય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન એંચ્યા કરીએ છીએ; ને તે એટલી બધી વાર એંચ્યા કરીએ છીએ, કે બાળકની એવી માન્યતા થઈ જય છે કે ચોટે ભૂલ જ કરે છે ને બીજું તેનાથી કશું બનવાનું જ નથી ! આવી માનસિક સ્થિતિ થતાં બાળક વધારે ને વધારે ભૂલો કરે છે ને વધારે ને વધારે ઠપકો ખાય છે. ખરી રીતે બાળકો જેમ ભૂલો કરે

છે તેમ ઘણી વાર તે ભૂલો નથી પણ કરતાં. ઘણી વાર તેઓ સારું સારું કરી બેસે છે. પણ જે સારું બને છે તેને આપણે હિસાબ કેતાં જ નથી; તે તરફ જેતાં જ નથી. તેમના દ્વારે કાઢવા તત્પર હોઈએ છીએ પરંતુ તેમના શુણોથી રાજુ થતાં નથી; તે તરફ તેમનું ધ્યાન એંચી તેમને શુણપ્રિય કરતાં નથી. સવિતા દસ વારમાં એક વાર તો સારી રીતે પાઠવો દળે છે, ખરું? તો પછી તે જ વખતે તેને કહેવું: ‘હં, જે એન! આજે પાઠવો કેવો સરસ દાળયો! આમજરોજ દાળતી હોતો કેવું સારું?’ અને ખરેખર સવિતા તેથી પ્રસન્ન થશે. તેના શુણું તરફ તેનું લક્ષ જરો. તે શુણુંને કેળવવા તે પ્રયત્ન કરશે. અને એને લીધે અણુઆવડતની જગાએ આવડત આવીને જલ્દી રહેશે. બાળકોમાં જે સારું હોય તેથી આપણે ચોંચ કદર - નહિ કે વખાણ - કરીએ તો સારું વધતું જ જરો. પણ જે તેમાં જે અચોંચ હોય તે ઉપર જ લાર હીધા કરશું, તે માટે ઠપકો હીધા કરશું, તેને સીધી રીતે કાઢવા લડશું, તો તે ઘર કરી બેસશે.”

સુમતિખાધિએ કહ્યું: “લક્ષ્મીએન! તમારી વાત ગળે તો જિતરે છે. જેઓ, હવે એ પ્રમાણે કરી જોઈશ જોઈએ શું થાય છે!”



અમારા ઘર સામે એક ખવાસનું ઘર હતું. માણીકરો સાથે રહે; મા કોથી અને હીકરો દારૂદિયે. હીકરો રાતે દારૂ પીને આવે; મા ચિડાઈ જાય. હીકરો ગોળો પાણી પીવા જાય. માના મનમાં થાય કે હીકરો દારૂના નશામાં ગોળો ક્રોડશે. પોતે ન આપે પાણી કે ન તેને હળવેથી કહે કે “ લાઈ ! સાચવીને વે. ” પણ કહે : “ આવ્યો મારો રોચો ! એ હમણું ગોળો ક્રોડશે ! ” હીકરો ગાળ સાંલળે ને ઉર્કેરાય અને તરત જ ધડ હઈને ગોળો ક્રોડી નાખે. ગોળો ક્રોડચા પછી મા કહેતી નથી કે “ હશે બા ! સૂઈ જ. ” એ તો વધારે ચિડાઈને ઓવે છે : “ લે હવે તો મારો રોચો કાચનાં વાસણુ ક્રોડશે. ” ત્યારે તો ધડ ધડ અભરાઈ ઉપરથી કાચનાં વાસણુ પડ્યાં જ છે ! મા તો કહે : “ રોચો ! આ મને ય મારશે કયાંક લાકડી લઈને મારે નહિ ? ” ત્યાં તો ડેશી ઉપર ધડ ધડ એ ધા થયા જ છે !

બાળકો દારૂ પીધેલાં નથી; પણ ધણી વાર માતાઓની વાણુ ઉપરની માના જેવી હોય છે. તેના શખ્ફો જ બાળકને ભૂલ તરફ લઈ જનારા હોય છે. બાળકની એક ભૂલ થાય છે ત્યારે આપણુ જ તેને બીજા શખ્ફથી બીજુ ભૂલમાં એંચીએ છીએ, ને એમ આપણી મારકૃત જ બાળક ભૂલની પરંપરામાં ઉત્તરે છે.

બાળક હાથમાં લાકડી લઈને ક્રતું હોય તો માતા ઓલી જોઈ છે : “ એ હમણું ગોળો ક્રોડશે કે ખ્યાલો ક્રોડશે ! ” પછી કહે છે : “ એ હમણું લાઈને મારશે. ” બાળક ગોળા

ઉપર લાકડી મારવા કે ભાઇને મારવા હોડે છે. માતા ઉશ્કે-  
રાય છે ને સાથે પોતાની વાણીથી બાળકને ઉશ્કેરે છે.

“ ‘એ હુમણું રહશે.’ ” “ ‘એ તો કજિયો કરશે.’ ” “ ‘હુઠ  
લેશે.’ ” “ ‘તેડી લેવાનું કહેશે.’ ” “ ‘આવાનું માગશે.’ ” વગેરે  
અનેક વાક્યો આપણે જ પહેલાં કહીને બાળકે શું કરવું તે  
તેને સૂચયવીએ છીએ. બાળક ઉશ્કેરાય છે ને તેમ કરવાની  
લતમાં જાય છે. એક ભૂલ થઈ એટલે ભૂલ અટકે એવો રસ્તો  
તેને બતાવવાને બદલે જિલદું તે ભૂલને માર્ગે જાય તેવો  
ઓલ એલીએ છીએ. પરિણામે બાળક એટે રસ્તે ચડીને પેલી  
ડાશીના ફીકરાની પેઢે નુકસાન કરવામાં અથવા કજિયો  
કરવામાં આગળ વધે છે.

આ બાબતમાં માખાપોએ વિચાર કરવાનો છે. જરાક  
સાવધાન રહી પોતે ને બાબે છે તે પોતે સાંભળશે, તો  
પેલી ડાશી અને ફીકરાની વાત તેને જરૂર યાદ આવશે.

\*

[ ૧૦ ]

માનતો નથી તે ભરી જધશ ?

: ૧ :

મા રોજ કહેતી : “ મારા રોયા ! મારું માનતો નથી  
તે કોણ હીનો ભરી જવાનો છે.”

પણ છોકરે જાધી જોપરીનો. રોજ નિતનવા હાલા હલવે.  
કોઈથી ઉરે તો કે ? આખું ગામ જિચું લે એવો.

ગામ બહાર તળાવ હતું. મા રોજ કહે : “રોયા ! ત્યાં જઈશ મા. જેણે, મારું કલ્યું ન કર્યું” તો તારી કાકી ખાઈ જવી છે ! ત્યાં મોટી મગર રહે છે.”

પણ છોકરો કયાં બીજે એવે હતો ? એ કહેતો : “ચાલ ને, જેવું તો ખરો કે મગર કાકી કેવી છે !”

છોકરો કહે : “મા ! પાણી પા ને ?”

“જસો રહે; ધાડ શી આવી છે ?”

“મા ! પાણી આપ ને ?”

“લઈ દે ને; તારા હાથપગ લાંગી ગયા છે ?”

છોકરો કહે : “ત્યારે હું તો મારે આ ચાલ્યો. તળાવે જઈને પાણી પીશા.”

છોકરો ચાલી નીકળ્યો.

મા કહે : “એ રોયા ! પાછો વળ, પાછો વળ ! આ મારું કહેવું નથી માનતો તે ભરી જવો છે.”

છોકરાને તો મગર જેવી હતી. કાંઠે જઈને પાણી પીવા જય ત્યાં તો મગરે બહાર નીકળીને એનો પગ પકુછ્યો. છોકરાના શા ભાર ? મગર તો છોકરાને ગળી ગઈ.

મા તો ફૂરથી જેઈ રહી. પણ મગર રહે ત્યાં જય શી રીતે ?

એ તો રોવા ને કકળવા લાગી. આડોશીપાડોશી લેગાં થયાં. બધાં કહે : “ના નોંતી પાડવી ? ત્યાં શું દાંટલું હતું તે જવા દીધો ?”

મા કહે : “ અરે બાઈ ! મેં તો ધર્ણી ચે ના પાડી. ના કહીને તો જુભના કૂચા વળી ગયા. પણ રોચે. માને એવો કયાં છે ? આ લ્યો, માભાનું ન માને તો આમ જ થાય ના ? ”

પાડોશીએ. કહે : “ હા બાપુ ! રોચાં આજકાલનાં છોકરાં જ એવાં થઈ ગયાં છે. માભાપનું તો માને જ શાનાં ? ને પછી આવા જ હાલ થાય ના ? ”

છોકરો તો મગરના પેટમાં ગયો. પણ કાંઈ કાચો ન હતો. કેઢે છરી તે કાહીને મગરનું પેટ કાપ્યું ને ભાઈસાહેબ બહાર નીકળ્યા ! દોડતો દોડતો ઘેર આવ્યો ને માને કહે : “ કા, કહેતી'તી ને કે માનતો નથી તે મરી જઈશ ? ”

: ૨ :

આફુકામાં ચાલતી એ એક વાર્તા છે. વાર્તા સાવ ખોટી છે. પણ તેમાં રહસ્ય છે. આપણે ત્યાંના દાખલા લઈએ. છોકરો કહે છે : “ બા ! મારે નિસરણીએ ચડવું છે. ” બા કહે છે : “ નથી ચડવું. ” છોકરો માનું કહેવું માનતો નથી ને ચડવા લાગે છે. મા કહે છે : “ રોચા ! પડી જઈશ, હો ! ” છોકરો ચડીને પાછો જતરે છે, ને કહે છે : કા, કહેતી'તી ને કે પડી જઈશ ? ”

નાનું બાળક કહે છે : “ બા ! હું પાટલી લાવું ? હુંધની ટખૂડી લાવું ? ઇલાણું લાવું ? ઇલાણું લાવું ? ” બા કહેશે : “ ના, નથી લાવવું, તારા હાથમાંથી પડી જય. ” બાળક કહે છે : “ ના, હું તો લાવીશ. ” “ રહેવા હે, બાઈ ! પડી જઈશ ને પગ ભાંગશે. ”

‘હા’ ‘ના’ આલુ હોય છે એટલામાં બાળક વસ્તુ લાવે છે ને કહે છે : “કાં, કહેતી તી ને કે પગ લાંગશે ? પગ તો કાંઈ ન લાંગ્યો.”

આલું હમેશાં ઘરેામાં બન્યા જ કરે છે. મા ‘ના’ કહે છે; છોકરો કરવા જાય છે. મા ‘ના’નું કારણ બતાવે છે; છોકરો તે જોટું પાડી બતાવે છે. માને લાગે છે કે છોકરું કહેવું માનતું નથી ને બાંગરું થઈ ગયું છે. છોકરાને થાય છે કે મા નકામી ના પાડે છે ને વળી જોટું સમજાવે છે. મા કહે છે કે ‘આમ થશે ને તેમ થશે.’ છોકરું સિદ્ધ કરે છે કે ‘તેમ ન થયું.’ મા છોકરાને કામ કરતું રોકવા જાય છે; છોકરું માને કામ કરી પાછી પાડે છે. પરિણામે માને ના કદ્યા કરવાની અને છોકરાને ન માનવાની ટેવ પડે છે.

આપણું આપણું કહેવું મનાવવાનો અજખ જેવો શોખ છે. એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ, મારીએ છીએ. વખતે વખતે લાલચ આપીએ છીએ. કહેવું ન માનનારના આ હાલ થયા ને તે હાલ થયા, એવી ‘માણી અને તેનું બચ્યું’ની વાર્તાએ કહીને તેના ઉપર ઠસાવવા માગીએ છીએ કે બાળકે મોટાનું માનવું જ જેઠાએ; જે ન માને તો પાપ થાય, નહીં તાણી જાય, અથવા જીના ઉનામણ્ણામાં પડીને મરી જાય, કે તેને ભગર ખાઈ જાય. પરંતુ ‘ના’ની ઉપર વટ થઈને કામ કરતું બાળક તુરત જ શોધી કાઢે છે કે માણાપનું કહેવું સાવ બનાવઠી છે. કદ્દાચ માણાપના કહેવા પ્રમાણે થાય છે તો ત્યાં પણ બાળક પોતાના અનુભવથી સમજ શકે છે કે આ તો પોતાને ચાલતાં ન આવડયું તેથી પડાયું, નહિં કે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું.

માટે તેમ થયું. કોઈ કોઈ બાળક આવે વખતે એમ પણ માને છે કે બાનું કહેવું ન માન્યું માટે પડયું. પણ આ માન્યતા લાગે વખત ન રકી શકે. કહાચ ટકે તો બાળકમાં કાર્યકારણને ઓઠી રીતે જેડવાની પદ્ધતિ ઊસી થાય; માભાપનું ન માનવાથી કંઈક નુકસાન થાય જ એવો વહેમ પેસે. અને વહેમ એટલે બુદ્ધિનો અંધકાર !

બાળકોને આપણે ઓઠી રીતે સમજવવાં નહિ જેઠાચે. એમ કરવાથી તેમનામાં અશ્રદ્ધા ને અનાજ્ઞાંકિતપણું આપણે જ હાખલ કરીએ છીએ. જ્યાં બાળકના ખરેખરા સંરક્ષણ માટે ચોગ્ય રુકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાં જ 'ના' પાડીએ. અને ના પાડી સીધી રુકાવટ સાથે બાળક સમજ શકે ત્યાં સુધી ખરાબર સાચેસાચાં કારણોં બાળકને આપીએ. છેક નાનાં બાળકો પણ ધીરેથી તેઓ સમજે તેવાં કારણો આપીએ તો સમજુ શકે છે.

છોકરે માનું કહ્યું ન માન્યું માટે મરી ગયો. એવું આપણા લોક-કેળવણીકારો આવી જાતની વાર્તાએ ક્ષારા બતાવે છે. આદ્રિકાના લોક-કેળવણીકારો ઉક્ત વાર્તા ક્ષારા માને એવું શિક્ષણ આપતા હેખાય છે કે માએ એવી રીતે 'ના' પાડીને બાળકને જ્યાંત્યારી જતું રોકવું નહિ !

થોડાએક વખત પહેલાં અમે નાનાં બાળકોને લઈને એક નહીંએ નાહવા ગયેલાં. બાલમંદિરનાં ઘણ્ણાં બાળકો આવ્યાં હતાં.

નહીનું પાણી ખળખળ વહી જતું હતું. નાનાં બાળકો ગોડણુસમા પાણીમાં નાહી રહ્યાં હતા; સામસામે પાણી ઉડાડી હસતાં હતાં; ચતાં પડી આકાશની સામે જેઈ રહ્યાં હતાં; કેઈ કોઈ માછલી જેમ પાણીમાં તણુતાં હતાં. બાળકોની સુંદર જલકીડા ચાલી રહી હતી.

હું ત્યાંથી નીકળ્યો. એક ભાઈ કાઠે જિલ્લા જિલ્લા આ બધું જેતા હતા. મેં તેને પૂછ્યું :

“કેમ ભાઈ ! નાહી લીધું ?”

“ના.”

મેં કહ્યું : “ચાલો ત્યારે નાહીએ.”

તે રડવા લાગ્યા ને યોદ્યા : “પણ મારી બાએ નાહવાની ના પાડી છે.

“શું કામ ?”

મેં ધણો આગ્રહ કર્યો પણ તે ભાઈ નાહવા ન પડ્યા. હું વિચાર કરવા લાગ્યો :

“શા માટે બાએ ના પાડી હશે ?”

મને લાગ્યું માને બાળક જોઈનું કે બહુ પ્રિય હશે; ને સાથે જ તેને થયું હશે કે રખે ને મારો હીકરો પાણીમાં પડે ને દૂધીને તણુાઈ જાય!

એશક અહીં માનો તો પુત્ર પ્રત્યે પ્રેમ જ છે; તેની સાચવણું માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે. અને ખરેખર બાળક પાણીમાં પડ્યા વિના ઘેર પહોંચશે એટલે માને તો પોતાની શખામણું આપીને મેઠલવાની કે મનાઈહુકુમ કાઢવાની રીતમાં વધારે વિકાસ એસશે. પણ આ તો માતાની દસ્તિએ.

બાળકની દશ્ભિંદી માતાનો જે આ પ્રેમ છે તેની પાછળ ઝડપની લાગણી છે તેનો ધનકાર ન કરી શકાય. છતાં એમાં અજ્ઞાન છે અગર તો પ્રેમની લાગણીની વિકૃતિ છે. માના મનમાં સહજ હોય છે કે પોતાનું બાળક સુરક્ષિત રહે; પણ એ સાથે જ માનું મન માગે છે ને માગવું જ જેદું કે મારું બાળક શરીર, મન અને સર્વ શક્તિઓમાં વિકાસ પામે. બાળક પરતવેનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તો તે માતૃપ્રેમ નથી પણ માતૃસ્વાર્થ છે. બાળકને કરી ધન થાય એ જેવા મા ન માગે; પણ સાથે જ બાળક નિષ્ઠિક્ય અને અશક્તા રહે તેની ચિંતા મા ન રાખે તો માની બુદ્ધિ અને લાગણી અણુવિકસી અને અંધ ગણ્યાય.

ધારો કે પેલા લાઈ વીશ વર્ધની ઉંમરે તરતાં ન આવડવાને કારણે જ એકાદ પૂરમાં તણુાઈ જાય છે, જ્યારે તેના સાથીએ નહીંમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતાં શીજ્યા છે તેથી તેએ બચી જાય છે. તે વખતે આ માતાના મનને શું થશે? તે કપાળ કૂઠી કહેશે: “અરે, હું કેવી

દૂંકી મતિની કે મારા બાળકને મેં પોતે જ શક્તિમાન થતું અટકાવ્યું ? મેં પોતે જ તેના હાથ-પગ કાપી નાખ્યા, અગર ખાંધી રાખ્યા ? ”

અતિકાળજી રાખનારી માતાઓનાં બાળકો સંબંધે આવું જ બને છે; ને બનવું સહજ છે. બાળકનો મૂળ સ્વભાવ સવય પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ શુભચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધું પોતે કરે છે અગર કરાવી હે છે, ત્યારે બાળક અંકિય રહી સડે છે. તેની શક્તિનો થનગનાટ થોડા વખત જાણી પાણો પડે છે. તેનું પોતાનું વ્યક્તિત્વ વારવાર રડી રડીને પછાયા પછી ટાહું પડે છે ને આખરે બાળક હતાશ થઈ અશક્તિને માર્ગ જાય છે. ધીરે ધીરે તે પોતાની જ જાતમાં વિશ્વાસ એઠ નાખે છે તેને મા એકજ સર્વજ અને સર્વશક્તિમાન લાગે છે; તેનો જોલ એકજ શાસ્ત્રવચન થઈ પડે છે. પોતે વિચાર અને કિયા એઠ એઠલું છે. તે વારવાર માને પૂછે છે : “ આ કરું ? પેલું કરું ? ” માની ‘ હા, ના ’ ઉપર તે રહે છે. તેનામાં પોતાપણું કશું રહેતું જ નથી. લોકો તેને ‘ માભાઈ ’ કે ‘ માવડિયો ’ કહે છે, અને પાછળથી તે જ ‘ માવડિયાને ’ મા કહે છે : “ રોચા ! આવો નમાલો કયાંથી થચો ? રોચા ! બહુ સાચવીને રાખ્યો તે બગડી ગયો ? ” વગેરે પણ પાછળથી આ બધું રાંડચા પણીના ડહાપણ જેવું રહે છે.

માને બાળકની ચિંતા રહેવી જ જેઠાંએ. પણ તે ચિંતા બાળકને સહૈવ ઉપકારક થાય તેવી જેઠાંએ. તે ચિંતા કદિપત ન જેઠાંએ; તે ચિંતા અકારણ ન હોવી જેઠાંએ.

માએ બાળકને એમ કહેવું જોઈતું હતું કે “બાપુ ! તારા શિક્ષક કહે ત્યાં નાહજે. સૌ નાહતાં હોય ત્યાં નાહજે; રજ વિના આટલા પાણીની પેદી બાજુ ન જતો.”

અને માએ શિક્ષકને પોતાના બાળક પરતે ભલામણું કરવી હતી. બાળકને લઈ જનાર ઉપર ભલે આપણો પૂર્ણ વિશ્વાસ હોય છતાં માનું મન ભલામણ કર્યો વિના નથી રહેવાનું; માટે ભલામણ અવશ્ય થાય. પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સોપેલ હોય તેના ઉપર અને સર્વથી મોટા શુરૂ ભગવાન ઉપર ભરોસો રાખતાં શીખવું જોઈએ.

ઘડી માતાઓના મનમાં હમેશાં એવું હોતું નથી કે કોઈનો ભરોસો જ ન કરવો. કોઈનો માતૃપ્રેમ ભરોસા પર નલતો હોય છે, છતાં બાળક સંબંધે બેઝિકર નથી રહી શકતો; પણ એ લાગણીની કોમળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણું કરવી પડે. અને એ કઠણું થયેલી કોમળતા જ ઘરી લાગણી છે—સમતોલ લાગણી છે, એમ સમજવું પડે. ઘરી માતાએ પોતાનાં બાળકને આવી નખળી લાગણીને લીધે નખળાં રાખે છે, ને આખરે તેમને ગુમાવે છે.

જ્યારે પેલા ભાઈના ગોઠિયાએ નહીમાં નાહીને મન કરતા હતા, પાણીના પ્રથમ પરિચયનો આનંદ લેતા હતા, તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મ-વિશ્વાસ ને સ્વાતંત્ર્ય અનુભવતા હતા, ત્યારે આ ભાઈ કાંઠે જીભા જીભા રોતા હતા ! કારણુંકે પોતાને નાહવું હતું પણ માનો મનાઈહુકમ હતો. પોતે વિકસવાને બદલે અયક્યા હતા; પોતે માની આજાને લીધે જીવંત મરી પથ્યર થઈ ગયા હતા. માએ તેને આવી ના ન પાડી હોત તો ?

પેલા ખીજ બાળકો વૈર જઈ માને અને બાપાને કહેશે : “ અમે તો આમ નાદ્યા ને તેમ નાદ્યા. અમને તરતાં આવડયું. અમે પાણીમાં દૂષકી ખાતા હતા. અને પાણી ઉડાડતા હતા ! ” બા અને બાપાને તે સાંભળી આનંદ થવાનો.

હવે આ ભાઈ વૈર જઈને શું કહેશે ? મા પૂછશે : “ પાણીમાં નાદ્યો તો નહોતો ના ? ” બાળક કહેશે : “ ના. ” પરંતુ તેને પેલી નહી વગેરે ચાદ આવશે લારે તો તે રહી પડશે. તે કહેશે : “ તેં મને નાહવાની ના પાડી તી ! ”

મા જીલટી વઠશે ને કહેશે : “ શું કામ રડે છે ? ન નાદ્યો એ જ સારું કર્યું. મારું માન્યું તો કેવો ડાદ્યો કહેવાય ! એ તો કોઈ તણુાઈ ન ગયું, પણ વખતે તણુાઈ ગયું હોત તો ? ”

બાળક માતાની અરી ફ્લીલમાં પાછો સપડાશે. રડવાનું સમાધાન થશે. તે કહેશે : “ હાશ ! ઠીક થયું. દૂષી તો ન ગયો ! ”

તે મોટો થશે; કઢી દૂષી જશે જ નહિ. તે પોતાનાં બાળકોને પણ પાણીમાં જવા હેશે જ નહિ; કારણુંકે તે દૂષી જાય !



હું એક ભિત્રને ત્યાં બેઠો હતો. નાના બાળકનું ઉપરાણું લેતાં એમના માતુશ્રી અમારી પાસે આવ્યાં ને કહ્યું : “ આ આવ્યા લખુને ધમકાવનો. આપણી નાનીને એવી રીતે હોડાવી કે એ પડી જત ને એને લાગત. ”

ભિત્ર સમજુ હતા. માતુશ્રીના કોથને જોઈ લીધો, નાનીની આંખમાંનો ફરિયાદનો જુસ્સો પણ જોઈ લીધો, ને ધીરથી હસીને કહ્યું : “ પણ લાગ્યું તો નથી ના ? બસ; હવે પત્યું ? ” માતુશ્રી ચિડાયાં : “ પણ લાગી જત તો ? હાથ-પગ લાગી જત ના ? આપણે એ ન ચાલો. લખુને લાડકો હોય તો એના ધરનો ! ”

ભિત્રે વળી હસીને કહ્યું : “ પણ લાગ્યું તો નથી ના ? ”

“ પણ લાગત એનું શું ? ” માતુશ્રી વધારે ચિડાયાં અને બબડતાં ચાલ્યાં ગયાં. “ આવવા હે લખુડાને કાલે અહીં. હું જ એને ધઘલાવીશ ! ”

મારા ભિત્રનું વર્તન ચોણ્ય હતું; એમ જ જોઈએ. “ ફ્લાણું આમ થઈ જત. ” તે ઉપર લડવું વઢવું એ કેટલું મૂર્ખોઈ લરેલું છે, એ પણ આપણુને સ્પષ્ટ નથી. એ બાળકો વચ્ચે આવા કોઈ ગ્રસંગો બને છે કે તુરત જ આપણે “ આમ થાત, આમ થાત, આમ થાત. ” એમ કહીને પોકાર કરી જઠીએ છીએ, બળાપો કરીએ છીએ, ને પરસપર વચ્ચે કલહનું ધીજ રોપીએ છીએ. અને ખરેખર, આવાં નજીવાં કારણો માટે જ ધણાં પાડેશીએ. લડતાં જેવામાં આવે છે.

આ જતની ટેવ આપણી વસ્તુ જેવા પરતવેની દિશમાં જે ક્રેક છે તેનું ક્રેણ છે. આપણે માટાંએ જીવનમાં “આમ થાય તો ? આમ થાય તો ? અરે, આમ થઈ જાય આમ થઈ જાય !” વગેરેની કદ્વના કરીને હુલકી જઠીએ છીએ; ને ખરેખર વાસ્તવિક હુઃખ નથી હોતું ત્યાં હુઃખ અનુભવીએ છીએ. એમાંથી આપણે “આમ થાત” ને જાય લીધી છે. એ હમેશાની પ્રકૃતિ કંજિયાનું કારણું છે. પણ જે આપણામાં ચોખખી બુદ્ધિથી જેવાનું ડહાપણ હોય તો આપણે એમ વિચારીએ કે “આમ ન થયું તે જ સાંદું થયું. લાગ્યું નહિ તે જ કાયદો થયો. દીવાસળી સળગી પણ આગ ન થઈ એ જ મોટો લાલ થયો. ભૂલથી છરી પર પગ આવ્યો. પણ લાગી નહિ એ જ મોટું હાંસલ થયું. ધા લાગ્યો. નહિ ને બાજુ પર પડ્યો એ જ લાલમાં લેખ્યું.”

એ બાજુમાંથી આપણે સારી બાજુ-સવળી બાજુ જેઠાએ તો સુખી થઈએ. બાળકોનાં ઉપરાણું લઈ “આમ થાત” કહીને લડવા ન જઈએ.

એશક આનો અર્થ એમ નથી કે ગમે તેમ થવા હેવા માટે આપણે એદરકાર રહેલું, અથવા થવાનો સંભવ હોય ત્યાં ફૂરંદેશી ન વાપરવી. વાત ‘થવા હેવા’ના નથી; થયા પછી ચોંય ઉપાય તો લેવો જ જેઠાએ. થઈ ન એસે તેની ચિત્તા-કાળજી રાખવી જેઠાએ. પણ થયું ન હોય છતાં થાત તેનો જાય અને ચિત્તા કરીને ન તો આપણે હુઃખી થવું, અથવા બાળકો કે માબાપો સાથે લડવું.



નાનુ' છોકરુ' પોતાનામાં શક્તિ આવી છે એની ખાતરી રાખી તપેલુ' લઈને માને દેવા જય છે. મા કહે છે : " મૂકી હે; તારથી નહિ લેવાય. "

છોકરે મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી એ પગથિયાં પછી ત્રીજે પગથિયે ચડવા જય છે ત્યાં બાપ કહે છે : " હેઠો જિતર; હજુ ચડવા જેવડો નથી. પડીશ તો હાડકાં રંગાઈ જશો. "

છોકરુ' પોતાની આંગળીની સંભાળ રાખીને શાક સુધારે છે કે પેનિસલની અણી કાઢે છે. બાપ બિનાઈને કહે છે : " છરી હેઠે મૂકી હે; નાને પંડે નાનો ને મોટાંનું કામ કરવા જય છે ? "

છોકરુ' કહે છે : " હુ' તો હવે આવડો મોટો ખાડો ટપી જઉ. હવે તો હુ' આવડો મોટો પથરો ઉપાડુ'. " ઘરમાંથી કોઈ કહેશે : " બાપુ ! મકોડાની કડ સંભાળજો. "

બારણુ' ન જિધડતુ' હોય ને છોકરુ' કહેશે : " લાવો હુ' ઉધાડી દઉ. " બધાં એને લોંહુ' પાડીને કહેશે : " કાઈ છોકરથી તે છાશ પિવાતી હશે ? "

મોટાંએ કોઈ સુશકેલીના પ્રસંગે કોઈ ગુંચ ઉકેલતાં હોય છે એટલામાં છોકરુ' આવીને પોતાની દણિએ કંઈક માર્ગ બતાવવા જોવે છે. બધાં કહે છે : " આ જોને, કુંભાર કરતાં ગઘેડાં ડાદ્યાં ! "

છોકરી હાળશાક વધારવા માગે. બા કહેશે : “હાજી જઈશા.” છોકરી કહેશે : “ચાખા સમા કરવા આપો.” બા કહેશે : “ટોળી નાખીશ; આવડે નહિં.”

આમ ને આમ કહીને આપણે બાળકમાં તેની જત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ. બાળકો અમુક વખતે અમુક કામ શીખવા માગે છે. તે વખતનો તેમનો ઉત્સાહ જખખર હોય છે. નવું જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે, ને તેથી તેઓ પોતાનું કામ પૂરેપૂરી એકાચરતાથી કરે છે. તે વખતે તેઓ જતને સંભાળવાની કાળજી રાખી શકે છે; તે વખતે અમુક આમ થાય અને અમુક તેમ થાય એમ બતાવવામાં આવે છે તો તેઓ ભૂલ ન થાય માટે અસાધારણું ચિંતા રાખીને કામ બનાવે છે. તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હોવાથી તેમના ચહેરા ઉપર આનંદ હોય છે; શરીરમાં ચેતન હોય છે. પ્રત્યેક પળે તેઓ જેમ જેમ કામ કરતાં જાય છે, તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતો જાય છે. એ વધેલા વિશ્વાસને લીધે આપણું તે કહે છે : “કરી શકીશ; મને કરવા ધો. મને આવડે છે !” અને જે કરવા નથી હેતાં તો ધણી વાર કળિયા કરે છે, ને માર પણ ખાય છે.

પણ વારંવાર ના પાડવાથી અને નહિં થાય એમ કહેવાથી બાળક પોતાની જતમાં વિશ્વાસ એઈ એસે છે. પછીથી પોતે કામ કરતાં જ ડરે છે. કામ કરવા જતાં માબાપનું વચ્ચે તેને સાંભરે છે ન તે મૂકી હે છે. પોતે એમ જ માને છે કે ચાઙ્ગસ પોતાથી નહિં થાય. તેને જે કોઈ કહે છે : “પાટલો લાવ ને ?” તો તે ના પાડે છે. પરાણે જિપડાવે છે તો પાટલો પડી જાય છે. લ્યારે રડે છે. કારણ પૂછતાં

જણાય છે કે તે એમ માને છે કે “પોતાથી તે ન બની શકે. પોતે કેમ કરી શકે ?”

મારા અનુભવમાં આવા ઘણા હાખલાચો આવ્યા છે. તેમાંને એક બસ થશે. ચંહુભાઈની માચે એનામાં અવિશ્વાસનું ધનજોઝશન કરેલું. તેને મેં કહ્યું : “ભાઈ ! ચાલો આ પુલ ઉપર.”

તે કહે : “મારાથી નહિ અવાય. દૂધી જાઉ.”

મેં કહ્યું : “કોણું કહે છે ?”

“મારી બા કહેતી હતી.”

“ચંહુભાઈ ! પેલો પથરો લાવો.”

“હું નહિ લાવું.”

“કેમ ?”

“મારાથી નહિ જાપડે.”

“કેમ જાણ્યું ?”

“મારી બા કહે છે કે મારાથી ન જાપડે.”

“પણ હું કહું છું કે જાપડશે. ચાલો, આપણે ઉપાડી જોઈએ.”

છેવટે મેં એની સાથે રહી એ કામ થઈ શકે છે એવી તેને ખાતરી કરાવી ત્યારે તે હરયો ને પછી વિચારમાં પડ્યો.

તે દિવસથી તે છોકરામાં ઘણો ફેરફાર થયો. ગંધેવી શ્રદ્ધાનું કિરણું તેનામાં ફરી વાર પ્રગટ્યું.

આપણે બાળકેમાં અશ્રદ્ધા પેઢા કરી તેમને અશક્ત કરી નાખીએ છીએ. ખરી રીતે બાળકેમાં આપણો અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણું પોતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે.

આપણે બાળકોમાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઈએ.  
થોડી પણ શ્રદ્ધા રાખશું તો જરૂર તેઓ આપણને ખાતરી કરી  
જ આપણે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે. બાળક  
નાનું છે પણ મનુષ્ય છે; તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું  
છે. આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં  
મંદ કરવાનું છે. આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ.

\*

[ ૧૪ ]

ટોકણી

જેઓને વારંવાર દવા લેવાની ટેવ પડી ગયેલી હોય છે  
તેઓને દવા બહુ જ થોડી અથવા સાવ જ નહિ જેવી અસર  
કરે છે. દાકૃતરને દિનમતિદિન દવાનું પ્રમાણ વધારવું જ  
પડે છે. દાકૃતરો આવા દરહીએને 'કોનિક પેશન્ટ્રસ' કહે છે.  
દાકૃતરો દવા આપ્યા કરે છે, દરહીએ દવા પીધા કરે છે,  
રોગ આગળ વધે છે, ને જીવન ઘસાતું જાય છે !

આનું કારણ શું ? મૂળ કારણ માણુસ માંદો પહોં તેમાં  
છે. તેણે જે આરોગ્ય જ સાચવ્યું હોત તો તેને દવા પીવી ન  
પડત; બીજું કારણ દાકૃતરે તેને નીરાગી રહેવાને માર્ગ મૂક-  
વાને બદલે માત્ર રોગ જ મરાડવાનો પ્રયત્ન કર્યો; ત્રીજું  
કારણ રોગ જેમ જેમ ન મટતો ગયો. તેમ તેમ વધારે ને  
વધારે તેજ ડેઝો આપવામાં આવ્યા. હવે દાકૃતરો અને શરીર-  
શાસ્ત્રીએ માનવા લાગ્યા છે કે આ દવાના ઉત્તેજકો અને મંદ  
પરિણામાંથી સુક્રિત આપવા માટે દવાખાનાને બદલે

આરોગ્યગૃહો ખાંધવાં જેઠાએ; દાકતરોની જગ્યાએ હવે આરોગ્યશાસ્ત્રીઓએ આવવું જેઠાએ; દવા લેવા હોડનાર દરહીને દવાને બદલે પહેલેથી શુદ્ધ હવા ખવડાવવી જેઠાએ.

આ વિચારસરણીથી ભાવશિક્ષણમાં ટોકણીના સ્થાનને જેઠાએ. આપણને વારંવાર માભાપો તરફથી કહેવામાં આવે છે કે “ભાઈ! આ ટોકરાંઓનું તે શું કરવું? કહી કહીને થાકી જઈએ છીએ પણ ટોકરાએ. સાંભળતાં જ નથી એક વાર કહીએ છીએ તે તો જાણે કાનતળે જ કાઢે છે! પાંચ-પચાસ વાર કહીએ ત્યારે જરાક ધ્યાન આપે છે. આનું તે કરવું શું? જેમ વધારે કહીએ છીએ એમ વધારે ગણુકારતાં નથી. આનો કંઈ ઉપાય?”

ઉપર જેથું કે દવાએ જેમ વધારે લેવાય તેમ તે વધારે લેવાની જરૂર પડે છે, ને ત્યારે જ તે અસર કરતી હેખાય છે. ટોકવાની ભાબતમાં પણ એમ જ છે. જેમ વધારે ટોકતા જઈએ તેમ ટોકવાનું વધારે ને વધારે વધતું જ જાય છે. જેમ દવા લાણે વખતે કામ નથી કરતી પણ સહી રહે છે, તેમ જ લાંબે વખતે તેનાં તે જ વચ્ચેના અસર નથી કરતાં; સાંભળનાર રીઠે થઈ જાય છે. તેને થાય છે કે “એ તો કદ્યા કરે. રોજનું થયું; દિવસ આખાનું થયું; કહેવાની એક ટેવ પડી. આપણે તો કરીએ છીએ તે કર્યા કરીએ!” ટોકવાથી આવી માનસિક વૃત્તિ બાળકમાં પણ આવે છે.

મૂળ હોષ બાળકો સાથે કામ કેમ પાડવું તેમાં છે. મોટે ભાગે બાળક આપણું કહેવું સાંભળવા ને તેમ કરવા ખુશી હોય છે. તેની સ્વાભાવિક મનની વૃત્તિ તંહુરસ્ત હોય છે. તે જીલટું ના પાણ્યા છતાં કામ કરવા હોડે છે; કામ કરવા ન હુંએ તો તે રડે છે. પરંતુ આપણે જ તેની આ નીરોગી

અને સ્વાભાવિક વૃત્તિને અનારોગી અને માંદી કે વિકૃત કરી નાખીએ છીએ. જ્યારથી આપણે બાળકમાં રહેલી કામ કરવાની, કહું કરવાની, આપણુને સાંભળવાની વૃત્તિને રોકીને અટકાવીએ છીએ લ્યારથી ટોકવાનું કામ શરૂ થાય છે. એક વાર બાળકનો સ્વાભાવિક જુસ્સો રોક્કો એટલે તે પાછું પડ્યું; તેને આધ્યાત્મિક પહોંચ્યે; તે પાછું વળ્યું; તેના કાન બંધ થયા; તેના અંતરમાં આપણે અવાજ જતો અટક્યો. આપણે જ તેના કાન બહેરા કર્યો અને આપણે જ તે નથી સાંભળતું તેની ફરિયાદ કરવા એઠા ! તેનો ઉપાય પૂછવા નીકળ્યા ! આપણે જ તેને માંદું પાડ્યું ને હવા આપવાની શરૂઆત કરી. પરંતુ પ્રશ્ન એ છે કે રોગ લાગુ થયો તેનું શું ? જેમ જેમ ટોકણીનો ડોઝ વધારતા જઈએ છીએ, તેમ તેમ તે વધારે ને વધારે નીલાં થતું જાય છે. અને બરાબર આમાં જ ન સાંભળવાનો, ન માનવાનો માનસિક રોગ જડ ઘાલી એઠાનું મૂળ છે. એશક હરેક વધારેલા ડોઝથી બાળક થોડો વખત સાંભળશે, માનશે; પરંતુ જેમ બીજા ઉત્તેજકોથી શરીર આખરે પાછું પડે છે, તેમ જ ગાળો વગેરે ટોકણીથી ઉત્તેજિત થયેલ મન પાછું પડે છે ને વધારે મંદ થતાં વધારે ટોકણી માગે છે. આખરે તો તે સાવ હાથથી જાય છે. તેને કશા શરીરની અસર થતી નથી—જેમ આખરે કોઈ પણ હવા પેટમાં રહેતી જ નથી તેમ.

આપણે ટોકણીના ઉત્તેજકોથી બાળકને હૂર રાખીએ. તેને હવાને બદલે હવા આપીએ. તે જ્યારે સ્વાભાવિકપણે આપણું કહું કરવા અને સાંભળવા તૈયાર હોય છે, ત્યારે તેની તેમ કરવાની મરજી અને શક્તિને વધારીએ; અને જ્યારે તેમ કરવાની મરજી ન થાય ત્યારે તેને છોડી જ દઈએ.

રડતી રડતી ચંદ્રા બા પાસે આવીને કહે : “ કનુ પાસેથી કાતર અપાવી હે. ”

ચંદ્રા નાની હતી; કનુ માટી હતી. કનુ કાતરથી કાગળ કારતી હતી. ચંદ્રાને એની જેમ કરવું હતું.

બાએ ધાંઠો પાડી કહું : “ એ કનુ ! આપી હે એને કાતર ! ”

કનુ કહે : “ બા મારે કાતરવું છે; મારે ભાત પાડવી છે. ”

બા કહે : “ પણ, આ ચંદ્રા રોવે છે એ જેતી નથી ? આવડી માટી થઈ પણ નાની એનને રોવરાવતાં શરમ નથી આવતી ? ”

કનુને કાતર આપી હેવી પડે છે. ચંદ્રા કાગળ લઈ કાપવા એસે છે.

કનુ ચિત્ર કાઢે છે; વોટરકલરની પેટી અને પીંઠી સામે પડેલાં છે. ચંદ્રા કનુ પાસે જઈ એસે છે ને કહે છે : “ મને પીંઠી આપ. ”

કનુ કહે : “ હું નહિ આપું. મારે ચિત્ર કાઢવાં છે. તને પેટી વાપરતાં ન આવડે. ”

ચંદ્રા કહે : “ હું બાને કહુને તારી પાસેથી લેવરાવીશ. ન આપ તો બાને કહું. જેને, બા ન અપાવે તો ! ”

ચંદ્રા બાને કહે છે : “ બા ! મને કનુ પાસેથી પેટી ને પીંઠી અપાવ ને ? મારે ચીતર કાઢવાં છે. ”

બા કહે : “ તારે ચીતર ન હોય; તું નાની છો. ”

ચંદ્રા કહે : “ અ અ ! અમારે ચીતર કાઠવાં છે. એન ચીતર કાઠ તો અમે ય કાઠશું. અમને પેટી અપાવી હે.”

બા કહે : “ બાપુ કનુ ! આને જરા પેટી ને પીંધી આપ ને ? એને ચીતર કાઠવાનું મન થયું છે.”

કનુ કહે : “ પણ તો પેટી બગાડશે. અને એને ચીતર કાઠતાં કયાં આવડે છે ? કહે તો અહીં બેસાંદું ને ચીતર દેખાડું.”

બા કહે : “ એન ! ધરીક વાર આપને ? એનો કન્જિયો. એલાય ! ”

કનુએ કણુસ્તે મોંબે પેટી ને પીંધી આપ્યાં.

ચંદ્રા કહે : “ કાં, નોંતાં આપવાં ને ? બાને કહુને લીધાં ને ? ”

નાનાં બાળકો મોટાં બાળકો પાસેથી જ્યારે કાંઈ બેનું હોય ત્યારે બાનું શરણું શોધે છે. બા નાના બાળકનો પક્ષ કરે છે. કાં તો બાળક નાનું છે એટલે વધારે વહાલું લાગે છે; કાં તો નાનું બાળક રડે તે બાથી સાંખી શકાતું નથી; કાં તો એનો કન્જિયો. એલાવવા માટે; કાં તો એને માગ માગ કરતું પોતાની પાસેથી કાઠવા માટે; કાં તો નાનું બાળક રેઝ રાળું જ રહેનું જેઠાંએ મોટાંએ જરા લલે સહન કરે પણ નાનાની ભાગણી કે હિચ્છા સાચવી લેવી જેઠાંએ, એમ બા માનતી હોવાથી. આમ જુદાં જુદાં કારણે બા નાના બાળકને હમેશાં અપાવી હે છે. કોઈ બા મોટા બાળકને હુકમ કરીને, વખતે તેના પર જુલમ કરીને, વખતે તેને મારીને પણ નાના બાળકને અપાવે છે જ્યારે કોઈ બા મોટા

બાળકને સમજાવીને, ફોસલાવી પટાવીને કે કંઈક લાલચ આપીને અપાવી હે છે. કોઈ બા ઘડીકમાં અપાવી હે છે તો ઘડીકમાં અપાવી હેવાની ના પાડે છે; પણ આખરે નાનું બાળક જીહ પર ચાડે છે ત્યારે પાછું અપાવી હે છે. કોઈ બા મોટા બાળકની જરૂરિયાત ચોંચ ગણીને અપાવી હેવાની ના પાડે છે, પણ આખરે નાના બાળકની આજુલુ રુદ્ધન કે કનંડગતને આધીન થઈ અપાવી નાનાને હે છે.

આમ નાનું બાળક વારંવાર મોટા બાળક સામે ભાની મહદ્દથી ફૂલી જાય છે, ને ફૂટી જાય છે. તેના મનમાં વિચાર આવવો જેઠાં કે આની પાસેથી આ લેવું છે કે ‘બસ અપાવી હે !’ તેને અનુભવથી ખાતરી થઈ છે કે બા અપાવી હેવાની છે. કદાચ કંજિયા માટે બા મારશે તો પણ તે અપાવશે તો ખરી જ ! આવું બાળક ‘અપાવી હેવરાવવાની’ બહીમાં પડે છે, એટલે તે એક જુલમગાર બને છે. તે બીજા બાળકની જરૂરિયાત જેલું કે સાંભળતું કે વિચારતું જ નથી; બીજાને માન આપવાનો વિવેક તેની આગળથી ચાંદ્યો જ જાય છે. નખળા સત્તાધારીના હથિયાર તરીકે રૂદ્ધન, તો ફૂન વગેરે કરીને અવિચારી ને અવિવેકી કે પોચા મનની ખાને તાણે કરે છે. સત્તા વિનાના, પારકી તાકાત ઉપર રહેવાવળા આપણુંનો તેનામાં સ્વભાવ આવે છે. તેને “કમલેર ગુસ્સા ખણીત ” કહેવત લાગુ પડે છે.

‘અપાવી હે’ માં કે બાળક ફૂલે છે તે વિચાર-વિવેક ભૂલે છે, ઉપરાંત શુલામ બને છે. તે પોતાની ચોંચતાનો વિચાર નથી કરતું પણ તેને જેઠાં છે માટે પોતે લાયક છે એવો ભ્રમ તેનામાં પેઢા થાય છે; અને જ્યારે નથી મળતું ત્યારે તે કોઈનું શરણું શોધી શરણું આપનારને આધીન બને છે.

‘આપાવી હે’ને માર્ગે ચડેલ બાળક કોઈકે કરી આપવું જોઈએ ને ન કરી આપે તો તેની સામે લડાઈ કરે છે, પણ પોતે કરવું જોઈએ કે તેને માટે લાયક બનવું જોઈએ, તે તે સમજતું નથી. પરિણામે જ્યારે તેને આપાવી હેનાર નથી મળતું અગર જ્યારે તેને આપનાર નથી મળતું ત્યારે તે હુંખી થાય છે, હેરાન થાય છે.

આવું બાળક મોટું થતાં બહુ હુંખ સાથે સમજે છે કે “લાયકને માટે બધું છે.” ‘આપાવી હે’ની ઠેવથી તે તૈયાર માલે જમતાં શીખ્યું ને જાતે મેળવવા ચોણ્ય ન થયું તેનું તેને સાલે છે. ‘આપાવી હેવરાવ’માંથી તે ઓટું અભિમાની અને સરસાઈ લોગવવાવાળું બનયું કે જેને લીધે તે સ્વાભિમાનથી વધારે ફૂર ગયું. નાના બાળકને ‘આપાવી હેવાની’ દીતમાંથી માખાપે બચવું જોઈએ. જેને આપાવી દઈએ છીએ તે સ્વાર્થી અને આપખુદ બને છે, ને જેની પાસેથી આપાવીએ છીએ તેને અન્યાય થાય છે. લાઈ-લાઈ કે બેન-લાઈ વર્ચે આમ કરવાથી સંપ થવાને બહલે વેર થાય છે; એકને થાય છે કે બા મને ચાહે છે ને બીજને લાગે છે કે મારી બા ખરાબ છે, મને જ હેરાન કરે છે, મારું જ લેવરાવી લે છે! બાળકો આપાવી દીધા પછી અંદરઅંદર લડે છે ને કહે છે: “કાં નો’તું આપવું ને ? લે, લેતું જ !” સામું બાળક ચિડાઈને મારવા હોડે છે, અગર હિજરાઈને ગાળો હે છે કે રડે છે; પરિણામે બા પોતાનાં જ બાળકો વર્ચે ‘ઓ’ પડાવે છે.

આપણે માખાપ તરીકે આ બાખતમાં ખૂબ કાળજીથી ચાલલું જોઈએ. ઘરમાં બેચાર બાળકો હોય ત્યારે દેખાદેખી કરવાનું સહજ છે; છતાં બધી વખતે દેખાદેખીથી કામ કરવામાં

લાલ નથી. પોતાની કેવળ યોગ્યતાની બહાર જઈ બાળક કંઈક કરવા માગે તો તેમાં તેને નુકસાન જ છે. પોતાની કંઈક યોગ્યતા હોય ત્યારે થતું અનુકરણ શીખવાના પ્રયત્નરૂપે છે. નાનાં બાળકો જ્યારે મોટાઓ જે કરે છે તે કરી શકતાં નથી, કરી શકવાનાં નથી તે છતાં તેમ કરવા માગે છે, ત્યાં આપણે તેમને તેમ જ કરવા હેવા માટે મોટાં પાસેથી અપાવી હેવું ન જ જેઠાં. કાં તો તેમને મોટાંઓના કામને જેવા બેસારીએ, અગર તેમને તે કામમાં મદદગાર બનાવીને જેડીએ; જેમ કે રંગકામ ચાલતું હોય તો પાણી લાવવાનું કે પીઠી ધોવાનું, અગર તો તે કામને બદલું ભીજું તેવું જ કામ તેને આપીએ. ગમે તેમ કરીએ પણ ભીજ પાસેથી અપાવી તો ન જ હદ્દાએ.

અમુક વસ્તુ બાળકને જેઠાં છે ને તેને જરૂરની છે એમ લાગે ત્યાં પણ, તે જેઠાં છે માટે જ ભીજ પાસેથી અપાવી હેવી ન જેઠાં. તેને વસ્તુ મળ્યાનો લાલ થાય તેના કરતાં અપાવી હેવરાવવાની ટેવ પડે તેતું નુકસાન વધારે છે. બાળકને તેવી ભીજ વસ્તુ હોય તો આપવી નહિતર તેને તેનો વારો આવે ત્યાં સુધી રાહ જેવાનું કહેલું. આપણને જેઠાં છે તો ધાણું, પણ જીવનચ્યવહાર જ એવો છે કે જે દિચ્છિયું તે તરત જ મળે તેવી શક્યતા નથી. તે જ સામાન્ય નિયમ અહીંથી જ બાળકના જ્યાલ ઉપર ભસે આવે. બાળકને ભીજ ચીજ આપી શકતાં ન હોઈએ, અથવા તો બાળક માગતું હોય તેને માટે તે લાયક ન હોય, તો તેને અણુદ્ધિટકે રડવા દઈએ પણ ભીજ પાસેથી અપાવીએ તો નહિ જ.

આપણને ભીજ પાસેથી અપાવી હેવું સહેલું પડે છે. મોટા બાળક ઉપર હુકમ ચલાવી શકાય છે; તેને સહેલથી

સમજાવી પણ શકાય છે. એમ નહિ તો કુળદાયી જુલમ પણ  
શક્ય છે. આથી ‘આપાવી હેવા’ના લોભમાં પડી આપણે  
માગનાર બાળક માટે ખરો રસ્તો કાઢવાનું પસંદ કરતાં  
નથી, તેનો શ્રમ વેતાં નથી. પરંતુ એમ કરવામાં નાનું  
બાળક એ ઘડી રાજુ થઈ આપણા પર પ્રસન્ન થાય છે, તે  
જ વખતે મોટું બાળક આપણા પરથી વિશ્વાસ અને પ્રેમ  
બંને ખુચે છે. ‘આપાવી હેવા’ની આપણામાં શક્તિ છે તે  
વાપરવામાં શાહીપણું છે જ્યારે તેનો રસ્તો કાઢવામાં શાખ-  
પણ છે.

છતાં ઘણ્ણી વાર એવા નાંજુક પ્રસંગો આવી પડે છે કે કે  
જ્યારે ન તો આપણને નાના બાળકની માગણી નામંજૂર  
કરવાનું ચોણ્ય લાગે, ન તો મોટા પાસેથી લઈ લેવું ‘ન્યાય-  
ભયું’ લાગે. અને છતાં આપણે એ પરિણામ તો ઈચ્છાએ કે  
બંનેનું મન રાજુ રહે : બંનેની ઈચ્છા તૃપ્ત થાય આપણે  
એવે વખતે તેમને સહકાર કરવાની ચુક્તિ બતાવવી જોઈએ.  
એમાંથી એકેયને એવી છાપ ન પડવી જોઈએ કે મને આપાવી  
દીધું કે મારા પાસેથી લઈ લીધું; અને છતાં બંનેના મનનું  
સમાધાન થવું જોઈએ. આ કામ કાં તો બંનેને ત્રીજે જ  
માર્ગે વળવાથી થાય, અથવા બંને જણુને એ જ કામમાં નવી  
પ્રવૃત્તિ આપવાથી થાય.

આપણે મોટા છીએ તેથી આપાવી દઈ શકીએ છીએ, ગમે  
તેવો ન્યાય આપી શકીએ છીએ, એવો ખ્યાલ બાળકોમાં  
પેસવા હેવા કરતાં જ્યાં આપણું ન ચાલે ત્યાં “જાએા,  
તમે ઠીક પડે તેમ કરો; હું કશું કહીશ નહિ.” એમ કહેવું  
વધુ સારું છે. પછી બંને લાલે લડી લડીને કોણે લેવું ન લેવું  
તે નક્કી કરે ! એમાં સારું ન્યાય નહિ થાય, છતાં આપણા

પક્ષપાતી ન્યાયને તો અવકાશ નહિ જ રહે ! ધર્ણી ખરી વાર બાળકને પોતપોતાનું પોતાની જતે પતાવી લેવા છુટાં મૂકીએ છીએ તો તેઓ સામસામે અથડાઈને વહેલાં ઠેકાણે આવે છે. ને આપણે વર્ચ્યે પડીએ છીએ તો અસંતોષ સાથે એકખીળાંના દુશ્મન બને છે તેને બદ્દેલે તેઓ ભિત્રો થાય છે અને પોતાની ઈચ્છા ને મર્યાદા કર્યાં રાખવી તે સમજે છે.

દ્વાંકમાં અપાવી હેવાની રીતિ ચોણ્ય લાગતી નથી; માટે આપણે તે છોડી દઈએ.

\*

[ ૧૬ ]

તેડકાં બાળકો

ઘરમાં વાતો ચાલતી હતી. ચંપાની બાએ પૂછ્યું : “ આ રસુ નાની હતી ત્યારે ‘ ટેલો ’ તેડો, તેડો, કરતી; ગંગાની પણ એવી જ ટેવ હતી; નટુ પણ એમ જ કરતો. એક આ ચંપા એમ નથી કરતી. એ તો જિલ્લા જ્યારે એને તેડીએ છીએ ત્યારે પગ તડકડાવીને કહે છે : ‘ માલે છેડે જિટલવું છે, માલે છેડે જિટલવું છે.’ રવિ નાનો હતો ત્યારે એને તેડીએ તે ન ગમતું. આનું શું કારણું હશે ? ”

જરા વિચાર કરી દુઃખે કહ્યું : “ એક કારણું તો ચોણ્યું જ છે. મને તો આપણાં બાળકો પરત્વે એ એક જ કારણું લાગે છે. બીજાઓના અનુભવો જણુવા મળે તો વધારે ચોકસાઈથી કહી શકાય. ”

ચંપાની બા : “ કુહે જેઠાએ ? ”

ઇંહુ : “ મને તો એ નોકરોનું કારણ લાગે છે. રવિ જ્યારે નાનો હતો ત્યારે આપણે પરાવાળો ન હતો. આપણે એને ઝરવા લઈ જતાં ત્યાં પણ એ પગ હલાવી હેઠે જિતરતો ને આપણે એને ચાલવા હતાં. તે દિવસ આટલું બધું કામ પણ નહોંતું કે અટ ઝરીને પાછું જવાનું હોય, ને તેથી તેની પાછળ પાછળ આપણે ન ચાલીએ. રવિ ઘરમાં પહેલો ને તેથી બહુ લાડકો હતો. આપણે તે દિવસ ભાળજેરમાં બહુ ન સમજતાં, પણ એની નાની નાની ને કાલી કાલી ગમતો જેવાની આપણને બહુ મળ પડતી. તે નાની નાની ટાંડુડીએ ટેકાવતો ટેકાવતો આગળ ચાલતો ને આપણે તેની પાછળ ચાલતાં. તે કીડી જેવા જેલો રહેતો, આપણે તેની પાછળ જેલો રહેતાં. મોર જેવા તળાવની પણે બેસતો તો આપણે પણ સાથે જ બેસતાં. એને તેડવાની જરૂર નહોંતી ને આપણે એને તેડતાં નહિં. એથી એ તેડકો ન થયો. પણ આ રમુ આવી ત્યારે ઘરમાં નોકર આવેલો. બીજાએના નોકરો છોકરાંએને તેડીને ઝરવા જતા જેઠને તને પણ મોહ થયેલો કે ઓપણા ભાળકને પગે ન ચલાવાય; નોકર છોકરું તેડીને પાછળ પાછળ ચાલે એમાં તેં શોભા અને સસ્યતા માની. છોકરું પણ તેથી જ વધારે રાણ થશે એમ લાગેલું. મનમાં નોકરની મોટાઈ એટલે આ ભૂત વળગેલું. રમુને ચાલવાનો કેટલો બધો શોખ હતો તે આપણે નજરે જેયું છે. ઘર પાસેનાં પગથિયાં ઉપર તે કેટલી બધી વાર ચડજિતર કરતી ? પણ નોકરે તેડવા માંડી ત્યારથી તેડાઈને તેના પગ હરામના થઈ ગયા. તેણું પગે ચાલવાનો આનંદ અને શક્તિ બંને ગુમાવ્યાં ! તળિયાં સુંવાળાં થયાં. નોકર તેડે તેમાં કંઈક મોટાપણું છે, તેના તેને પણ ભાસ થયો; તેથી તન સાથે મન પણ હરામી થયું અને પછીથી તો તે ઘરમાં પણ કહેતી : ‘ તેલો, તેલો ! ’ એ

ટેવ સુકાવતાં તેને કેટલી બધી વાર રોવું પડતું? આપણુને કેટલી બધી સુશકેલી પડેલી?"

ચંપાની બા : "વાત તો સાચી છે."

ઇહુ : "આપણુને એક વાર અનુભવ થયો હતો છતાં ગંગું અને નટું એવાં જ તેડકાં થઈ ગયાં હતાં. રમુની બાખતમાં થોડો ઘણો ગેરલાલ જાણ્યો. હતો છતાં આપણા ઘરમાં પાડોશીની દેખાદેખીથી નોકરોનું શરણ એવું ને એવું જ રહ્યું. આપણે પણ જરા વધારે કામકાજમાં પડવાં. આપણે એમ માન્યું કે નોકરો બાળકને સાચવી લે તો આપણે આપણું કામ વધારે અને સારું કરીએ: આપણે ગંગું નટું એ રીતે નોકરના હાથમાં વધારે જવા હીથાં. નોકરોને તો બધું કામ પતાવીને બરાબર વખતસર પહોંચી વળવાનું. તે છોકરાંએનું મન જેઠને તેમની પાછળ ચાલે તો આપણે જ કહીએ : 'જે, નકામો વખત ગુમાવે છે!' પછીથી તો નોકરને જ્યાં ત્યાં બાળકને તેડીને પહોંચે જ છૂટકો. બાળકને એક જોટી ટેવ પાડી; એ જ વસ્તુ એને વૈભવરૂપ લાગી. બાળક વૈભવનું દાસ બન્યું. પછી નોકર ન તેડે તો તેને રડવાનું જ રહ્યું. આપણે પણ બાળક રડે માટે નોકરને વફવાનાં જ. આવી રીતે બાળકો તેડકાં થાય છે. આપણું બાળકો પણ એ જ ફેં જિછ્યાં ને ગુલામ બન્યાં હતાં."

ચંપાની બા : "વાત તો ખરી; બન્યું પણ એમ જ હતું."

ઇહુ : "પછી નોકરોથી આપણે છૂટચાં ને નોકરો (આપણાં) બાળકોથી છૂટચાં. ચંપાને કોઈ તેડનાર નથી, અને આપણે એને નાનપણથી જ્યાં ચાલવું હોય ત્યાં બની શકે ત્યાં ચાલવા જ હીધી છે. એટલે તે ચાલવાની શોખીન

થઈ છે. બીજાં ભાગકેને તેડેલાં જોઈ ચંપા કોઈ વાર કળિયો.  
 કરે છે, પણ આપણે તેડતાં નથી એટલે તે ધરીક કળિયો.  
 કરી રહ્યે આવે છે. કોઈ કોઈ વાર તો વળી તે કોઈ તેડે  
 છે તો ‘ઉતારો’ ‘ઉતારો’ એમ કહી હાથપગ હલાવે છે.  
 ઘરણી વાર ઉતાવળ અને અડપથી જતી વખતે આપણે એને  
 તેડવી પડે છે ત્યારે તેને અગાઉથી સમજાવી દઈએ છીએ,  
 એટલે તે વખતે તેને તેડવાનું બંધન નથી લાગતું. ચંપા  
 તો તેડવવાની ટેવમાંથી બચી ગઈ; કારણ કે આપણે હવે  
 અનુભવે ઘડાયાં છીએ ને ઘરમાં નોકર પણ નથી. હવે તો  
 નોકર મળે તો પણ ચંપાને તેડવા ન જ દઈએ. ભાગકે  
 નાનપણુમાં ચાલવાની પ્રવૃત્તિ કરી મનમાં આનંદ સાથે  
 શરીરને વ્યાયામ આપે છે. જે આટલા સુદૃઢ પગોથી આપણે  
 કેટલું ચે ચાલી શકીએ છીએ તે પગોને નાનપણુમાં ઘડાવાનું  
 છે, અને તે ચાલીને જ. એ માટે ભાગકેને છૂટ જોઈએ.  
 પુષ્કળ જગા જોઈએ. જ્યાં જ્યાં માબાપો ભાગકેને ચાલવા  
 દેવાને બદલે તેડાને ફરે છે, ને તેમાં ભાગક પ્રત્યેનો એમ  
 સમજે છે, ત્યાં ત્યાં ભાગકને તો નુકસાન જ થાય છે. કોઈ  
 કોઈ પ્રસગે જેમ કે માંહગી વખતે કે ઉતાવળથી સ્ટેશને  
 પહોંચવું હોય ત્યાં ભાગકને તેડાય એ જુદી વાત છે.”

ચંપાની બા : “સાચી વાત છે.”



ધરને ઓરડે હોલું ઘૂઘવે છે.

બા કહેશે : “ સાંભળ્યું કે, ઓરડે હોલું આવે છે. રોજ ઓરડે હોલું આવે તે નહિ સારું.”

બાપા પથ્થર મારીને હોલું ઉડાડે છે. નાતું છોકરું જોઈ રહે છે.

ગામમાંથી બાપા આવીને કહે છે : “ ધરમધઙ્કો થયો. હું જાણ્યો જ હતો કે કાંઈ વળશે નહિ; સામી વિધવા મળી હતી.”

રાત પડી; ચીભરી અભયખી. બા કહે : “ અરરર ! ચીભરી તો કોણું જાણે કેવી યે આવે છે. કાલ કોણું જાણે કેવી યે પડશે. ચીભરી રોજ વાસે લાગી છે ! ”

પાડોશણું ફૂતરાં હાંકતી કહે છે : “ આ જે ને ફૂતરાં ! કાંઈ રાવે છે. કાંઈક માદું થવા એહું છે.”

કૃઈભા કહે છે : “ આજે તો તાવડી હસી; હમણું મહેમાન આવશે ”

સાંજે વાળું કરી શેરીમાં બેરાં એકઠાં થયાં છે. નિતનવાં ગાપાં મારે છે. “ ના, બા ! ઈ વડાનાં ફૂંડાણાં કર્યાં હોય એમાં છોકરાંને પગ ન મૂકવા દઈએ.” “ આ મારું ધર કોણું જાણે કેવું યે છે ! કોઈને શરીરે સાખો જ ન રહે.” “ હનુડીની નજર બહુ કડવી. આજ ફૂધપાઠ આતી હતી ત્યાં તો ઓચિંતેથી આવી. કહે : ‘ બાપુ ! ફૂધપાઠ બહુ સારો

લાગે છે.' એટલું કહી એ તો ગઈ; પણ રાંડની કાંઈ નજર ! હું તો આકીને નહા થઈ ગઈ.'

ધરમાં માભાપ છોકરાને કહેશે : " અત્યારે એલા ગઘેડાનું નામ ન વેવાય." " સવારમાં જઠીને સાયલાનું નામ કયાં લીધું ? સાંજ સુધી રોટલા નહિ મળે." " એલા છનકા ! આ સંદ્યાકાળે એતરાહો કયાં સૂતો ? જઠ, જલ્સા થા."

આ બધા નર્યો વહેમો છે. આપણી આસપાસ અને વરચે વસતાં આપણાં બાળકોને આપણે એ વહેમો પળે પળે પાઈએ છીએ. માભાપો પાસેથી આ વહેમો આપણું મહ્યાઃ આપણે એ જ વહેમો પેઢી દરપેઢી જણેઅન્જણે બાળકોમાં ઉતારી રહ્યાં છીએ. આપણે માભાપોને પૂછ્યું : " સાપ આડો જિતરે એમાં આપણું નુકસાન શાનું થાય ? " આપણું જવાબ મહ્યો : " એમાં તમે શું સમજો ! ધરડાં અમથાં કહી ગયાં હશે ? " આપણું બાળકો પૂછ્યે : " પગ હલાવીએ તો મા શાને મરી જાય ? " આપણે કહીશું : " લે રાખ, બહુ ડાંદો થયો તે ! પગ ન હલાવીએ, એટલું એ નથી સમજતો ? "

પરિણામે આપણે વહેમી થયાં, આપણાં બાળકો વહેમી થશે, તેનાં બાળકો વહેમી થશે; ને એમ પેઢી દરપેઢી વહેમ જિતરશે !

વહેમી માણુસ એટલે બીકણ માણુસ. " જમણી અંખ ઝરકી; હાયહાય ! હવે શું થશે ? " " ધી ઢાળાયું; કાંઈક આકૃત આવશે." શિયાળ રાયું; આજ ખાતર તો નહિ પડે ને ? " " રાતે મેળવણ દઈંશ તો મારી ગાય વસુકી જશે, તો ? " આ બધા વહેમો માણુસના વિચારોમાં છે.

વહેમી મન વહેમ પડતાં ડરી જાય છે; અમંગળની ચિંતામાં ધૂળ જોડે છે; ભયભીત થઈ પરસેવાથી નાહી જાય છે. ઘડીકમાં તો કદ્યનામાં તે ટેટલું ય હુઃખ અનુભવી લે છે.

વહેમી એટલે માની લે તેવો; પ્રમાણ માણ્યા વિના ગમે તે વાત સ્વીકારે તેવો. વહેમીને વહેમ નાખવો જેછાએ. આપણે કહીએ : “જોજે, હતુમાનને હાર નહિ ચડાવે તો હતુમાન કોપશે.” “મેલડીને લાપશી નહિ માન તો મેલડી નડશે.” “એ તો ચૂલો ઢારો નહેતો એટલે શીતળા રૂક્ષયાં અને તેથી દીકરાને શીતળા નીકળ્યાં.” વહેમી બધું સાચું માનશે ને કહેશે : “આ તો સાચી વાત.”

વહેમી માણુસ એટલે નિર્મળ તર્કખુદ્ધિનો અસ્વીકાર કરનારો માણુસ “એમ શા માટે ? મારી ખાતરી કરાવી આપો તો જ હું માતું.” એવું વહેમી માણુસ નથી પૂછતો.

વહેમી માણુસ એટલે અશાખીય મનવાળો માણુસ. “ગમે તેમ કહો પણ મારે તો જાતે તપાસવું જ પડશે. ન સમજાય ત્યાં સુધી તરસ્થ રહેવું હું પસંદ કરીશ.” એમ વહેમી કદ્દી નથી કહેતો. વહેમી તો તપાસ્યા વિના જાહેરો વગેરેમાં મંત્રતંત્ર ભાળે છે, જ્યારે વહેમસુક્ત જાણી શકે છે કે તે બધું દવા વગેરેથી કે ચુક્કિત્પ્રચુક્કિતથી કે હાથચાલાકીથી બને છે.

વહેમી મન એટલે અંધશ્રદ્ધાવાળું મન. એટલે જ તો વહેમી માણુસ શાખવચનને અફ્ર વચન માને છે; દેવો અને પરીઓની વાતોને સાચી ન માનનારને નાસ્તિક ગણે છે; ભૂતપ્રેતની વાતોનો ખીંચે ખુલાસો શોધવાની ના પાડે છે.

માટે લાગે આપણે વહેમનું જીવન જીવીએ છીએ. અત્યારના ધર્મનો માટો ભાગ એક વહેમ છે. પાખંડી લોકો

ધર્મને નામે વહેમી પ્રકૃતિના લોકોને ગેરલાભ ઉઠાવ્યા કરે છે.

આપણે આપદાદાને કારણો પૂછ્યાં; જવાબ નથી મળ્યો; હવે આપણે પોતે જ આપણા અનેક વહેમોનાં કારણો પૂછીશું? અને તે આપણે માટે નહિ તો આપણાં ભાગડોને માટે પૂછીશું? ભાગડોના પ્રશ્નોના ઉત્તરમાં આપણે કારણો આપવા પ્રયત્ન કરીશું?

વહેમો છેક ઓટા છે, એની ખાતરી આપણે જતે જ કરી લઈએ. સાચલા એક ગામ છે; એનું રોજ નામ લઈ નેવાથી ખાતરી થશે કે એનું નામ નેવાથી કંધ થતું નથી. ચીભરી પોતાના માટે જ બોલે છે. આંખ ફરકવાનું કારણ શારીરિક અવ્યવસ્થા જ હોય. આમ વહેમોને તપાસીએ તો આપણે આપણી બેઅંકલ માટે હસીશું.

ભાગડો આપણી પાસેથી ધણું શીખે છે; આપણે શીખવીએ છીએ તેના કરનાં જીવીએ છીએ તેમાંથી તેઓ ધણું વધારે શીખે છે. મારામાંજે વહેમો છે તે નિશાળમાંથી નહિ પણ ધરમાંથી માણાપના પ્રત્યક્ષ વહેમોમાંથી આવ્યા છે. આપણે આપણાં ભાગડોને વહેમનું શિક્ષણ આપવું છે? તેમને બીજણું અને માની લે તેવાં બનાવવાં છે? તેમને શાસ્ત્રીય દિશિ વિનાનાં અને તર્કરહિત ખુદ્ધિવાળાં બનાવવાં છે?

એમ ન કરવું હોય તો આપણે એક પણ વહેમમાં માનીએ નહિ, ને કોઈને મનાવીએ નહિ.

: ૧ :

“ બચીએન ! જરા ફૂર જઈને પેશાય કરો ને ? ”

“ ના ના; બાવો લઈ જાય ના ! મારી બા કહેતી હતી કે ફૂર જઈએ તો બાવો લઈ જાય. ફૂર ન જવાય. ”

હું હુભકી ગયો ! “ માબાપ આળકોને શું કામ બીવરાવતાં હશે ? ”

પણ બીવરાવવું એ તો સાધારણ વાત છે. માબાપોને એમ લાગતું જ નથી કે એથી કાંઈ હાનિ છે.

આળકે બરદ્દ ખાવાને કજિયો. કજિયો. કેમે એલાય નહિ. બા કહેશે : “ છાનું રહે છે કે નહિ ? મકોડાની ડોડીમાં નાખી દર્શા. નહિતર આ અંધારી ડોટડીમાં પૂરી દર્શા. ઓલ્યા કાળા ગરનાળા પાસે મૂકી આવીશ, ને નહિતર સિપાઈને એલાવીશ. ”

છોકરીને બાએ ઘરેણું પહેંચાયા. છોકરીને રમવા જવું છે. કાકો કહે છે : “ એલી બહાર ન જઈશ, હો કે ? નહિતર બાવો લઈ જશે ઓલ્યો. કાખલી ભાજ્યો. છે ? નાનાં છોકરાને તો ચોરણુમાં ઘાલીને લઈ જાય છે. ”

કોણું જણે શા ય કારણથી નાનું આળક રાતે રડે છે. મા તેને ધર્યો. મારી ડરાવે છે : “ સૂઈ જાય છે કે નહિ ? ઓલ્યું શિયાળ બોલે છે તેને અવરાવી દર્શા ! ”

છાકરાઓ રાતે રમવા નીકળે છે. માટાં મા કહે છે : “ એલા છાકરાઓ ! પેલા પીપળા હેઠે જશો મા ; ત્યાં તો ભૂત થાય છે. ભરખી જશો .”

છાકરાને બાપે માયો છે. તે રડે છે એટલે કૃદ્ધ કહે છે : “ એલા મેઢું ક્ષાડીને રડે છે તે વાંધી આવીને મોઢામાં કિટકાવશે, હો કે ? ”

વરસાદ આવ્યો ને છાકરો નાહવા હોય્યો. મોટીઅહેન કહે છે : “ બાપાને આવવા હે, તારાં હાડકાં લંગાવું ! ”

નાના કાકા કહે છે : “ એ રમુડા ! પાઠ કરવા જેસ, નહિતર માસ્તરનો માર અવરાવીશ. ”

માટા બાપા કહે છે : “ એલા ફૂવા પાસે જશો તો મરી જ જશો ! ”

હરખા ભાભા કહે છે : “ એલા ફૂતરાને રમાડો છો ? અચ્છું ભરશે હો કે ? ”

માબાપ કહે છે : “ એટું બોલીશ તો નરકમાં પડીશ ને કોઠ નીકળશે. ”

મા કહે છે : “ રાંધતાં રાધતરી આઈએ તો આવતા ભવમાં વડવાંગળી થઈએ. ”

દાદા કહે છે : “ એલા હનુમાનને પગે ન લાગીએ તો હનુમાન કોપે ના ? ”

બાપા કહે છે : “ એલા ગાંધીજીને ન બોલાય. વાંદે માતરમ્ બોલીએ તો સરકાર જેલમાં નાખે ! ”

કેટલીયે જાતની બીકોઃ બાવાની બીક, ભૂતપલીતની બીક, વાધવરુની બીક, સિપાઈ-શિક્ષકની બીક, સરકારની બીક :

ખદે ખીક, ખીક ને ખીક ! પરિણામે બાળક કેવળ નામર્દ,  
આયલું, ડરપોક અને નાદાન બને છે.

“ હુર જઈશ તો વાધ ખાઈ જશે. ” એ ખીક નાનપણુ-  
માં લાગે. બાળક મોટું થાય ત્યારે માસ્તરથી ખીચે. માસ્તરથી  
ખીચે તે સિપાઈથી ખીચે; સિપાઈથી ખીચે તે સત્તાથી  
ખીચે. સત્તા જણે મોટો વાધહીપડો ! જણે મોટો હાઉ !

અંધારાની ખીક નાનપણુમાં લાગી. મોટું થતાં ભૂતની  
ખીક; આગળ જતાં વીરની ખીક; ત્યાર પછી માતા—મેલડીની  
ખીક; એમ કરતાં લગવાનની ખીક. એ ચાલી ખીકપરંપરા !  
ખીક શરીરને નિઃસત્ત્વ કરે છે; મનને નખળું કરે છે. ખીધેલું  
બાળક આખો બંધ કરે છે. તે બળહીન બને છે; તેનું હૈયું  
થડકે છે; પરસેવે રેખજેખ બને છે; મળમૂત્ર પણ કરી નાખે  
છે ! પ્રત્યેક ખીકરામણીના પ્રસંગે બાળકના મેં સામે જેવું  
ને છાતીએ હાથ મૂકવો. ખીકની લયંકરતા સમજશે.

: ૨ :

એકવાર મારા ધરના મોલમાં ઉદર બોલતો હતો :  
‘ચું ચું ચું.’ ઉદરને બોલતો બંધ કરવા માટે હું એક  
બારી પાસે ગયો. અને જેરથી બારી ભટકાવી. જણે કે  
ઉદરની સામે થતો હોઉં એમ ‘સીસ’ ‘સીસ’ સિસાઠી  
બગાડી. મારા હાથમાં એ વરસની ટીકુ હતી. અગાઉ ઉદરના  
‘ચું ચું’ થી તે બીતી જણુવામાં આવી નહોતી. પરંતુ  
ઉદરને હાંકતી વખતનો મારો દેખાવ, બારીનું જેરથી  
ભટકાવું, કોધ્યકુત સીટીનું વગાડવું ; એકંદર ભયની સામે  
થતો હોઉં એવા મારા દેખાવ અને વર્તનથી ટીકુના ઉપર  
સજજડ ભયની છાપ પડી. પહેલાં જેની ખીક તેના મનમાં  
નહોતી તેનાથી તે બીધી. તેના મોઢા ઉપર ભયનાં ચિહ્નો

હેખાચાં. તે વખતે મારું ધ્યાન એના તરફ એટલું બધું ગયેતું નહિ. થોડી વારે મેં ટીકુને જેમ પ્રાણીઓ ભયને પ્રસંગે આંખ બંધ કરીને જે થવાનું હશે તે થશે એમ ધારી જાધાં સૂઈ જાય છે, એમ ધ્યાનલાં કપડાંમાં આંખો મીંચીને જાધી પડેલી જોઈ. તપાસતાં તરત માલૂમ પડ્યું કે તે ઉંદરથી ખીતી હતી. ભયને લીધે તે આટલી ઉઘાડી રીતે પણ આંખ બંધ કરીને સંતાઈ હતી.

મારી ભૂલ મને સમજાઈ. હું તેને ઝરી વાર બારી પાસે લઈ ગયો. ભય ટાળવા મેં કહ્યું : “એ તો ઉંદર હતો; હું તેને કાઢતો હતો.” પણ તેની બીજી ગઈ નહિ. મેં ઉપર કહ્યું તેમ મારી ઉંદર કાઢવાની રીતથી તે ઉંદરથી બી ગઈ હતી. ત્યાર પછી તે લીંત સામે જોઈને ‘ઉંદર’ એમ કહીને ખીતી; વોડિયામાં સૂતી હોય તો લીંત સામે જોઈને એચેન થતી; આટલામાં હોય તો ઉંદરની બીકે તે પાસે આવતી ને મૂંગી મૂંગી પડી રહેતી; આંખ ઝડપી રાખતી ને હાલતીચાલતી નહિ. આખરે મેં ઉંદર નાસી ગયો છે, મેં તેને કાઢી મૂક્યો છે, હવે તે નથી જ કારણુંકે ‘ચૂં ચૂં’ બોલતો નથી, એવી ખાતરી કરી આપી અને તેને ભયમાંથી મુક્ત કરી.

ધણી વાર આવી રીતે જેમાં કશું બીવાપણું હોતું જ નથી તેનાથી પણ આપણી પોતાની વર્તવાની રીતને લીધે બાળકો ખીતાં શીખે છે. ધરમાં કૂતરું પેસે ને બા કે લાઈ હાથમાં લાકડી લઈને જુસ્સાથી બેઘડકપણે તેને હાંકી કાઢશે તો બાળક તે પ્રમાણે કૂતરાને હાંકી કાઢતાં શીખશે; પણ જે બા કે લાઈ તેનાથી ‘આયવોય’ બોલીને ડરીને ભાગશે તો બાળક પણ ડરતાં શીખશે. મોટાંચોને અંધારામાં અજકતાં

જેઠને કે ‘ધીંડ છુ’ કહેતાં સાંભળીને કે ભાગી જતાં જેઠને ભાગક પણ ભીતાં શીંચે છે. મોટાંએ બિહામણે ચહેરે ને લયલીત અવાજે રાક્ષસની અને ભૂતપ્રેતની કે બીજી વાતો પોતે પણ ભીતાં ભીતાં કરે છે, ત્યારે ભાગક તેમાંથી ભીતાં જ શીંચે છે.

ભાગકમાં બીક સ્વાભાવિક છે. પરવશતા અને અજ્ઞાન એ આનાં કારણે છે. એનો ઉપાય કરવાને બદલે જિલદું જ્યાં ખરેખર બીકનું કારણું નથી હોતું લાં પણ આપણે જ બીજે ભાગકમાં બીકનું આરોપણ કરીએ છીએ. તેમાં આપણે ભાગકને તુકસાન કરીએ છીએ. વીજી નીકળે લારે “વોય બાપરે!” એમ કરીને આપણે ભાગીએ નહિ ને પગ ધુલવતા આધે જિમા રહીએ નહિ, પણ તેને ઝડપ દઈને સંભાળથી સાંખુસીથી પકડીએ તો ભાગક સમજુ લેશે કે એમાં કશું બીવા જેવું નથી; માત્ર સાવચેતી રાખવાની જરૂર છે સિંહ, વાધ કે સાપ : જેનો ભય રાખવાની જરૂર છે તેની સામે પણ નીડરપણે કેમ થઈ શકાય તેની વાત કરીએ, આવા પ્રસંગે રક્ષણુંની સંભાળ લઈ નિર્ભય વર્તન બતાવીએ, તો ભાગક ખરેખર ભયમાં પણ બીધા વિના રક્ષણું કરતાં શીખશે. રાક્ષસ સાથે લડીને બળ હોય તો તેને પણ મારી શકાય, એવી રીતમાં રાક્ષસની વાત ભાગક પાસે આવે તો તે રાક્ષસની બીકમાંથી જિગરે દુંકમાં જે પ્રસંગેએ ખરેખર બીવા જેવું નથી હોતું તે તે પ્રસંગેએ આપણા વર્તનથી ઘણી વાર ભાગક બીતું થઈ જાય છે. તેમ ન થાય તે માટે આપણે કાળજુ લેવી જેઠાંએ. ઉપરાંત સહીસવામતીની ખાતર જ્યાં જ્યાં કાળજુ રાખવાની છે લાં ત્યાં નિર્ભયપણે કાળજુ કેમ રખાય તેનો વિચાર ભાગકમાં મૂકીએ તો ભાગક ખરે

વખતે બીકણું થઈને નાસ્તો જવાને બહદે, અથવા ભયને શરણે  
જઈ પડવાને બહદે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.



[ ૧૬ ]

ભૂખલપણું

આલમંહિરમાં મારા પરિચયમાં ઘણું બાળકો આવી ગયાં.  
કેટલાંએક મેં એવાં જેયાં કે જેમને નાસ્તો ખાવાની ગરજ  
જ ન હોય; આપણું તેમને બોલાવીએ તો પણ આવવાની  
પરવા નહિ. તેઓ એ વર્ગમાંનાં તો નથી જ કે જે જુદાં  
જુદાં કારણોથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત બીક  
કે ધ્યાન વખતે થતા અંધારાનો અણુગમેં વગેરેથી જમવાના  
ઓરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં  
માંદાં બાળકો માંછેનાં પણ નથી. માંછગી શરૂ થવાની હોય  
તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે  
નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વર્ગનાં  
બાળકો પણ નથી કે જેમને વૈરથી કહેવામાં આવ્યું હોય કે  
અલડાઈ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઈશ નહિ.

આવાં એપરવા બાળકો ઘણું થોડાં જેવામાં આવે છે;  
છતાં તેનો એક ચોઝુસ વર્ગ તો લાગે જ છે. એ વર્ગને  
ખાવાની તૃણણા નથી માટે જ તે ખાતો નથી. તેને મન  
પોતાનું પેટ લરેલું છે તે ધારે છે કે વૈરથી ખાઈને આવેલ  
હું; વેર જઈને નાસ્તો ખાવાનો છે; આમાં શું છે ? આ

વર્ગમાં કેવળ શ્રીમંતનાં ભાગકો જ છે એમ નથી; ગરીબનાં ભાગકો પણ છે.

ભાગકોનો એક બીજો વર્ગ સાવ એટલો બધો બેપરવા નથી. તે જમવાને વખતે હાજર થાય છે મંત્ર આલાય છે તે વખતે જ ખાય છે. આજે નવું ખાવાનું શું છે તે રકાણી ઉપાડીને જેઈ લીધા પછી તેનું ધ્યાન ખાવામાં નથી રહેતું. આ ભાગકો ઓરડામાં ચાલતી કસરત, વાતો, વાર્તા, આદર્શવાચન, વગેરેમાં લક્ષ્યપૂર્વક રસ લે છે. તેમને પીળ રમતો કે કામ ગમી ગયું હોય છે તો તેઓ ખાવામાં મોડાં પણ થાય છે; વખતે ખાવામાંથી રહી જવાય કે ખાવાનું ન મળો તો તેઓ એસ્ક્રિપ્ટ રહે છે. મોડાં થવાની બીક રમત કે કામ ઝટપટ પતાવતાં નથી. વખતસર હાજર થવાય તો ઠીક છે; ખાવાનું આધું તો યે ઠીક ને રહી ગયું તો યે ઠીક.

વળી એક વર્ગ જેવો પણ છે કે જેને ભૂખ લાગે છે; ખાવાનું ભાવે છે. વખત થાય છે ત્યારે ખાવાનું સાંભરે છે, ને સાધારણ રીતે ખાવાનો વખત ન ચૂકવો તેવી નેમ ધરાવે છે. આ વર્ગ વખત થતાં હાથમેં ધોઢિને બારણૂં પર હાજર થાય છે. શું પીરસાયું છે તે જાણ્યા પછી ખાવાનું મળવાનું તો છે જ એવી ખાતરી હોવાથી ચાલતી રમતગમતો ને વાતચીતોમાં ધ્યાન રાખે છે અથવા તે ન ગમે તો વાતચીત કે ગડબડ કરે છે. તેઓ વધારે પીરસાય છે તો ખુશીથી લે છે; વાદે વાદે વધારે પણ લે છે. કોઈ ‘અમને’ એમ જોવે છે તો આ વર્ગ ‘અમને, અમને’ એમ પણ જોવે છે. પરંતુ તેમને જે દિવસે ‘ખાવાની રજ’ હોય છે તે દિવસે આધાત પહોંચતો નથી. તેઓ ખાવાનો વખત થયો. કે નહિ તેની પૂછપરછ નથી કરતાં. શું આવ્યું છે તે જાણવાની ખાસ કાળજી પણ નથી

રાખતાં. ધારા કે તેમને ખાવા ન આપ્યું તો તેઓ નારાજ થશે પણ હુઃખી નહિ થાય; તેમને ખાવું ગમે છે પણ તેઓ ખાવા પાછળ નથી. વધારે મળશે તો તેઓ પણ ખાશે, પણ વધારને માટે મનમાં વિચાર રાખી પાછળથી નિરાશ થશે નહિ.

વળી એક ખીને વર્ગ પણ છે. આ વર્ગનાં ખાળકો ખાલમંહિરમાં નાસ્તામાં શું લાવ્યા છે તેની ખાસ તપાસ રાખે છે. વખતે વખતે ખાવાનું મૂકવાની જગ્યાએ જઈ તે ઉપર કુપાકટાક્ષ કરી આવે છે; જરાક પ્રસ્ત્રતા લઈ આવે છે. સારું ખાવાનું આવ્યું હોય તો તે દિવસે તેમને ઉત્સવ જેવું લાગે છે. ‘આજે જીવેણી છે.’ ‘આજે શુલાખણાખું છે.’ એવી વાતો તેઓ રસથી કરે છે, ને તેવી વાતો ફેલાવવામાં આનંદ લે છે. વળી તેઓ ખાવાની પાસે રહેવા માગે છે, નેથી તેઓ પીરસવાનાં ઉમેદવાર હોય છે; અગર તેમને પીરસવાનું કહેતાં કદ્દી પણ ના પાડતાં જ નથી. ખીનાં ખાળકોની પેઠે પીરસવાની ગોડવણુમાં તેમને થોડો જ રસ છે; ખીનાં કેટલાંએકની પેઠે પીરસતાં શીખવામાં-જેમ કે દૂધનું એક ટીપું ન પડે તેમ પીરસવું વગેરેમાં તેમને ખાસ મજા નથી; તેમની મજા નાસ્તો જેવામાં, તેનું નિકટત્વ સાધવામાં, ને કદાચ લાગ આવે તો ગળયું મોઢું કરી લેવામાં છે. ખીનાં પેઠે તેઓ ખાવામાંથી ગેરહાજર તો ભાગ્યે જ રહે છે. તેમને ગેરહાજર રાખવાં એ જ તેમને માટે જે દંડ કરવાનું હોય, તો દંડ ગણ્યાય. એ વર્ગમાંના એક ખાળકને એક વાર ખીનાંએથી જુડું પાડીને મૂકવામાં આવ્યું. જ્યાં સુધી તેને નાસ્તો મહ્યા કર્યો ત્યાં સુધી એકાકીપણુંની રપણ્ણતા તેના મગજ ઉપર એકી નહિ; પણ જ્યારે તેને નાસ્તો આપવાનું બંધ કર્યું ત્યારે તેને એકાકીપણું ભારે લાગ્યું.

આ વર્ગ જમવાનો વખત લાગ્યે જ ચૂકે. ‘જે આટલું ભણી આપે તે જમે.’ એવું ઠરાવ્યું હોય તો તેઓ જરૂર જ્યાં સુધી જમવાનો વખત થાય લાં સુધી ઊચું માથું કર્યો વિના લણ્યા જ કરે કામધંધો ન હોય માટે જ જમવાના ઓચડા આગળ તેઓ એકઠાં થતાં નથી, પણ કચારે નાસ્તલેગાં થઈએ એવું એમના મનમાં હોય છે. તેઓ બીજાની પેઠે એકલાં એકલાં પીરસતાં હોય તો છાનુંમાનું જરાક મેંમાં નાખ્યાના દાખલાએ પણ છે. જમતી વખતે તેઓ રાંકના ગોળ જેમ ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે. કોઈ વાર જહેર તો કોઈ વાર ખાનગી ઉઠંગી પણ કરે છે. જમતી વખતે મારી પાસે એઠેલી એક છોકરીએ મારી નજર બિને ગઈ ત્યાં મારી રક્ષાખીમાંથી પેંડા ઉપાડી લીધેલો ! બીજુ વધારે ખુદ્ધિવાળી છોકરીએ ઉપરથી તો કામ કરવાનો હેખાવ કરી જમેલાં વાસણેં ઊચ્ચકવાનું રાખેલું, પણ અંદરનો હેતુ તો એંડો ચેવડો ખાવાનો હતો ! બેશક છેક નાનાં અને નવાં બાળકો જેઓ એંધાજૂઠામાં કશું સમજ્યતાં નથી, તેઓ શીંગ લેવાનું કરે છે; કોઈના ખ્યાલામાંથી અથવા નીચે પડેલી કે કોઈના હાથમાંથી આંચડીને ચીજ ખાઈ જાય છે. વળી જેઓ એકાદ ગમતી વસ્તુ પાછળ જ છે—નહિ કે જેએઓનું મન જે હેઠે તે ખાવામાં ભટક્યા કરે છે, ને જ્યાંથી લાગ આવે ત્યાંથી ખાવાનું જ કરે છે — તેવાં બાળકોને આપણે જુદાં પાડીએ છીએ. તેમને વિષે અહીં કશું જ કહેવામાં આવ્યું નથી.

ચેલી મારી પાસે એઠેલી છોકરી જ્યારે મારો પેંડા ખાઈ ગઈ ત્યારે મને મારું લાગ્યું. છોકરી સારી હતી; હેતાળ હતી. મને તેની દયા આવી. છતાં મેં જે બધાંની હેખતાં તેની જરા નાલેશી કરી, ‘આ ખરાબ !’ એમ મેં કહ્યું, એ પણ અયોધ્ય જ હતું એમ મને પાછળથી લાગ્યું. એ ને હું માંઠી

જ ગણુ'. એની મારે માનસિક દવા કરવી જોઈએ એમ લાગે છે. રોગનું કારણ અંદર હોય ત્યાં બહારથી વઢવું શા કામતુ'?

બીજુ છોકરી ને ચેવડો ખાઈ જતી હતી તેની સાથે મેં વાતચીત કરી ત્યારે મને જણાયુ' કે તેને ઘરમાં પૂરું ખાવાનુ' મળતુ' નથી; ખાવાનુ' આપે છે તો થોડું થોડું, અને 'હે આડા થશો!' 'હે બહુ ખાય છે!' એમ કહીને આપે છે. છોકરી વાત કરતાં કરતાં હિજરાઈ ગયેલી ને આંખમાં અગાર્જિયાં આવી ગયેલાં. તે જ્યારે કામમાં લાગેલી ન હોય, એચેન કરતી હોય, કોઈના તરફ ચિડાતી હોય ત્યારે હું તેને પૂછું: "આજે જમી છો?" મને અચૂક જવાબ મળતો : "આજે બા વહી છે ને ખાવા નથી આપ્યુ'" બધી અચ્ય-વસ્થાનુ' કારણ કચાં છે તે હું તરત જ જાણી શકતો.

ઉપચાર તરીકે મેં એને એ ખ્યાલા પિરસાચ્યા, પણ તેણે એ ખ્યાલા એક જ દિવસ ખાધા; બીજે દિવસે તે શરમાઈ. બીજાં બાળગોએ તેના મનમાં આ શરમ નાખેલી. શરમની મારી તે મંહિરમાં ખાતાં અટકી, પરંતુ તેની મૂળ વૃત્તિ તો ત્યાં જ રહી. શરમભરમથી બહુ બહુ તો ઉપરનું કણ આવે; તેથી તો ઉપરનો ખરો માણુસ ઊડો જાય. એટલે વિકૃતિ અંદર જતાં તેને સુધારવાની કે સુધરવાની તક દિવસે દિવસે આછી થાય. ધીમે ધીમે માણુસ પોતાની વૃત્તિને પિછાનવાનુ' પણ ભૂલી જાય, અગર બહારથી ફાબાઈને સંતાઈ ગયેલી વૃત્તિને સંયમિત થઈ ગઈ છે એમ માની લે; જ્યારે પેલી વિકૃત વૃત્તિ તો એક અથવા બીજે રૂપે પાછી રોગ અનીને ઝાટી નીકળવાની જ !

પેલા લાઈબંધ જેને એકાકી કરવામાં આવ્યા હતા તેઓ એ દિવસ પહેલાં એંડા ખ્યાલામાં પડેલી 'જલેણી' સામે

ભૂખની આંખથી જોઈ રહ્યા હતા; કોઈની નજર ન હોય તો ઉઠાવી લેવાની તૈયારીમાં હતા એટલામાં મારી નજર પડી ને ભાઈ ખસીને ચાલ્યા ગયા !

આ અતૃપ્ત મંડળી જ્યારે મારા એચેરડામાં પીરસવાનું કામ કરે છે ત્યારે તેઓ અટાટ પીરસે છે, વ્યવસ્થા રાખી દેખાડે છે, છોકરાંઓને ઓચરડામાં દૂખલ કરવાનું કામ કરે છે, મારી સામે પ્રસન્ન દેખાય છે અને મને આજાંકિત પણ દેખાય છે. આ બધું મને એચેન બનાવે છે. આવી રીતે પીરસી—કરાવીને તેઓ ખાવાની ઇચ્છા તૃપ્ત કરે છે; અર્થાતું ઘરમાં ભૂખ્યા રહે છે તેને બહલો આવી રીતે મેળવી લઈને કંઈક રાજુ થાય છે. એ જેતાં મનને હુંઘ થાય છે એટલા જ માટે તેઓ પીરસવા હોડે, એમાં પ્રસન્ન રહે, મારું કંધું માને, અને કેળવણીની દાખિયે અર્થાતું આંતર કારણે તેઓ પીરસવું, ગોડવવું, હાથ લેવા, બેસારવું વગેરે ન કરે—અંતરના વિકાસ માટે ન કરે પણ ખાવાની ચીજેની નજીક રહેવા માટે કરે, એમાં કેળવણી નથી, એમાં પ્રગતિ નથી; એમાં બધી જાતની હાનિ છે !

આપણે આપણાં ખાળકોને ભૂખે મારવા નથી જ માગતા. કોઈની તેવી ઇચ્છા હુણ જ ગણ્યાય. પરંતુ આપણે તેમને ઘણુંં જુદાં જુદાં કારણોથી ‘ધરાઈને’ ‘રાજુ થાય તેમ’ ‘હાશ ખાંધું’ ‘પેટપૂરું’ ખાવા હેતા નથી એ વાત ઓઠી નથી.. આપણે તેને પેટપૂરું ખાવા નથી આપતાં તેને લીધે જો ખાળકમાં ‘ભૂખલપણું’ આવે તો શી નવાઈ ?

ખરી રીતે ખાળક ‘ભૂખલ’ જન્મતું નથી. ફરેંડ ખાળકને ભૂખ લાગે છે; ભૂખ લાગે ત્યારે તેને ખાવું જ જોઈએ; ભૂખ ખાવા માટે જ લાગે છે. પરંતુ જે ભૂખને, સાચી ભૂખને

થોરણ ઓરાક પૂરતો ઓરાક આપવાની ના પાડીએ, તેમાં આડે આવીએ તો ભૂખ કે જે તંહુરસ્ત માણુસમાં હોવી જોઈએ અને જે જ્યારે નથી હોતી ત્યારે જીલ્ટી ચિંતા થાય છે, તે જ ભૂખ વિકૃતિ પામીને ભૂખલપણુના રોગનું કારણ થઈ પડે છે. લાગે છે કે બાળકના ભૂખલપણું માટે આપણે પોતે જ જવાબદાર છીએ.

બાળકો હરહું મેશા ખડું ખાતાં નથી; આપણો એ વહેમ છે. તેમ તેણો જાતજાતનાં તે નિત નવાં ખાવાનાંજ માંગ્યા કરે છે એમ પણું નથી. પરંતુ તેણોને થોડી થોડી વિવિધતા-લર્યા, ભૂખ શરીર અને પોષણ મળે તેવા, ને ધરાઈને ખવાય તેટલા ઓરાકો મળે તો બાળકો પોતે જ પોતાનો ઓરાક અને એનું માપ આપણુંને કહી આપશો. તેમને પોતાના જ અનુભવમાંથી ખખર પડશો કે આમ થાય માટે આ ન ખાવું જોઈએ, વગેરે. આરોગ્યદાયક ઓરાકની પસંદગી આપણી પાસે રાગ્યા પછી બાળકની ખરી ભૂખને જે તૃપ્ત કરવાની તક આપ્યા કરશું તો બાળક જરૂર ભૂખલપણું માંથી ખયશે.

છેક નાનાં અણુસમજણુંં બાળકોથી આ પ્રયોગ કરી શકીએ. બાળકો ભૂખલ ન થાય તેની વાત આપણું-માબાપના હાથમાં છે. માબાપો બાળકને ખવરાવવા-પિવરાવવામાં કાળજી લેશો તો ખૂબ ખાઈ જઈને માંદા પડવાના, એંધું ખાઈ જવાના, ખાઉં ખાઉં કરતા ભૂખલપણુના, તે એવા 'રોગ' માંથી બાળકો અવશ્ય સુકૃત થશે.

નાનપણુનો એક પ્રસંગ યાહ આવે છે. મારે ત્યાં મારે એક ભિત્ર મારી સાથે રમવા આવેલો. અમે રમતા હતા એટલામાં મોટી જેન આવીને જોલી : “ લાઈ ! કાકી તને ધરમાં બોલાવે છે.”

હું ધરમાં ગયો અને કાકીએ મને બદામની પૂરી આપી. મને કહે : “ અહીં ખૂણુમાં એસીને ખાદુંદે. ત્યાં બહાર તો તારો ભાઈબંધ છે ”

મારા ભિત્રને મૂકીને ખાવું મને કેમ ગમે ? મેં કહું : “ મારે નથી ખાવું; પછી ખાદુંશ.”

કાકી કહે : “ લે હવે ખાતો જા ને ? અટ કર; વખતે ચેવો બહાર એકો છે તે અંદર આવશે.” કાકીએ ચોવી રીતે કહું કે હું વધારે જોલી શક્યો નહિં અને બદામની પૂરી ખાઈ ગયો.

મારો ભિત્ર તો આતુરતાથી મારી રાહ જેતો હતો. હું ગયો એટલે રાજુ થયો, અને અમે બન્ને રમવા લાગ્યા. અમે થાડુંક રમ્યા; પછી તે ગયો.

આ વાતને વર્ષો વીત્યાં છે. પણ વારંવાર મને એવું થઈ આવે છે કે જાણે હું અટઅટ ભિત્રથી ચોરીને બદામની પૂરી ખાઉં છું ! જાણે હું કાંઈક શુભ રીતે પાપ કરું છું ! મને થયા કરે છે કે કાકીએ કહું તેથી મેં આ શું કર્યું ? મારા ભિત્રને છોડીને એક ચોર બનીને મેં કેમ ખાદું ?

મને વારંવાર મારી કાકી ઉપર રોષ આવે છે. એક બદામની પૂરીના ટુકડા માટે મને ચોર જેમ છુપો રાખી ખવરાવવું? મારા મિત્રને એમાંથી ટુકડો આપવાની ના પાડવી? મારા મિત્રને બીજે ટુકડો આપ્યો હોત તો શી એટ આવી જત?

વર્ષો પછી ગયા અઠવાડિયામાં હું એક મારા સંખારીને ત્યાં ગયો. હતો. બરાબર એવો જ બનાવ બન્યો. મારા મિત્રની લીએ પોતાની નાની છોકરીને કહ્યું : “રધુને અહીં બોલાવ. આ શરખત પી જાય. જે, એમ કહેને કે ઝોઈ તને શાક સુધારવા બોલાવે છે.” રધુ શાક સુધારવા આવ્યોને છુપીથી શરખત પીને ગયો. રધુ છેક નાનો છે; હજુ વિચાર કરી શકે એવો નથી. પણ ઝોઈ તો પચાસ ને પાંચ વર્ષનાં છે. તે જૂહું બોલ્યાં અને જૂહું કર્યું, તથા રધુ પાસે કરાયું!

મને થયું : “ચાળીશ વર્ષો વીતી ગયાં છે છતાં હજુ એની એ જ સ્થિતિ છે. જેવાં કાકી હતાં એવાં જ ઝોઈ છે!”

અને મને વિચાર આવ્યા : “વર્ષો પછી પણ એમ જ રહેશે. કાકીની અને ઝોઈની શાળાઓ ચાલુ જ છે; અને એ નિશાળે રધુ અને ચંપા શીખ્યા જ કરે છે લલેને નિશાળમાં સાચું બોલવું ને સાચું કરવાના પાઠો ભણાવવામાં આવે? લલે ને શિક્ષક સુધાં પ્રભાવશાળી અને શીલવાન હોય? પણ એનું શિક્ષણ નકારું જવાનું. કાકી અને ઝોઈ, કાકા અને મોટાભાઈ, મારી અને મામા, સહુ નાનાં બાળકોને જ્યાં સુધી આમ છુપાઈને મિત્રને છોડીને ખાવાનું તેમ જ ખવરાવવાનું શિક્ષણ આપે છે ત્યાં સુધી નૈતિક શિક્ષણના,

ધાર્મિક જીવનના, સત્ય વચ્ચાર અને આચારના ઉપદેશો નિર્ણય કરું છે !”

મને કહેવાનું મન થાય છે : “ એ માતાઓ અને પિતાઓ ! એ દાઢીઓ અને કાકીઓ ! કયાં સુધી તમે તમારાં બાળકોને જૂઠાણું શીખવશો ? એ જૂઠાણાના પાપમાંથી તમે કયે લવે છૂટશો ? જૂઠાણું અને છળ કરી-કરાવી તમે બાળકોને લાવિ પ્રજાના આત્માને કયાં સુધી કાળો કરશો ? ”



[ ૨૧ ]

શામજીભાઈને ઘેર

થાળીઓ નખાઈ, પાટલા સુકાયા, પાણીના લોટા ભરાયા અને કહેવામાં આવ્યું : “ ચાલો જમવાનો વખત થયો. ”

શામજીભાઈને લ્યાં આજે ચંપા અને તેની બા મહેમાન હતાં.

શામજીભાઈ અને શાંતાયેનને ત્રણ બાળકો હતાં : એક છોકરો ને એ છોકરીએ.

શામજીભાઈએ ઈશારેથી પોતાનાં ત્રણ બાળકોને પાટલા પર એસવા કહ્યું. તેઓની પાસે ચાંચો પાટલો ચંપાનો હતો.

ચંપા કહે : “ બા ! હું તો તારી પાસે જ એસું ; ત્યાં નહિ એસું. ”

ચંપાની બા, શાંતાયેન, ગૌરી વગેરે મોટાંના પાટલા એક બાળુએ હતા અને બાળકોની મંડળી જુહી હતી.

ચંપાની બાએ કહ્યું : “ ચંપા ! ત્યાં સૌની સાથે બેસીએ. જે, આ લાઈ-બહેનો કેવાં બેઠાં છે ? તારો પાટલો ત્યાં જ છે.”

“ ના. એ...હું તારી પાસે જ બેસીશ ! તારી પાસે; એ....તારી પાસે !”

“ મારી પાસે જગા નથી; ત્યાં જ બેસલું પડે.”

“ ના. પેલો પાટલો છે ત્યાં હું બેસીશ.” ચંપાએ હઠ લીધી.

એ પાટલો ગૌરીબેનનો હતો. શામજુલાઈએ તોડ કાઢયો : “ ચંપાબેન ! તારે તમે તમારી બા પાસે બેસો. ગૌરીબેન ! તમે ચંપાની જગાએ આવો ને ?”

જગા બહલાઈ. ચંપાની બાના મનમાં સારું ન લાગ્યું. ચંપા સામે તેણે નારાળુથી જેચું પણ નારાળ દખાવી. તેના મનમાં થયું : “ આ ટેવ સારી નહિ.”

પિરસાવા માંડયું. ચંપા કહે : “ બા ! તું પડિયો થાલી રાખ.” “ બા ! આ શાક સરખું કરી હે.” “ બા ! આ પૂરી સરખી ગોઠવી હે.” “ બા જેને, રાઈતાનો રેલો ચાલ્યો, ખંડું લૂધી હે.”

બા કહે : “ ચંપા ! જે, પેલાં ખાળકો કેવાં પોતાની મેળે કરે છે ? તું પણ કરી શકે. તું તો પેલી હવીથી અને રમુથી જરાક મોટી છે !”

ચંપા કહે : “ તે તું કરી હે ને ? તને કરતાં કયાં નથી આવડતું ? રોજ તો કરી જ હે છે.”

ચંપાની બા શું ભાલે ? પણ મનમાં થયું : “ ચંપામાં આવી ટેવો ન જેઠાએ. મારે તેનો ઉપાય લેવો જેઠાએ. મારા

વિના ચાલે નહિ, હું કરી દઉં તો જ ચંપા રાજુ ને મારા  
પર જ આધાર, એ સારું નહિ. ”

કેળાં આન્યાં, ચંપા કહે : “ બા ! મારે એ જેશે મારે  
એ... મારે એ ! ”

સૌને એક એક મૂક્યું હતું.

બા કહે : “ એ તો સૌને સરખાં જ હોય. ”

ચંપા કહે : “ ત્યારે તારું કેળું હું ખાઈશ ”

બાએ જરા કડકાઈથી કહ્યું : “ એમ ન થાય; તારું તારે  
ખાવું ને મારું મારે ખાવું. ”

“ એ...એમ કાંઈ હોય ? મારે તો એ કેળાં ખાવાં છે.  
નહિ આપ તો તારું ઉપાડી લઈશ ને ખાઈશ. ”

ચંપાએ કેળું ઉપાડ્યું, પણ શામળુભાઈએ બીજું  
મંગાવ્યું ને ચંપાને એ કેળાં મળી ગયાં.

પણ ચંપાની બા તો ખૂબ શરમાયાં; મનમાં લાજ  
અર્યાં !

પેલાં છોકરાં તો શાંતિથી એઠાં એઠાં વાતો કરતાં હતાં;  
ઝીણું ઝીણું હસતાં હતાં; જે આવતું હતું તે ગોઠવીને  
મૂકતાં હતાં.

જમવા લાગ્યાં એટલે ચંપા કહે : “ આ તો મને તીખું  
લાગે છે; તું લઈ લે. ”

બા કહે : “ તું તારા ભાણુમાં જ રહેવા હે. ”

“ પણ મને એ ન ગમે. તું લઈ લે, નીકર પછી હેઠે  
નાખીશ. ”

ચંપાની બા કંઈ બોલ્યાં નહિ ને ચંપાએ શાક બાની થાળીમાં નાખ્યું.

ચંપાની બા મૂંઝાતાં હતાં શામજીભાઈનાં છોકરાં સુંદર રીતે ખાતાં હતાં, ન લાવે તેને અડતાં ન હતાં. અને અંદર અંદર વાતો કરતાં હતાં.

શામજીભાઈ, શાંતાબેન અને ગૌરી વાતો કરતાં હતાં; ચંપાની બા પણ તેમાં લાગ લેતાં હતાં.

ચંપા કહે : “ બા ! મારી વાત તો સાંભળ ? તું મારી વાત તો સાંભળતી જ નથી ! ”

ચંપાની બાએ ધ્યાન ન આપ્યું એટલે તો ચંપાએ એંઢો હાથ બાને લગાડી કહ્યું : “ મારી વાત સાંભળવી છે કે નહિ ? ”

ચંપાની બા જરા ખસિયાળી પડી. તેને થયું : “ આ છોકરી તે કેવી થઈ છે ! ”

શામજીભાઈ ચતુર હતા. તેમણે છોકરાંઓ સાથે વાતો માંડી ને ચંપાનું તે તરફ ધ્યાન ગયું એટલે બાની સુશકેલી રણી.

ચંપાની બાને થયું : “ આપણે કાં તો કોઈને ત્યાં જમવા ન જહું, ને કાં તો ચંપાને સુધારવી. ” વળી મનમાં ગણગાળી : “ પણ એમાં ચંપાનો શો વાંક છે ? જેમ ઘરમાં મારી પાસે અને એના બાપા પાસે રોજ જમતી વખતે કરે છે, તેમ અહીં પણ કરે છે. જેવી ટેવ પડી છે તેવી હેખાય છે. હવે હું કંટાળું કે આંખ કાઢું તેમાં શું વળે ? ”

ચંપાએ જમતાં જમતાં ઐ હાથ એંઢા કરી નાખ્યા હતા; દાળના છાંટા જ્યાં ત્યાં પડવા હતા; હાથનું ડેખું આવ્યું

હતું તે એક વાર તો પડિયો જ ફળી ગયો હતો, ને થાળી આખી ગંધી ગંધી થઈ હતી ! મોઢું પણ ઠીક ઠીક બગડયું હતું.

ચંપાની બા તો પેલાં છોકરાં સામેજુએ ને ચંપા સામે જુએ.

જમીને ઊઠયાં. ખીલાં છોકરાં નળે ગયાં; હાથ ધોયા, મોં ધોયું, કોગળા કર્યા ને હાથ લુછયા.

ચંપા તો કહે : “એ બા હાથ ધોવરાવને ?” અને પછી રમાલ હાજર હતો છતાં પોતાના પોલકે જટ ફૈને હાથ લૂછી નાય્યા.

શામજુભાઈ આ બધું જેતા હતા. બોલવે ઠાવકા હતા; ચંપાની બાની મૂંઝવણું પણ સમજતા હતા. એ એના મામાની દીકરી થતી હતી.

જમ્યા પછી સૌને માટે પાન-સોપારી આવ્યાં. ચંપાએ મૂઠો લરી ધાણું ઉપાડ્યા, ને એ પાનનો રૂચ્યા માર્યો; પણ પછી ડ્યૂરો વળ્યો. ને ચંપાની આંખો ને ગાલ લાલ લાલ થઈ ગયાં.

ચંપાની બાને આજે વધારે એસવું ગમતું ન હતું. તેણે અટઅટ શામજુભાઈની રજ માગી, ને વેર જવાની તૈયારી કરી.

શામજુભાઈ કહે : “એસ એસ ! આ ચંપલી બહુ કુબરાવની લાગે છે, ખરું ? ”

ચંપાની બાની આંખમાં આંસુ આવ્યાં.

શામજુભાઈએ કહ્યું : “ને એન ! એ તો બાળકેને નાનપણુથી વ્યવસ્થિત થવાનો રસ્તો બતાવીએ અને પહેલેથી આ આમ થાય, આ તેમ થાય, આમ એસાય, આમ ખવાય,

આમ હાથ ધોવાય, એમ કરી ખતાવીને કરવા દઈએ, અને શરૂઆતમાં તો જેવું થાય કે કરે તેવું ચલવી લઈએ, તો જ બાળકો ધીરે ધીરે આવું બધું તેં નજરે જેચું તેમ કરતાં શીખી જાય છે. આને હું ભોજનનો આચાર કહું છું. બાળકો જમતી વખતે વ્યાંઘાટ કરે, વારે વારે રડી જઠે, અહીં ન ગમે ને ત્યાં ન ગમે, કાં તો બાની ને કાં તો બાપાની પડે ઘૂસે, એ બધું નથી ગમતું ને આપણે એમ કરવા દઈએ છીએ એટલે તો થકવી નાણે છે! મેં તો પહેલેથી જ રિવાજ કાઢ્યો છે કે આ પાટલાએ નાનાના, આ થાળીએ નાનાની, આ એમની જગા, આ એમના ચમચા, આ એમની ટખૂડીએ, અહીં હાથ ધોવાનું, આ એમનો રૂવાલ વગેરે, અને એમને મારે જે બધું મેં રાખ્યું છે તે તેમને માર્કાનું, તેએ ઉપાડી શકે તેવું ને તેમને ગમે તેવું રાખ્યું છે.

“ જમતી વખતના નિયમો પણ આપ્યા છે. ડોઈ ચીજ આવે તો લેવી હોય તો આંગળી ભાચી કરે; ન ભાવતું આવી જાય તો પાસે જ એક રકાણી રાખું છું તેમાં મૂકે; વગેરે. અનુભવથી વ્યવસ્થાના જે નિયમો ઠીક લાગ્યા છે તે રાખ્યા છે. બધું જોહુકમીથી કરાવવાનું નહિ; ન કરે તેને ફંડ પણ નહિ; પણ તેમને રોજ રોજ તેમ કરવા દઈને, ને રોજ ને રોજ કરવાની ટેવ પાડીને શીખવા દઉં છું. તેમને હું એટાં લાડ લડાવતો જ નથી. એટી રીતે તેમની માગળી કે એવું હોય છે ત્યારે તે વખતે ધ્યાન આપતો નથી; પણ તેમની સુશકેલી સમજ ઓને દિવસે એનો નિકાલ આણું છું.

“ હું બાળકો સાથે વાતો કરવાની ને તેમને સમજવાની તક લઉં છું; તેમનાં નાનાં સુખહુંએ ઉપર ધ્યાન આપું

જું; તેમને માટે ચિંતા રાખું જું. પણ તેમને મારા જેવાં સ્વાધીન અને સ્વતંત્ર તેમ જ આનંદી બનાવવા મહેનત કરું જું.”

ચંપાની બા કહે : “ત્યારે, લાઈ! હું તારે ત્યાં થોડા દિવસ રહેવા આવું ને તું કેમ ચલવે છે તે નજરે જોઈ, તો ખબર પડે.”

શામજીભાઈ કહે : “ભલે, આવતે અઠવાડિયે જ આવ ને રહે. ઘર તો તારું જ છે ને !”

ચંપાની બાનું હૈયું કંઈક હેઠે એહું.

\*

[ ૨૨ ]

તું સાંભળતી નથી

“ બા હું તને પીરસવા માટે જીણી જીણી ઘણી બાબતો કહું જું પણ તું સાંભળતી નથી; ને પછી હું પૂરું ખાધા વિના જિઠી જઈ જું જું ” જમતાં જમતાં નાની લલી કંટાળા સાથે લાચારીથી બોલી.

નાની લલી સાત વર્ષની છે, પણ તેની બુદ્ધિ તેજ છે. તે જીણી જીણી વાતો સમજે છે, ને બધું ભાષા કારા વ્યક્ત કરે છે.

નાની લલીને બીજાં ચાર ભાંડરડાં છે. ચાર ભાંડરડાં અને એક પિતા બધાં સાથે જમવા એસે છે. બાના મનને રહે છે કે જેની જેની ખાખરી કરતી જઈ અને સૌને જેનું

ખવરાવતી જાઉ; એમ પણ છે કે સૌ સાચે બેસે અને આખું ધર વાતો કરતું જાય એ સારું લાગે. પણ જમવાવાળાંએને ઘડીક આ જેઠાંએ ને ઘડીક તે જેઠાંએ; વારાફરતી કંઈ ને કંઈ માર્ગયા જ કરે. એકલી બા સૌને પહોંચી બળવા ધારણા રાખે, પણ ગરમ ભાખરી કરતાં જવું ને પીરસતાં જવું એ બંને અટાડટ ન જ થાય. આવા સંજેગોમાં-નાની લવીએ ઉપલા શાખદો કાઢ્યા.

જમવાના, વાતોના અને રસોઈના વોંઘાટમાં-અવાજમાં આ શાખદો કોણું જાણે બીજાએ સાંભળ્યા હોય તો; પણ મેં એ સાંભળ્યા ને મારો મનમાં ભરાઈ ગયા.

હું વિચાર કરવા લાગ્યો : “આનું શું કરવું ? સાચેજ લવી બા પાસેથી કંઈ ને કંઈ જીણું જીણું માગતી હોય છે; પણ માટાંએની વાતોમાં કાં તો બાને કંઈ સંભળાતું નથી, ને કાં તો બાનું ધ્યાન જ બીજે હોય છે. બાને માર્ક કરી શકીએ પણ લવીની સુરક્ષકી ફૂર કેમ થાય ? ”

એક વિચાર એમ આવે છે કે બાએ અગાઉથી બધું રંધી રાખવું ને પછી બધાંને નિરાંતે પીરસવું. બા કહેશે : “પણ ગરમાગરમ રોટલી કે ભાખરીનું શું કરવું ? ” હું કહું કે કાં તો એટલી ચૃપળતા કેળવો કે બધે ધ્યાન આપી શકાય, અને કાં તો જરાક ઠંડું ખાવાનું-ખવરાવવું પસંદ કરો. જમતી વખતે રસોઈ સારી અને ગરમાગરમનો પ્રશ્ન મહત્વનો છે તેથી યે વધારે મહત્વનો પ્રશ્ન બાળકો તે રસોઈ ધરાઈને ખાય, અર્થાતું તેમને એવી સરસ રીતે પીરસવામાં આવે કે તેમને ખાવાની તૃપ્તિ મળે, તે છે. બાને ધેર રસોયો હોય ને બા ગરમાગરમ પીરસવાની વ્યવસ્થા કરે તો લવે ગરમ રસોઈ આપવાની તેની ઈચ્છાને પાર પાડવા

દ્વારા. ( અગર જોકે બહુ ગરમ રસોએ ખાવા—ખવરાવવાની ટેવ હાતને નુકસાનકારક છે, ને તે વધારવા જોવી નથી.) પરંતુ નહિતર તો બા ચૂલે ગરમ રાખી મૂડેલી રસોએ સૌને હેતપ્રીતથી સૌની માગણી પ્રમાણે પીરસે એ જ સારું છે. એક વિચાર એવો છે કે બાએ રસોએ તૈયાર કરવી ને પછી તેણે પણ સાથે બેસલું ને સૌએ સાથે જમલું. નાતું એવું કુટુંબ હોય તો બા એઠી એઠી પીરસે અને ખીંદાં આજુખાજુ જમે. બાને પીરસલું ગમે છે કારણુંકે તે બા છે, કારણુંકે તે પોષણ આપનારી છે. બાળકોને—જગત આખાને પ્રથમ તે પોતાનામાંથી પોષણ આપે છે. એ જ અન્ધાતા, અજ્ઞપૂર્ણા મા સીધી રીતે નહિ તો રાધી—પીરસીને આપણને પોષવાની વૃત્તિ તૃપ્ત કરે છે; એમાં તે પ્રસન્ન રહે છે; એમાં તે પળે પળે માતૃબની સંપૂર્ણતા કેળવે છે અને તેનો આનંદ અનુભવે છે.

જેમ બાને ધવરાવતાં ધવરાવતાં ખાળક ઉપર ઉમળકો આવે છે ને ધાવણ અમૃતરૂપ થાય છે, તેમ પીરસતાં પીરસતાં બાતું હૈયું કેળે છે અને તેના મનમાં આનંદના ઉમળકા આવે છે. એમ કહેવાય છે કે ભવે રોટલો ને મીઠું પણ બા ખવરાવતી હોય ને વાંસા ઉપર હાથ ફેરવતી જતી હોય, તો છોકરાને શેર લોહી ચડે છે! ખવરાવતી વખતે બાળકોને પંપાળવાની—ચાટવાની કુદરતી ટેવ ઢોરોમાં પણ છે. બાને પીરસવાનો—ખવરાવવાનો હક બા પાસેથી હુરાયહથી છોડાવવો ઠીક નથી; બાની જગ્યા રસોયો લઈ કે ને બા માત્ર એક જમનારી શેઠાણી થઈ એસે એવું બાને ગમે તો બાતું બા—પણું એછું થાય છે કે નહિ તે વિચારવા જેલું છે. છતાં તે પ્રક્ષનો વિચાર બાને જ સેપીએ. એમ જ,

બા માત્ર લહિયારી બની જાય અને બાળકો માત્ર જમનારાં થઈ પડે એ પણ સારું નથી; એ ખરાખ જ છે. રસોઈ રસોયો કરી શકે, પરંતુ આનો પીરસવાનો—ખવરાવવાનો હક કાયમ રહેવો જેઠાં.

એવું પણ જેવામાં આવે છે કે બા રસોઈ કરતી નથી; અગર કરે છે તો જમવા પહેલાં. જમવાને વખતે બા એક મધ્યસ્થ વ્યક્તિની જેમ બિરાજે છે, ને પોતાની પાસે તમામ વાનીઓ રાખી પીરસતી જાય છે અને જમતી જાય છે. સાથે જમવાના આનંદને તે ગરમાગરમ રોટકી ઉતારીને આપી હેવા કરતાં વધારે ગણે છે, અને સાથે જ તેમ છે. બા સાથે જમે, જમતી જમતી હેતથી પીરસતી જાય, નવી નવી વાતો કરતી જાય, હસાવતી જાય, એ ચિત્ર પ્રિય લાગે છે. ઘણી સંસ્કારી માતાઓ એ ફેલે બાળકોને જમાડે છે. બા હેખરેખ રાખી રસોઈ કરાવે ને પછી જમતી વખતે અજ્ઞાપૂર્ણું થઈને બેસે એ ઝોટું નથી, પણ સારું છે; એમ થતાં બા પોતાનાં બાળકોને વધારે જીવંત અને ગ્રેરક લાગશે.

કેટલાંએક મોટાં કુટુંબોમાં બાને બીજી ઘણી પ્રવૃત્તિ હોય લાં રસોઈ રસોયો કરે છે; ભવે તેમ થતું હોય બા, બાપા, બાળકો સૌ સાથે બેસે છે અને સાથે વાર્તાલાપ કરતાં કરતાં જમે છે; બાપા કરતાં બાની નજર બાળકોના થાળ પર વધારે હોડે છે; પ્રેમભરી દશ્ચિથી તે બાળકોને પીરસવાનું કે જમવાનું કહ્યા કરે છે. અને જ્યાં રસોયો કુશળ, સલ્ય અને ખાનદાન પીરસનારા હોય લાં તો બા પૌષ્ટિક ખોરાકમાં પોતાની મીठી વાતોથી પૂર્તિ કરે છે, ને એરાક અને પાચનમાં મહં કરે છે. આવું પણ પોસાય ત્યાં કખૂલ રાખવા જેવું છે; એટલું જ નહિ પણ વખાણવા જેવું છે.

વિચારો અંતે એમ હોડે છે કે રસોડામાં બા એક અજાણું વ્યક્તિ ન બનવી જેઇએ. બાએ રસોઈ બનાવવાની ખટપત્રમાં એટલાં બધાં ન પડવું જેઇએ કે નાની લલીઓના શરૂહો તેને સંલગ્નાય જ નહિ; બાએ રસોડામાંથી એટલી હુદે નીકળી ન જવું જેઇએ કે છેાકરાંને માટે રાંધનાર તો રસોચોને જમાડનાર તો આયા અથવા ચાકરડી ! બાએ અને બાપા-એ એ બાબત પર ધ્યાન રાખવું જેઇએ કે મોટાંઓની વાતો આડે બાળકોને કોઈ સાંભળે જ નહિ, અથવા નાની લલી-ઓની ઝીણી ઝીણી વાતો મોટા ઘોંઘાટમાં તો કયાંઈ પડી રહે, એવું ન બની જય !

બાળકોને પહેલાં જમાડી લઈ પછી માણાપોએ જમવું કે કેમ એ સવાલ વિચારવા જેવો છે. કેટલાં એક માણાપોનો શોખ એવો છે કે બાળકો અને પોતે સાથે જમે તે તેમને ગમે. એમાં માણાપોની કુટુંબભાવના પ્રધાન છે. સાથે જમવા એસવું એ એક કુટુંબગત આનંદ છે. જ્યાં બાળકોને અને માણાપોને સાથે એસવાની સારી વ્યવસ્થા હોય, જ્યાં માણાપો જમતી વખતે માત્ર સાથે ખાય એમ નહિ, પણ સાથે જ સાથે જમે - એટલે બાળકોની હુનિયા સાથે ભળી જઈ તેમના આનંદમાં વધારો કરીને જમે, ત્યાં આ રીત સુંદર છે. ઉદ્ઘોગી માણાપો એકીસાથે બાળકોના પ્રસંગમાં દિવસ આખામાં થોડાં આવે છે. ત્યાં જમવાનો પ્રસંગ સૌને એક સામાન્ય આનંદનો બની શકે. બુદ્ધિશાળી અને ભાવના-શાળી માણાપો જમવાના સ્થળને ભારે આકર્ષક અને પ્રેરાણુ-ત્મક બનાવી શકે-બાળકોને માટે શરીરનો તેમ જ મનનો એચાક મેળવવાનું સ્થાન બનાવી શકે.

બાળકોને જમાડી હેવાનાં પણ કેટલાં એક કારણો તપાસીએ. માણાપોને મોડું જમવાનું રહેતું હોય અગર માણાપો સાથે

ઇતર જમનારાંએ હોય, અર્થાતું જ્યારે બાળકોને માબાપ સાથે જમાડવાનું અનુકૂળ ન હોય, ત્યારે બાળકોને વહેલાં જમાડવાનું જરૂરનું છે. બાળકો માબાપો સાથે જ એમ વળગી રહેવાની જરૂર નથી. પણ બાળકોને જમાડવાં એટલે એક ઉપાધિમાંથી સુકત થવું અને પછી નિરાંતે, શાંતિથી આનંદથી ઝડપ મારતાં જમવું, એ ખરાબ વૃત્તિ છે. બાળકો આપણને જમવામાં કનદે છે માટે કાઢો તેમને જુદાં, એ સ્વાર્થદિષ્ટ ત્યાજ્ય હોય તો તો બાળકોને સુન્યવસ્થિતપણે, શાંતિથી, સફાઈથી જમતાં શીખવવાની અને સાથે જ એસવાની આપણી ઝરાજ છે. આપણે માટે જેમ જમવું આવશ્યક કિયા છે, તેમ જ બાળકો પરત્વે સમજવું. ઉપરાંત ખીલાં કારણોસર બાળકો આગળપાછળ એસી શકે છતાં જમવાની વ્યવસ્થા, શાંતિ, બાની પ્રેમપ્રેરણા, બાપાને ઉત્સાહ વગેરે તો તેમને મળવાં જ જેઠાંએ. છતાં બા જમાડનાર હોય ને બાળક જમનાર હોય એમ બનતું અટકવું ન જેઠાંએ. બાની કે બાપાની હાજરી અને હેખરેખ તો અવશ્ય જેઠાંએ જ જેઠાંએ. બાળકો જમે એ ખસ નથી; પરંતુ બાળકો સંસ્કારી વાતાવરણમાં, હૂંઝમાં વાર્તાવિનોદ સાથે જમે એ જરૂરનું છે; નાની લલીની જીણી જીણી વાતો જ્યાં સંભળાય તેમ જમે એ જરૂરનું છે.

નાની લલીના થોડાએક શાખદોએ મારી પાસે જે છૂટાછવાચા વિચારો કરાવ્યા તે અહીં ટાંકચાં છે. માબાપો તે વાંચે અને પોતાના વિચાર ઘડે.

આપણે મોટાંએ ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે વાતો કરીએ છીએ : નાતનતની વાતો, સગાંસંબંધીની વાતો, લેખુદેખુની વાતો, નાનપણુની વાતો, મિત્રઅમિત્રની વાતો, આડેશી-માડેશીની વાતો : તેમ જ સાહિત્યની, કાવ્યની, વજાનની, શાળાની, દવાખાનાની, રેલવેની, કેટલીયે વાતો થાય છે. આપણાં બાળકો આપણી આસપાસ કરતાં હોય છે; તેઓને કાન છે ને સાન પણ છે. આપણે જે બાલીએ છીએ તે બીજડુપે તેમનામાં પડે છે અને વખત મળતાં ખાતર પાણી મળતાં, અનુરૂળ વાતાવરણ મળતાં, તે જરી નીકળે છે.

આપણે માનીએ છીએ કે બાળકો આપણી વાતમાં શું સમજે ? પણ ખરી વાત તેમ નથી તેઓ કેટલીએક વાતો સમજતાં નથી એ ખરું છતાં તે તેમને ચાંચી જાય છે. જે વાત નથી સમજતાં તે વાતોને તેઓ ધણી વાર ચેતે જ ગમે તેવો અર્થ કરી લે છે; ધણી વાતો તેઓ બરાબર માબાપની દશિએ સમજે છે. એટલે કે સાંલળેલું વૃથા જતું નથી; તેની સારીમાઠી અસર થયા જ કરે છે.

જે નાનાં બાળકોને આપણે વાતો કરતાં જેઈશું તો આપણુને આ બાબતની પૂરી ખાતરી થશે. તેઓ એકખીલ વાતો કરતાં જણાશો : “ મારી મા મોાલતી હતી કે ક્લાણી તો ખરાબ છે. ” મારી કાકી કહેતાં હતાં કે પણ ગરનાળું છે ત્યાં એકલાં જતાં તો હું ક્ષાણી જ પડું ! ” “ મારા બાપા મારી બાને વહ્તા હતા ને કહેતા હતા કે શા માટે એને ઘરમાં જ આવવા હીધેં ? એ તો હુચ્ચેં છે. ” આવી અનેક

વાતો બાળકો કરે છે. તેમને તેના ખરાખોટાપણુંની ખખર-અખખર હોતી જ નથી; પણ બધાં બોલતાં હતાં, બધાં બોલનારાં મોટાં હતાં તેથી તે પ્રમાણે હશે, તેમ તેઓ માને છે.

આપણે બોલીએ છીએ તે ઉપરથી બાળકો સામાન્ય રીતે આપણી આસપાસની માણસો તરફ કેમ જેવું, કેમ વર્તવું, વગેરે શીએ છે.

“ ઇલાણીને ઘેર માગવા જઈએ તો હે એવી નથી એને શાનું હેવું ? ” “ ઇલાણીને મોટરનો ગર્વ છે તે મોટરમાં બહુ પહોળી થઈને એસે છે ! ” ઇલાણા તો મારી ખાય છે, ને પછી ધરમ કરે છે; એમાં શું વળ્યું ? ” બાળકો આ સાંભળે છે. તેઓ પ્રથમ એમ બોલવા અને પછીથી માનવા લાગે છે; તેમ માનવા લાગતાં તેમની મનોવૃત્તિ પણ આપણા જેવી જ થાય છે.

ધરમાં બાળકો સાંભળે છે : “ એ આપણે ત્યાં ન પાલવે. આપણે ત્યાં આવવું હોય તો આવે નહિતર રહેવા હે. અહીં રહેવું હોય તો કરવું જ પડશે. ” “ એ તો હું, તે એને રોજ રાંધીને ખવરાવું ને એ બધી પગ ઉપર પગ ચડાવીને એસે ! ” “ એવી નકામી માથાઝીક કરવાની મારે નવરાશ નથી. આવે તો કહેજે કે એ તો બહાર ગયા છે. આજે તમને મળી નહિ શકે. ”

બાળકો સાંભળે છે. એમના કાન કયાં જાય ? તેઓ સમજે છે ને આપણી પાસેથી શીએ છે : શા માટે કોઈને માટે તસ્હી ઉઠાવવી ? શા માટે મદ્દત કોઈને રહેવા હેવું ? ખરાખર લાલનો વિચાર કરવો. શા માટે જૂદું બોલીને સટકી ન જવું ?

ધરમાં વાતો થયા જ કરે છે : “ પેલી છાકડી જેઈ ? સાવ ગાંડા કેવી છે. એને બેસવા-બોલવાનો ધડો ? એની માચે એને બગાડી મૂકી છે.” “ બાપુ ! એરમાન મા હોય તે એને શું ? સાચી મા હોય તો આ હાલ થાય કે ? કોઈની મા મરશો મા.” “ એ રાધવળુની વાત કરો મા. મારા કાન હુએ છે. રેઠિયાર ! કોણું જાણે બાપ હશે કે રાક્ષસ ? છાકરાને કાંઈ ટીએ છે !” બાળકો આ પણ સાંલળે છે, એને વગર મહેનતે વિચારે છે : “ હં, એની મા ખરાબ ; હં, એનો બાપ રાક્ષસ ; હં, એ તો આવો ને એ તો આવો.”

ધરમાં બધાં લેગાં થઈને નાનપણુંની વાતો કરે છે : “ બા ! મને તો કોઈ અડે તો એવી રાડો પાડું, એવી રાડો પાડું કે ગાબ આખું ગજલું. મારા બાપા ફેન્ઝાર, તે અડનારની ધૂળ કાઢી નાએ !” “ મને નિશાળે જવું ન ગમતું, પણ આપણે તો એટું એટું માથું હુખવા લાવીએ.” મારી બા મને મારે નહિ એટલે હું તો એટું એટું. માત્ર એક વાર પકડાઈ ગયો. હતો ; તે પણ એક જ વખત !” છાકરાં તે સાંલજ્યા જ કરે છે ; તેમને ઘણા પાડો મળો છે.

“ મારી અધરણી ન થઈ તે ન થઈ ! એ રાંડ પેલી મારી નણુંદે બધું કર્યું.” “ મારે આ જીવી પેટમાં હતી ત્યારે મારે માચે કાંઈ હુંઘ પડયું છે ! ભૂંડું થને એ સાસુનું.” “ લાઈ ! બાપ તો નાનપણમાં મરી ગયો ને કાકો એ તો કાકો જ ! કાંઈ મારે માચે કરી છે ? હવે કાકો મળો તો સામું પણ ન જેઉં !” નણુંદ, સાસુને કાકા વિષેના વિરોધી ખ્યાલો બાળક લેગા કરે છે.

ધરમાં વાતેનો પાર નથી હોતો. “ એ વળી સામે શું એલે ? રાં...ને એક ડાંગ મારી તે માથું ફાડી નાખ્યું !”

“ ભાઈ ! નવો ન્યાયાધીશ તો ઠીક છે; લાંચ આપે એતું કામ થાય. ન્યાય ન્યાયને ડેકાણે ! ” “ એ વળી આપણું ઘરનું વાડું બોલનાર કોણું છે ? કાલે જઈને કેસ કરું. ” “ એ વકીલ ને વૈદ; એના ધંધા જ એવા. સ્વાર્થના સગા. પૈસા મળે ત્યાં સુધી તમારા. ” બાળકો ધંધાદારીએનો સારો ખ્યાલ લે છે.

આપણે વિચાર કરવો પડશો કે આપણે ગમે તે વાતો બાળકોને કાને પડવા હૃદિશું ? અને નહિ તો આપણી વાત ચીતના વિષયો ફેરફાશું ? ને સૌથી વધારે તો આપણી જગત તરફની દાખિમાં ફેરફાર કરીશું ? અથવા તો વધારે લાગે મૌન રાખીશું ? બાળકોને આપણે વિચાર કરવાની ને સાચું એટું પારખવાની શક્તિ આપીશું ને હુનિયા વિષે અભિપ્રાય બાંધી લેવા છૂટાં મૂકીશું, કે તેમને આપણું જ અભિપ્રાયમાં ઉછેરી તેમના પોતાના અભિપ્રાયેનો નાશ કરીશું ?



[ ૨૪ ]

છોકરાઓને કાન છે

બહારથી કોઈ બેસવા આવ્યું હોય ને નવું સવું હોય તો આપણે સૌ તેની હાજરીમાં વિચારીને બોલીએ છીએ. આમ બોલીશ તો આમ દુખાશો, આમ બોલીશ તો આવો અર્થ થશો, વગેરે વિચારો આપણી વાણીને નિયંત્રિત રાખે છે. આપણે કોઈને ત્યાં ગયાં હોઈએ તો ત્યાં પણ આપણે ઉપરના ધોરણે વરતીએ છીએ.

જ્યારે આપણે આપણા મિત્રો અને કુટુંબકથીલા વચ્ચે હોઈએ છીએ ત્યારે વળી આપણું વર્તન બીજા પ્રકારનું થાય છે. આપણે ધૂટથી બોલીએ છીએ. ઉપરની શિષ્ટતા ને સામાનું સન્માન કરવાનો સામાજિક વિચાર મિત્રો પરતે એછો રહે છે; ને તેથી ઘણી વાતો એવી થઈ જાય છે કે જે ખડારના માણુસો સાંભળવાને તૈયાર ન હોય. અથવા સાંભળીને જરા ચ્યમકે, ગમતરમતની, મશકરીદ્ધાની કેટલાક પ્રકારની વાતો આવે વખતે સહજ હોય છે, ને તે કોઈને આ ચોંચ લાગતી નથી.

મંડળીનું વર્તુળ આથી યે ટૂંકું કરીએ તો ઘરનાં માણુસો રહે. તેઓ વચ્ચે તો ઘણી ઘણી જતની વાતો ચાલે છે. તેમને બીજાંએ શું ધારશે તેની ચિંતા વાત કરતી વખતે એછી હોય છે; તેઓ મોટે ભાગે બીજાંએની વાત કરતાં હોય છે. ખડારનું બંધન એછામાં એછું હોવાથી તેઓ વધારેમાં વધારે ધૂટાં થાય છે. તેમની વાણી ઘણી વાર શિષ્ટતાની પરવા નથી રાખતી. આથી તેઓ ઘણુભરે ભાગે જેવાં હોય છે તેવાં જ વાણીમાં હેખાય છે.

ઘરના માણુસોમાંથી યે જ્યારે મોટાં ભાગકો અને બીજાં નાનામોટાં હુર હોય છે, ખારે સ્વીપુરુષની વાણી જુદા પ્રકારનું સ્વરૂપ લે છે. આ વખતે તેઓ પોતાની ખરી ખાનદાની કે જંગલીપણું વાણી દ્વારા પણ પ્રગટ કરે છે. આ વખતે તેમને કોઈની ભીતિ નથી. તેમને ‘આમ કહેવાશે’ તેવો વિચાર સરખો પણ નથી હોતો. તેઓ મનગમતું, મનમાં આવતું ઝેંકે છે. અતિ ભીડી વાણી પણ આ એકાંતને પ્રસંગે વપરાય છે ને કડવામાં કડવી વાણી ભાટે પણ આ જ પ્રસંગ છે.

આ બધા પ્રસંગોએ આપણું બાળકો તો આપણી આસપાસ હોય જ છે. બાળક આપણી સાથે રહે છે. તે મનુષ્ય પ્રાણી છે; તેને કાન અને સાન બંને છે. તે આપણને ખદ્યો વરમત જુએ છે ને જાણે છે. સંગતિથી તેના પર આપણી છાપ પડે છે.

હવે જ્યારે બાળક જુદા જુદા પ્રસંગે આપણને જુદી જુદી રીતે બોલતું સાંભળે છે લારે પ્રથમ તો તે ભારે મૂંઅવણુમાં પડે છે. હમણું જ ઘરમાં બા-બાપા બાજતાં હતાં; હમણું જ બહારથી બીજાં આવ્યાં એટલે હેતથી વાત કરતાં હોય તેવાં હેખાવા લાગ્યાં ને તેવી વાતો કરવા લાગ્યાં હમણું પિતાશ્રીને શોલે એવી વાણી તેમણે ન વાપરી; નોકર ઉપર કોધ કરતા હતા, પણ આ પેલા લાઈ મળવા આવ્યા ત્યારે તો અત્યારે શાંતિથી-આવનાર ઉપર ગુસ્સે થવાય એવી વાત તે કરતો હતો છતાં પણ શાંતિથી સાંભળતા હતા, ને કશું પણ બોલ્યા નહિ. વિદ્યાર્થીએ આગળ બાપા એક શરણ વધારે ઘટાડે બોલતા નથી; તેમની સાથે હસે છે તે પણ માપીને કે તોળીને; અને આ મારા ઇલાણું કાકા ને ઇલાણું મામા આવે છે ત્યારે તો બોલ બોલ કરે છે, ખડખડ હસે છે. બા હમણું જ નાની ઝોંઘને ઘરમાં તો ગાળો હેતી હતી ને તે આવ્યાં એટલે “આવ્યાં, બા !” કહીને જલ્દી થઈને ચાકળો નાખી હોયા ! પાડેશીની હીકરી એકલી ઘરમાં આવે છે તો બા કે બાપા કહે છે : “ચાલી જા ! અહીં કેમ આવી, અત્યારમાં ? આ જઈને આવી જ છે ! કાંઈ કામ-બામ છે કે ?” પણ જે તે એની બા સાથે આવે છે તો કાકા છે : “અલી ચંપી ! અત્યારમાં કચાંથી ? વહેલી જિઠતી લાગે છે ? લે આવ, તને કંઈક આપુ રોજ વહેલી આવતી હોય તો ટપુની સાથે તને ય કંઈક મળે ના !” બા ને

ખાપા, કાડા ને આમા, રામજીલાઈ ને દામજીલાઈ, સૌ વારે  
વારે જુદે જુદે વખતે કેવું ય જુહું જુહું આલે છે. બાળક  
નજરોનજર સધળું ભાળે છે ને કાનોકાન સાંલે છે. તે  
વિચારે છે : “આમ કેમ ?”

ધીરે ધીરે બાળક પલોટાઈ જાય છે. તે પણ ઘણા વેશો  
ધારણ કરવાનું શીખતું જાય છે. જુડા જુદા માણસો પ્રમાણે  
જુદો જુદો વેશ કરતું જાય છે. મોટાંચોના વિસંવાહી  
જીવનમાંથી તે વિસંવાદનો, દંલનો, ઉપરની શિષ્ટતાનો ને  
અંદરના અપ્રમાણિકપણુંનો પાડ લે છે. પરિણામે જેવાં  
આપણે છીએ, જેવો આપણો વ્યવહાર છે, જેવી આપણી  
સ્થિતિ છે તે બધું આપણે તેને આપીએ છીએ અથવા વધારે  
ખરું તો બાળક તેનું વારસ બને છે. આપણે આ બાયતમાં  
શું કરી શકીએ ? આપણે જીવનમાં એકરંગ-એકરૂપતાના,  
એકતાના સંવાદને ચોણ્ય અને સાચું સ્થાન આપીશું કે  
બાળકોને કાન-સાન છે માટે તેનાથી બધું છાનું જ કરીશું ?  
આપણે ધીમે ધીમે ગમે ત્યારે એ કરીએ ને જીવનનો આ  
પ્રક્રિયા ઉકેલીએ. પરંતુ ત્યાં સુધી આપણે એટલું ચાદ રાખીએ  
કે “છોકરાંચોને કાન છે.”

\* \* \*

“એ રમુ ! તુ કચાં જાય છે ? ”

રમુ કહે : “ નાના કાકા કહે છે કે પેલી બારી નાચે  
છાયો છે લાં રમો . ”

“ લાં નથી જવું ; પેલી ડોટડીના ખૂણા પાસે એસો . ”

\* \* \*

અત્યા રમુ ! અહીં કેમ એઠા છો ? આ ખૂણા પાસે ?  
ચાલો ધરમાં ; પાડ વાંચવા એસો . ”

“ બાચે અહીં રમવાની રજ આપી છે . ”

“ ચાલો ; પાડ વાંચવા એસો . ”

\* \* \*

“ એ રમુ ! પાડ વાંચવાનું અત્યારે કચાં સૂજ્યું ? ચાલ,  
અટ નાહી લે ; જેનું પાણી તૈયાર છે . ”

રમુ કહે : “ બાપુએ પાડ વાંચવાનું કહું છે . ”

“ પાડ પછી વંચાશે ; ચાલો , નાહવા એસો . ”

\* \* \*

‘ એ રમુ ! હમણાં નાહવાનું બંધ રાખ . પેલા ભાઇને  
સારાકાકાનું ધર બતાવી આવ . ’’

“ પણ એન કહે છે કે નાહીને જા . ”

“ ના , હમણાં જા ; પછી નાહનો . ”

\* \* \*

આ પેલી કહેવતવાળું થયું. એક રમુ ને સો રમુ : એટલે કે એક જણું ને સો જણું કહેનારાં !

રમુ નાનો છોકરો; સૌ એનાથી મોટાં. સૌને જાણું કે મોટાં છીએ એટલે જ અધિકાર કે રમુને જે આવે તે કહે ! એ અધિકાર સૌને પણ એવી જ રીતે મળેલો : એટલે કે તેઓ નાનાં હતાં ત્યારે તેમના પણ આ જ હાલ થયેલા.

આમાં રમુનું શું થાય છે તે જેયું ? રમુ એક કામ કરવા બેસે છે ત્યાં બીજું લેવું પડે છે; ને જ્યાં બીજું કરવા બેસે છે ત્યાં ત્રીજું કરવાની વાત આવે છે. રમુનું એકે કામ પૂરું થતું નથી. પછી તેને તેનાથી લાલ અને આનંદ તો શાનાં જ થાય ?

અને રમુનું કામ બગડે એ તો ઠીક, પણ તેનું મન પણ બગડે. એના મનમાં એમ જ થવાનું : “આ તે કોઈનામાં ઢંગધડો છે કે નહિ ? એક આમ કહે છે, ત્રીજું આમ કહે છે ! માણાં બધાં ડાદ્યાં ?”

રમુ નાનો છે એટલે તે રોકડું પરખાવી શકતો નથી, તેમ સૌની ભૂલ સામે સંભળાવી શકતો નથી. પણ તેમાંથી તે પાકું એવું શિક્ષણ તો વે જ છે.

રમુનાં હુકમ કરનારાંએ તરફ જેઠએ તો આપણને શું લાગશે ? આપણને થશે કે આ ઘરમાં કશું તેજ નથી. નથી એકત્રંત, નથી સંયુક્તતંત્ર, અથવા સ્વાતંત્ર્ય. અહીં તો સૌ-તંત્ર એટલે કોઈનું તંત્ર નહિ એવું ભાસે છે ! આ વિચિત્ર તંત્રમાં પહેલાનું બીજું ઉપાયે છે. અને બીજાનું ત્રીજું ઉપાયે છે. એમાં એકખીલ પ્રત્યે માન કર્યાં ? આમાં કશું નિયમન કર્યાં ? આમાં રમુને શાનું શિક્ષણ મળવાનું ? એધ્યાધ્યાધીનું ? કે વ્યવસ્થાનું ? માનનું કે માનલંગ કરવાનું ?

આવી સ્થિતિ ઘણું ઘરોમાં છે અને તે તુરત જ સુધરવી જેઠાચે. એક રાજને ખદ્વે બધા રાજ થાય ને સૌ સૌને કાવે તેમ હુકમ કાઢે તો રાજ્ય કેટલા દિવસ ચાલે ? શેઠ એક જેઠાચે; તંત્રવાહક એક જેઠાચે; સત્તા એક જેઠાચે. ઐશક જ્યાં મોટા કામો હોય ત્યાં સંયુક્ત સત્તા હોય, સંયુક્ત તંત્ર હોય, અગર કાર્યના વિલાગ કરી વિલાગિય તંત્ર હોય; પરંતુ નાના પરત્વે બાકીનાં મોટાંચો સૌ સત્તાધારી, એ સ્થિતિ તો પરવડે જ નહિ.

રમુના બાપા કાં તો એકલા જ બધા હુકમો કાઢે ને હુકમો પ્રમાણે રમુની બા પણ મર્યાદામાં રહી પોતાને લાગતા હુકમો કાઢી શકે; ઐનની સત્તા પણ હોય ખરી, પરંતુ તે મર્યાદિત અને માન્ય થયેલી. અને દરેક સત્તા એટલું તો અવશ્ય જુએ જ કે કોઈના પણ હુકમનું અપમાન કે ઉત્થાપન કોઈન જ કરે. દરેક સત્તા પોતાની મર્યાદાની ખરાક કરી હુકમ ન જ કાઢે. એટલું સ્વીકારે એટલે એક-તંત્ર, સંયુક્ત તંત્ર કે પ્રજ્ઞતંત્ર કે કોઈ પણ તંત્ર ચાલે જ; અને રમુ જેવાને કચરાવું ને આથડવું ન પડે.

૩૫

[ ૨૬ ]

વાણીમાં અતિશયોક્તિ

રમુને બાપાચે બોલાયો. ઉતાવળથી જતાં ફૂધના કળશાને જરાક ઠોકર લાગી; ફૂધની આલક ભડી ને પાવળું ફૂધ ઢોળાયું.

મા કહે : “ રોચો આંધળો ! આ શેર એક દ્વાધ ઢોળી નાજ્યું : ”

\* \* \*

વીજુ થાળી લઈ જમવા આવતી હતી. હાથમાંથી થાળી પડી ગઈ.

કાકી કહે : “ અરર ! મારા તો કાન ઝૂટી ગયા. ” ક્રઈ કહે : “ આમ તો વાસણ ઝૂટી જાય. એલી વીજુડી ! સરખાં થોલતી હો તો ? હાથ ભાંગલા છે ? ”

આવા અતિશયોક્તિના તો અનેક દાખલાચો આપી શકાય.

આ દાખલાચોમાં અતિશયોક્તિ છે; બાળકોની શક્તિ-અશક્તિનાં કારણેનું અજ્ઞાન અને ગેરસમજણું પણ છે.

ચાલવું-હાલવું એવી રીતે કે અથડાઈએ નહિ ને ડેસ ન આવે, એમાં ચાલવાનો કાબૂ બરાબર જોઈએ છે. નવો સાઈકલશિખાડી સાઈકલ વાંકીચૂંકી કરીને અકૃષ્માત કરે છે, એનું કારણ એ છે કે હેંડલ ઉપર તેનો પૂરો કાબૂ નથી. શરીરને સમતોલપણે ચલાવી શકાય તે માટે બાળકને ચોગ્ય એવી ડીલ જેવી કસરતની જરૂર છે.

લશકરને તાલીમ આપવાનો હેતુ સમૂહંગત હિલચાલનું વ્યવસ્થિતપણું કેળવવાનો છે.

આપણે બાળકને શરીરની સમતોલતા કેળવવાના પ્રસંગે ન આપીએ ને ભૂલો કાઢીએ તો બાળકની ભૂલો સુધરશે નહિ અને આપણુંને પણ અસરો રહેશે.

વળી અતિશચોકિતથી બોલવાની આપણી ટેવથી બાળક આપણું કથનની નૈતિક કિંમત ગણું નથી. તેના મનમાં આપણું વિષે પ્રશ્ન જાડે છે કે મોટાંએ આવું એટું કેમ બોલતાં હશે ? ભાષાદિશે પણ આવી અતિશચોકિત માઝ ન કરી શકાય. બાળક એની બોલવાની બાબતમાં બેદરકાર બને છે. આપણું કથન હમેશાં અતિશચોકિતથી લરેલું છે એવી છાપ થઈ જતાં બાળક તેને લગભગ ગણુકારતું નથી. ધીરે ધીરે તે રીદું થઈ જાય છે. પ્રથમ જેમાં તેને અસલ્યભાસ થતો હતો, જે અતિશચોકિત અતિશય લાગતી હતી, તેને બદલે પાછળથી તે રીદું થતાં તેવી જ અશિક્તવાળું વચન પોતે બીજા પ્રત્યે તેમ જ પોતાનાં બાળકો પ્રત્યે પણ કાઢતાં શીખે છે. આમ અતિશચોકિતની પરંપરા ચાલી આવે છે. જરાક જે કાળજી રાખીએ તો આપણું અને બાળકો આવી અતિશચોકિતમાંથી અને તેના નુકસાનમાંથી છૂટી જઈએ.

\*

બોલતાં આવડે છે એટલે આપણું બોલીએ છીએ; સામાને અર્થ સમજ્યા વિના ધૂટકો નથી તે સમજે છે. પણ સવાલ એ છે કે આપણુને બરાબર બોલતાં આવડે છે ?

તમે ઉતાવળથી ગડખડ ગડખડ બોલી જતા શેડને સાંભળ્યો છે ? તમને તે નથી ગમતો, છતાં તમે તેને સમજી વ્યો છો. તમારા મન ઉપર તેની કાર્યશક્તિની કશી જ છાપ પડતી નથી.

તમે કોઈ અખડઅખડ બોલનાર વક્તાને સાંભળ્યો છે ? તમને તેમાં મળ પડતી નથી છતાં વ્યાખ્યાનનો વિષય ઉપરોગી છે એટલે, અગર સભ્યતાને કારણે એસી રહ્યા છો એટલે, સહન કરી લ્યો છો. તમારા મનમાં તેના વિચારાની પૂરી છાપ નથી પડતી ને તેનું અડધું કહેવું નકામું જય છે. તે તમારામાં જે લાગણી જગાડવા માગે છે તે તે જગાડી શકતો નથી.

આવા વધારે દાખલા તમારા અનુભવમાં છે વક્તા અને શોઠ પેઠે આપણે માણાપો અને શિક્ષકો ને અણુગમતી ફેણે આવીએ છીએ તેની અસર બાળકો પર કેવી થાય છે તેનો વિચાર કર્યો છે ?

કોઈ સારાં સંસ્કારી માણાપો પોતાનાં બાળકો સાથે વાતો કરતાં હોય લારે લ્યાં તમે હાજર હો તો તમને જણ્ણાશે. માણાપો બહુ રૂપષ્ટતાથી, મધુરતાથી ધીરજથી અને ધીમાશથી ઓલે છે; પોતાના હૃદયના લાલો વ્યક્ત થઈ શકે તેવા શાખાની પસંદગીથી ઓલે છે. બાળકો સાથે વાત કરતાં તેઓને ઘ્યાલ છે કે બાળકો હજુ થોડા જ વખતથી આ હુનિયામાં આવેલાં મહેમાનો છે. બધું સમજુ લેવાનું જેમ સારા યજમાનો મહેમાન ઉપર છોડતા નથી તેમ સારાં માણાપો પણ કરે છે. નવા આવનારની મુશ્કેલી સમજુ, નવી ભાષા જાણુનારની મુશ્કેલી સમજુ, તેઓ બહુ કાળજીથી વાત કરે છે. બાળકો બધું બરાબર સમજુ શકે છે તેથી માણાપ અને બાળકો વર્ચે ગેરસમજણુ જિસી થતી નથી. ભાષા ન સમજવાથી ઘણી ગેરસમજણુ. થાય છે એ તો આપણે અનુભવ છે.

આથી જીલટો જ અનુભવ તમને અસંસ્કારી રીતે ભાષા વાપરનાર માબાપો અને બાળકો પરત્વે થશે. આ બધું તમારા હમેશના અનુભવનું છે એટલે એ લખવું છોડી દઈએ.

હવે ધારો કે તમે ભવિષ્ય કાળની એક નિશાળમાં ગયા. એ નિશાળમાં શિક્ષક એવી રીતે બોલશે કે એની સ્થિર-ગંભીર નિર્મણ વાણી તથા વ્યવસ્થિતપણે, શુદ્ધિથી, ધીમેથી, તાલખદ્ધપણે તેને ઉચ્ચારવાની રીતિ, બાળકને સ્વતઃ શાંત અને અલિમુખ કરશે. શિક્ષકને જે કહેવાનું છે તે બાળક એછા શ્રમે સમજશે. કહેવાનું પ્રિય વાણી સાથે આવેલું હોવાથી પ્રિય લાગશે અને બાળકોમાં પ્રાણ જગાડવાની વાણીની શક્તિ પ્રત્યક્ષ હેખાશે.

બાળકો માબાપના એછા ચાળા પાડે છે, કેમકે તેમને કોઈએ શીખવેલું હોય છે કે માબાપના ચાળા પડાય નહિ, અગર માબાપ બાળકોને સીધું કહી હે છે કે “ એમ ન થાય; ચાળાન ન પડાય. ” બાળકોની મનોવૃત્તિ વ્યક્ત કરવાનો માર્ગ બંધ કરી માબાપ હવે ચાળા પાડવા યોગ્ય પોતે રહ્યાં નથી એમ મૂર્ખાંધી માનતાં હોય તો તેઓ જખ મારે છે, અગર ખાંડ ખાય છે. બાળકો માબાપને છોડીને બીજાંનાં નામો આપી તેમના ચાળા પાડયે જ રહેવાનાં છે. પણ શિક્ષકના ચાળા જોવામાં માબાપ રસ લે છે, અને તેથી શિક્ષકોના ચાળા છૂટથી પાડવાનું બાળકોને મળે છે. આ ચાળામાં બાળકો શિક્ષકો કેમ બોલે છે ને તે વખતે કેવી કેવી કઠંગી તેમની સુખમુદ્રાની રૂપછાયાચો બને છે, તે બરાબર બતાવે છે.

શિક્ષકો આવે પ્રસંગે હાજર રહી જરા જુએ તો ખખર પડે કે તેમણે બાળકો સમક્ષ કેવી રીતે બોલવું ધરારત છે. માબાપો ધારે તો શિક્ષકોના ચાળામાંથી ધણું ડાહ્યાં થઈ શકે.

છેવટે વાત એમ છે કે આપણે સૌ વિચાર કરીએ કે આપણુને અંહર અંહર, માટાઓ સાથે, નાનાઓ સમક્ષ અને બાળકો સમક્ષ સારી રીતે બાલતાં આવડે છે ?

\*

[ ૨૮ ]

ખાનગી વાતો

મારા એક મિત્ર મને કહ્યું : “ મારો નાનો ભાઈ, અમે ઘરનાં કોઈ એ માણસો નજીક આવીને વાત કરતાં હોઈએ છીએ ત્યારે ફરથી કાન માંડે છે, પોતાનું કામ છોડે છે, કામ કરવાનો હેખાવ કરે છે, ધણી વાર બહાનાં કાઢી પાસે આવે જાય છે અને ધણી વાર કંઈ શોધતો હોય કે ચિત્રો જેતો હોય એવો ડોળ કરી સાંલળવાનો પ્રયત્ન કરે છે. મારે આ બાખતમાં શું કરવું ? ”

મેં તેને કહ્યું : “ એનો ઉપાય તમારે ખાનગી વાત ન જ કરવી, અથવા તમે ખાનગી વાત નથી જ કરતા એવું જણાવવું ; એ નથી. હરહુ મેશાં ત્રીજને તુકસાન પહોંચાડવાની કે કાવાદાની કે અટપટની કે એવી વાત એટલે ખાનગી વાત, એવો ખાનગીનો અર્થ નથી જ. એ માણસે જણાવવાનું હોય તે ત્રીજને તેની સાથે લેવાદ્વારા ન હોય, તેમાં તેનું હિત ન હોય, અથવા તે જણાવાથી ત્રીજને હાનિ હોય, અગર તે વાત ત્રીજના હિતની હોય પણ તેને જણાવવાથી અહિતની હોય, તેવી વાત ત્રીજ પૂરતી ખાનગી ગણી શકાય. તેવી વાત ખાનગીપણે જ થબી જેઇએ. દરેક ધંધામાં

એવી વાતો છે જ કે ત્રીજાને જણાવવાની ન જ હોય. દરહીએ દાક્તર પાસે પોતાની વાત કરી જાય તે ખાનગીપણે જ થાય, ને ખાનગી જ રાખવી જોઈએ, એવી એ ધંધાની સભ્યતા છે. કોઈએ અન્યને કોઈ વાત વિશ્વાસથી કહી હોય તો તે વાત પણ ખાનગી જ છે. નિર્હોષમાં નિર્હોષ વાત પણ એને માટે કે એની વરચ્ચે હોય તો તે ખાનગી જ છે. હીકરીને તેની બા જીવનની અગત્યની વાતો ખાનગીમાં જ કહી શકે. ગૃહપતિએ છાત્રોને ખાનગીમાં જ આલાવવા જોઈએ. દરેક કાર્યવાહકને પોતાના કાર્ય સંખ્યે કામદારો સાથે કામપૂરતી ખાનગી વાત કરવાની હોય જ છે. આમ અનેક વખતે અનેક પ્રકારની વાતો ખાનગી હોય છે, ને એશક તે ખાનગીપણે જ કરવી જોઈએ. જ્યાં સામા પક્ષને જણાવવું એ જ ધર્મ હોય ત્યાં ખાનગી રાખવું એ જેમ પાપ છે, તેમ જ જ્યાં એથી ત્રીજ માણસે ન જણાવવાની વાત હોય ત્યાં ત્રીજાને જણાવવામાં કે ત્રીજે જાણે એમ વાત કરવામાં પાપ છે. બાળકોને એટલો સામાજિક આચાર શીખવવો ધટે. જ્યારે ઉપરના પ્રકારની કોઈ પણ વાત હોય ત્યારે આપણે તેને કહેવું : “આ વાત ખાનગી છે. જરા બહાર જાઓ.” બાળકને આપણે જુહી જુહી રીતે ખાનગી વાત એટલે કેવી વાત એનો અનુભવ આપવો જોઈએ. તેના પોતાના અંગત પ્રશ્નો તેની સાથે ચર્ચાતી વખતે “આ વાત ખાનગી છે; બીજાને જણાવવા જેવી નથી; તારે પોતાને જ કામની છે.” એમ કહી ખાનગી વાતનું સ્વરૂપ જણાવી શકીએ. ધરમાં એવા ધણા પ્રસંગો બને કે જેમાંથી ખાનગી વાત કઈ ને જાહેર કઈ તેની સમજણું બાળકને આપવાની તક લઈ શકીએ. બાળકને એટલો ઘ્યાલ આપ્યા પછી તેને કહેવાય : “જુઓ; બીજાની વાત આપણું જરૂરી નથી;

તેને પોતાને જ કામની છે. માટે તે સાંભળવાની આપણુંને દરકાર ન હોવી જેઈએ. ને છતાં આપણે ઘણું વાર કાન માંડીએ છીએ, ચાર પેઠે લપાઇને વાત સાંભળીએ છીએ, એ સારું નથી; એમાં સહ્યતા નથી; એ ખાનદાની ન જ કહેવાય; ખાનદાનનું બાળક એમ ન કરે. જેમ આપણે ખાનગી વાત હોય છે તેમ ખીજને પણ હોય છે. જે આપણું વાત બધા જાણું એમ આપણું ઈચ્છતા ન હોઈએ તો ખીજની વાત જાણવાની ઈચ્છા કરવી તે અચોંય જ છે.”

હુનિયાની ઘણું વાતો ખાનગી રહે છે; કારણુંકે જે તે બહાર પડે તો તેમાંથી જેખ્મ ઊભું થાય છે. ઘણું વાર તેવી વાતો સાથે જોડાયેલાંને તે ખાનગી રાખવાની શરત કરવી પડે છે, અગર તો બીજુ સુશકેલીએ વેઠવી પડે છે. જે બહારનો લોકભય ન હોય તો ઘણું વાતો બહાર પડે ને તેનાથી ઘણુંએને ઘણું કિંમતી એવું જ્ઞાન મળે. લોકભયને લીધે એવું ઘણું મહામૂલ્ય સાહિત્ય ધૂપું રહે છે. પરંતુ માત્ર બહારના લયને લીધે જ વાતો ખાનગી રાખવી પડે છે તેમ નથી; બહારનો લય ન હોય તો પણ કેટલીએક વાતો એવી પવિત્ર છે, એટલી બધી મહત્વની છે, એટલા ઊંડા રહસ્યની હોય છે કે તેના જેએ અધિકારી ન હોય તેએ તે ન જ જાણું, તે માટે તેને ખાનગી જ રાખવી જેઈએ. આ ન્યાયે ઘણું વાર મોટાંએના જીવન પરતે સાવ નિર્દોષ અને અતિ લભ્ય વાતો પણ બાળકોથી શુપ્ત રાખીએ છીએ, અને રાખવી જ જેઈએ. એમાં બાળકોનું કશું અપમાન નથી. એમાં એમનાથી કશી ચારી પણ નથી એમાં એટા દાખલાએ હેખાડવા જેવું પણ નથી. આમ જ જીવનના બધા વિભાગો-માં રક્ષણું કરવા ચોંય ઘણું છે કે જે બાળકો આગળ ઝુલ્લું મૂકી ન શકાય.

બાળકોને પણ જીવન છે. તેમને આનગી વાતો હોય છે. તેઓ આપણાથી ગવીય કે ગંધી વાતો છાનીછપની કરે છે, કારણુકે તેઓ માને છે કે જે તેની અખર આપણુને મોટાં-એને પડશે તો આપણે તેમને વઢશું અગર મારશું. જે આપણે બાળકોનો વિશ્વાસ મેળવી શકીએ, જે આપણે “આવી વાત ન જ થાય; કરીશ તો મારીશ.” વગેરે કહીને તેમને આનગી તરફ દોર્ચાં ન હોય તો તેઓ આપણી સાથે ઘણી ઘણી વાતો સારુ સારુ કરશે. જ્યાં સુધી બાળકોને મન તેમની વાતો સાવ નિર્દોષ છે, કરવા જેવી છે, ન ઢાંકવા જેવી છે, ત્યાં સુધી આપણે તેને ગુપ્ત રાખવા જેવી ન બનાવીએ. એમાં આપણી શરમ કે અશ્રિતલક્તા ન ભાળીએ. આ વાતો બાદ કરીએ તો પણ બીજી ઘણી વાતો છે કે જે બાળકો એકાંતમાં ગુપ્તપણે કરવા માગે છે; તેમાં તેઓ વાતને ઢાંકવા જ માગે છે એવું નથી હોતું. કેટલાંએક બાળકો એવાં શરમાળ એટલે મેંસંતાં હોય છે કે તેઓ કહેવા જેવી વાતો પણ આપણુને કહી શકતાં નથી, અથવા તો ખાસ સંતાત્યા કરે છે. કેટલાંએક નાનુક પ્રકૃતિનાં બાળકો જેમ પોતાનું નામ, કામ વગેરે અન્યથી ઢાંકે છે, તેમ જ તેઓ પોતાની વાતો પણ છુપાવે છે. આવાં બાળકો વાતસંતાં કહેવાય. જરાક ઉત્સાહ આપી આપણે તેમને આપણી પાસે લઈશું તો તેઓ પોતાની બધી વાત આપણુને કહેશે. અપરિયયને લીધે પણ બાળકો આપણાથી પોતાની વાતો આનગી રાખે છે. ઘણી વાર આપણી બાળકોની વાતો તરફની એકદર પણ તેમને આપણાથી ફર રાખે છે. ઘણી વાર વાત કહેવાનો પ્રસંગ જ આવ્યો હોતો નથી તેથી વાત મનમાં ને મનમાં પડી રહે છે, ને આનગી રહ્યાનો હેખાવ થાય છે. ઘણી વાર ઉધાડા દિલથી વાત કહેનાર બાળકને આપણે પાછું પાડેલું

હોય છે, તેથી પણ તે વખતથી તે આપણાથી ખાનગી રાખે છે. ખાળકમાં આ બધી વાતો આપણે ઉદારતાથી ચલવવી જેઈએ. તેની ખાનગી વાતો માટે સન્માન રાખવું જેઈએ; તેમાં વચ્ચે ન પડતાં તેનું પાવિન્ય ગંભીરતાથી સ્વીકારવું જેઈએ. જે આપણે ખાળકોની વાતો જાણવા આપણું વર્તન છૂપી પોલીસ જેવું નહિ રાખીએ ને તેમને ખાનગી વાત કરવાની છૂટી આપીશું, તો આપણને જાણવા જેવું તેઓ આપણને ઉધાડે દિવે કહેશે જ. તેઓ ખાનગી-અખાનગી વચ્ચેનો લેટ સમજશે જ. તેઓ આપણી ખાનગી વાતને પણ માન આપશે જ, તથા કાન માંડીને સાંભળવાનું મન કરશે નહિ.

\*

[ ૨૬ ]

ખાળકનું દિલ્લિબિંદુ

“ અરે, વિનું ! આ ચાક કોણે બગાડ્યો ? ”

વિનુ કહે : “ એ તો ચાકનાં ચીતર કાઢ્યાં છે. ”

ખા પૂછે છે : “ અલી વિનુ ! ત્યાં ઠામ કેમ પછાડે છે ? ”

વિનુ કહે છે : “ ઠામ નથી પછાડતી; એ તો અવાજ સાંભળું છું. ”

“ કાં ભાઈ ! રમકડાં કાં લાંગી નાખે છે ? ”

“ એ તો અંદર શું છે, એ જેઉ છું. ”

“ ત્યાં એઠો એઠો બગાસાં કા મારે છે ? ”

‘ બગાસાં નથી ભારતો; આ કીડીઓ ફરમાં જય છે એ જેઓ છું.’

માબાપો અને બાળકો વરચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દ્યાને સાંભળીશું તો આવા કેટલા ચે સંવાહો જરૂરી.

ઉપર અપાયા છે તેવા ચિત્રવિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણુંને આપે છે ત્યારે કાં તો આપણે તે લક્ષમાં જ લેતાં નથી, કાં તો તેમાં બાળકની ભાલિશતા જેઠી હસી કાઢીએ છીએ. ઘણી વાર એવા જવાઓથી આપણે ચિડાઈને બાળકને ધમકાવીએ છીએ, પરંતુ બાળકે એવો જવાબ શા માટે આપ્યો તેનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ.

જરાક વિચાર કરીશું તો આ ખંડી વાતો આપણુંને ખતાવશે કે આપણી અને બાળકની દશિમાં કયાં અને કેવો લેદ છે. પણ આપણુંને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી. એવી નમાલી ભાબતો પર વિચાર કરવાનું પણ શું હોય? આપણી ઉતાવળમાં અથવા મોટાઈમાં આપણે સાંભળ્યું, ન સાંભળ્યું કરીએ છીએ. ઘણી વાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે આપણો પોતાનો વિચાર આરોપીએ છીએ, ને આરોપેલા વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ!

બાળક ચાક વાપરે છે તે આપણા મનને બગાડરૂપ છે. આપણી નજરે ચાકનો ઉપયોગ અસુક જ પ્રકારનો છે. બાળકે કાઢેલા ચાકના આડાઅવળા લીટા આપણી નજરે નિર્દ્ધક છે જ્યારે બાળકને મન એ ચિત્રો છે; આપણી દશિએ લાં વ્યય છે, બાળકની દશિએ કિંમતી ઉપયોગ છે. બાળકો જોડાથી રમે છે, તેને સરખા કરી મૂકે છે, તેમાં પગ નાખી ચાલે

છે, કોઈકના જેડા પહેલી મલકાય છે, ત્યારે આપણુને એમાં અસહ્યતા, ગંદાપણું, ચોટો ધંધો વગેરે લાગે છે. બાળકોની સામે જેડાએ પહાર્થોની સરખામણી અને લેહ જેવાનાં માપ કાઢવાનાં અને સમતોલતા અસમતોલતા જણવાનાં સાધનો છે. બાળકો જેડાએથી રમીને પણ નાનામોટા માપના ખ્યાલો લે છે. પગમાં નાખીને ચાદી જેવામાં પડવાની ને ચાલવાની ગમ્મત લે છે. રમતમાં શરીરના કાણ્ણુનો અનુભવ મળે છે. વાધરી અને ખુતાન બીડવા-છોડવામાં આંખ અને આંગળાંની કસરત છે.

આમ બાળકની દિલિએ તેમની નાની નજીવી પ્રવૃત્તિઓમાં પણ ઘણું છે, જ્યારે આપણી દિલિએ કશું નથી. ખરી વાત આપણી નહિ પણ બાળકની દિલ હોવી જેઇએ. જેને પોતાની આંખ છે તેને પોતાની દિલ હોવી જેઇએ. જેને પોતાની જુદ્ધિ છે તેને પોતાની જ જુદ્ધિના વપરાશની કિમત છે. જેએ બીજાને પોતાની આંખ આપી બીજાની આંખ બંધ કરે છે, જેએ પોતાની જુદ્ધિનું આસ્તરણું પાથરી બીજાની જુદ્ધિને ઢાંકે છે તેએ. બીજાની ઉત્તીના દ્રોહી છે. આપણું કર્તવ્ય બાળકની દિલ સમજવામાં છે. બાળકનો ઉદ્ધાર તેમાં જ છે. બાળકને પણ જગત અને જીવન પ્રત્યે અસુક ચોક્કસ દિલિ છે અને તે હોવી જેઇએ, એમ જે સ્વીકારીએ, અને પછીથી એ દિલિને આડે ન આવીએ પણ તેને સહાતુભૂતિપૂર્વક સમજવા યતન કરી તેની પ્રવૃત્તિએને થવા દઈએ, તો આપણે બાળકને તેની દિલથી સમજશું; તો બાળક આપણી દિલ પણ સમજશે. આ રીતે પરસપરની દિલિએ સમજતાં વધારે વિશ્વાસ આવશે, અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે.

બાળકોને શું ગમે છે ? વ્યવસ્થા કે અવ્યવસ્થા ? શાંતિ કે વૈંધાટ ? કામ કે નિષ્ઠિયતા ?

લોકો એમ માને છે કે બાળકોને અવ્યવસ્થા ગમે છે કારણ કે તેઓ અવ્યવસ્થિત રહે છે ને અવ્યવરસ્થા ઉત્પન્ન કરે છે; પરંતુ તે માન્યતા જોઈ છે. બાળકોને વ્યવસ્થા પ્રિય છે, કારણ મનુષ્યનું માનસ વ્યવસ્થાપ્રિય છે. અવ્યવસ્થામાં તે ગુંગળાય છે, મૂંઝાય છે; તેને અવ્યવસ્થામાં કાંઈ સૂજાતું નથી. આપણે સુવ્યવસ્થિત વાતાવરણ કરી આપતા નથી, ને બાળક બિચારું નાનું હોવાથી મોટી અવ્યવસ્થા વ્યવસ્થિત કરી શકતું નથી; માટે તેને મૂંઝાતાં અકળાતાં નેમતેમ અવ્યવસ્થામાં લુવવાનો રહ્સ્તો શોધી કાઢવાનો રહે છે. ને તેને જ આપણે બાળકની અવ્યવસ્થા કહીએ છીએ ! બાળકની અવ્યવસ્થા એ તો એ બિચારાની મૂંઝાયેલ સ્થિતિ છે, અને આપણું અવ્યવસ્થિત વાતાવરણમાંથી તે ઉત્પન્ન થયેલી હોય છે !

લોકો એમ માને છે કે બાળકોને વૈંધાટ ને ગડખડ પ્રિય છે; બાળકોને શાંતિ ગમે જ નહિ ને શાંત બેસતાં આવડે પણ નહિ, કારણ બાળક ચંચળ છે. પણ તે માન્યતા જોઈ છે. બાળક વૈંધાટ ને ગડખડથી બહુ મૂંઝાય છે. તેના નાના નાના જાનતાંતુંએ મોટા અવાજથી બહુ અકળાય છે; તેના પર ખૂબ તાણ પડે છે. રોજ કેટલાયે અર્થ વગરના અવાજે તેના કાન પર નિર્દ્યતાથી અથડાયા જ કરે; શેરીનાં ને ઘરનાં માણુસેં ખૂબ જોરથી વાતો કરતાં જ હોય; આજુભાજુમાં

માણસો રાડો પડતાં જ હોય; માણસો બારણું લટકાવતાં જ હોય, વાસણો ખખડાવતાં જ હોય; ને તે પણ બધું કારણ વગર, અર્થ વગર ! બાળકનું મગજ આ વ્યાંધાટથી ખવાઈ જાય છે. આવી ધમાલમાં પોતાને બીજાં સાંલળે માટે તેને પોતાનો નાનો અવાજ પણ ખૂબ તાણું વો પડે છે; ગળું હુખવવું પડે છે. પણ જિચારું શું કરે ? અવાજ, ગડખડ અને વ્યાંધાટમાં જીવવાનો રસ્તો તેણે શોધવો જ રહ્યો; ને તે શોધી લે છે કે વ્યાંધાટ કે ગડખડ કરવી એ જ તેનો રસ્તો છે. તેના જ્ઞાનતંતુએ થાકી તો જાય છે જ.

લોકો એમ માને છે કે બાળકોને કામ કરવું ગમતું જ નથી માટે બાળકો પાસે પરાણું કામ કરાવવું જેઠાં; પણ આ માન્યતા તફન ઓટી છે. બાળકો કુદરતી રીતે કિયાપ્રિય છે. પણ આ મોટાંઓના જગતમાં તેમને કામની સગવડ મળતી નથી, તેમને માટે યોગ્ય એવાં સાધનો મળતાં નથી, તેમને માટે સ્થળ મળતું નથી. મોટાંઓની ગમે ત્યારે રાડ પડશો જ : “આ શું કરે છે ? ત્યાં શું કામ અડયો ? આ શું કામ લીધું ? ” તેને એવા અકર્માતો વચ્ચે જ કિયા કરવી રહી. એટલે તે આસ્તે આસ્તે નિર્ણયતાપ્રિય થતું જાય તો શી નવાઈ ? બાળકમાં અવિશ્વાસ રાખવાવાળા તો કયાંથી જ જેઠ શકે કે બાળકોને શું શું આવડે ને કેટલું તેઓ કરી શકે ?

બીજું જે ઝાવે, જે ગમે કે જેમાં સૂજ પડે તે કરવાની સગવડ મળે નહિં, અને ન ઝાવે, ન ગમે, ન સૂજે તે કરજિયાત કરવું પડે : તો તેવું કરવા કરતાં બાળકો ન કરવાનું પસંદ કરે તો શી નવાઈ ? તેથી મોટાંઓ માને છે કે બાળકોને કામ ન ગમે. આ કારણે બાળકોમાં કેટલી

અમાપ કિયાશક્તિ રહી છે તેનાથી તેઓ અજ્ઞાત જ રહી જાય છે !



[ ૩૧ |

આગળ ખુતાન

ફેશન ઘણી વાર સગવડ—અગવડની દરકાર નથી કરતી, એટલું જ નહિ પણ આપણને તકલીફ આપે છે. ફેશન પાછળ વિચાર હોય જ છે એમ નથી; વિચાર કરવાવાળા પણ ફેશનના લોગ થઈ પડે છે. ડાહ્યા લોકો પણ ઘણી વાર ફેશનમાં ખૂણી, સૌંદર્ય, ચોણ્યતા વગેરે લાળે છે અને તુકસાન-કર્તા અથવા ત્રાસદ્યાયક ફેશનનો પણ બચ્ચાવ કરે છે !

ફેશનનાં લોગ થઈ પડેલાં માબાપોનાં બાળકો પણ ફેશનનાં લોગ થઈ પડે છે. એમાં નવાઈની વાત નથી. બાળકો અમસ્તાં ચે માબાપનાં લોગ થઈ પડેલાં જ છે !

માબાપોને કે ફેશનેબલ અને સુંદર લાગે છે તે બાળકોને માથે આવી પડ્યા કરે છે. માબાપો સુંદર કહે છે : આસ-પાસના લોકો પણ તેમ જ કરે છે; તેમનાં બાળકો પણ તેમજ કરે છે. એટલે બાળકો જાતે તેના લોગ થઈ પડે છે. પછી તો માબાપો પણ કહી શકે છે : “ બાળકોને ગમે તે તો કરવા દઈએ ને ? ” પણ ખરી રીતે એમાં બાળકો તથા માબાપો બંનેની ફેશનના લોગ થઈ પડવાની ગુલામી વૃત્તિ છે.

બાળકો આજકાલ ફરાક વગેરે પહેરે છે તેમાં ખુતાન,

એસિયાં વગેરે પાછળ બીડે છે. આ ફેશનનો નમૂનો છે. એ ક્યાંથી આવી અને કોણે કાઢી તે તે કોણું જણે; પણ બાળકોને પાછળ બુતાન રાખવાં ગમે છે. માભાપો તેવાં જ ઝરાકો કરાવે છે; દરજુએ તેમ કરવા એઠેલા જ છે. ફેશન ઝેંકનારા આ પરહેશીએ અને તેને નમીને જીલનારા આપણે તથા તેનો અમલ કરી હેવાવાળા દરજુએ, એ તરણેની વાત અહીં નહિ કરીએ. અહીં તેના લોગ થઈ પડેલાં બાળકોને તેમાંથી છાડવાનું નશી કરીએ.

જ્યારે જ્યારે કપડાં પહેરવાં હોય ત્યારે બાળકોએ માભાપનું શરણ લેધું પડે છે. “આ ! બુતાન બીડી હે.” “આપા ! હૂક બીડી ધો.” બા અને બાપાને બહુ કામ હોય છે. એ આ બધું કચારે કરે ? બા મોટી હીકરીને ઘમકાવે છે : “એ, બુતાન બીડી હે.” બા નોંધને કહી હે છે : “અલ્યા એ, બુતાન બીડી હે તો ?” હાથ હોવા છતાં અપંગ બનેલું બાળક જિલું રહે છે; બિન્દું કોઈ બુતાન બીડે છે ત્યારે તેનાથી કપડું પહેરાયું વહે છે-ત્યારે તેનાથી બહાર જવાય છે. એમ જ કોઈ ને કોઈ મદદ માટે જોઈએ જ. પાછળ બુતાનનાં ઝરાકોનો શોખ કરવા માટે બાળકને એ વાર એ માણુસોની શુલામી સહેવાની.

એ તો ઠીક; પણ ઝરાક બીનું થયું છતાં બાળક પોતાની જાતે કાઢી શકે નહિ. ઘામ થાય છે ને ઝરાક કાઢવાનું મન થાય છે; બાળક જાતે તેમ નહિ કરી શકે. ઝરાક સણગયું અને બાળક દાઢે છે; બાળક કેવી રીતે ઝરાકને કાઢી શકવાનું ? પાછળ બુતાન આ રીતે બાળકને હેરાન કરે છે. છતાં બાળકને તે ગમે છે-કેમકે માભાપને તે ગમે છે, કેમકે

માબાપને અન્ય દેશની, અન્ય લોકોની, ખીજની ફેશન ગમે છે.

‘ફેશનનું’ એવું છે કે નેમ ચલાવીએ તેમ ચાલે. જરા પ્રતિષ્ઠિત, જરા અસુક જાતના, જરા તસુક જાતના લોકો અમુકતસુક કરે એટલે સામાન્ય જનતા પણ તેમ કરે છે. એટલે એવા આગેવાન લોકોએ સારી ફેશનો ચલાવવી જેઠાએ. પણ ધણ્ણા આગેવાનો અછ્છલથી હુશમનાવટ રાખી ફેશનને ચલાવે છે લારે જનતાને ઊડા ખાડામાં ઉતારે છે.

ધણ્ણા લોકો ફેશનનો મોહ છોડી હે. તેઓ જે કાંઈ કરે તેમાં જાતે જ વિચાર કરે કે આ સગવડવાળું, શોભીતું અને પરવડતું છે કે કેમ? લોકોથી જુદા દેખાઈશું તેની ચિત્તા સમજુ લોકો નથી કરતા; તેઓ ચોંચ શું છે તેની જ ચિત્તા રાખે છે.

આપણું તો હવે થાય તે ખરું, પણ બાળકોને આપણી પાછળ ન ચલાવીએ. તેમની સગવડ વગેરેનો અલયાસ કરીએ, અને તેમને બંધાયેસતું કરાવી દઈએ નાનાં બાળકો પણ પ્રથમ દસ્તિએ પોતાને ઝાવતું ન ઝાવતું, ગમતું ન ગમતું સમજુ શકે છે. તેમની પાસે તેમને જેઠિતું નાખી કરાવીએ, અને ફેશનને નામે આપણે તેમને ન આપીએ.

બાલમંદિરમાં ‘ખુતાન આગળ’ની હાજરી થાય છે-ખુતાન તપાસવાનાં. આગળ ન છોય તો આગળ લાવે. માબાપોને ચિહ્ની લખવામાં આવે છે કે હવેથી નવાં કપડાં આગળ ખુતાનનાં કરાવવાં. સંતોષની વાત છે કે ડેટલાંક માબાપો આગળ ખુતાનનાં ફરાકો, કખજા, પેરણો વગેરે

કરાવવા માંડચા છે. તેઓએ પોતાનાં બાળકોની સારી સેવા ખજાવી કહેવાય.

\*

[ ૩૨ ]

પહેલાં અને હમણાં

: ૧ :

પહેલાં લલીને પાણી પીવા આપવું પડતું. પાણી આપતાં વાર લાગતી તો લલી રડતી હું કામમાં હોઉં ને લલી ‘પાણી આપો, પાણી આપો !’ કહેતી તો હું ખિંજતો. પાણી ન આપું તો લલીને તરસ્યાં જેસવું પડતું કે તે કનંડતી. વારે વારે પાણી આપીને હું કંટાળતો ને કહેતો : “આ છાડી જેને, વારે વારે પાણી માગ માગ જ કરે છે !” તે વખતે ગોળો પાણિયારે રહેતો; લલી અંભાઈ શકતી નહિ; મારા ઉપર તેનો આધાર હતો. તે પરાવલંખી હતી તેથી હાથપગ હોવા છતાં અપંગ હતી. અપંગની ચાકરી કરવામાં હું પોતે પણ પરતંત્ર બનતો; એમ નહિ તો અપ્રિય તો થતો જ.

હમણાં ગોળો નીચે માંડ્યો છે; તેની પાસે એક ખ્યાલો મૂક્યો છે. પાણી પીને ખ્યાલો ઘાવાનું બતાવ્યું છે. વધેલું પાણી નાખી હેવા બાદદી મૂકી છે. હવે લલી પાણી માગવા નથી આવતી. તે માટે તેને રડવું નથી પડતું. મને તેની એ બાબતમાં અડચણ નથી આવતી. મને ખખર પણ પડતી નથી કે લલી પાણી કયારે પીએ છે. લલી પોતે જાતે પાણી લે છે, ને પીએ છે; જિલટો હું પોતે પણ તેની પાસે પાણી

મગાવું છું ને લકી હોંશે હોંશે લાવે છે હવે તે સ્વાધીન બની છે. મારો આધાર મટી ગયો છે. મારે તેની ચાકરી નથી કરવી પડતી. પહેલાં તે રડતી પણ હવે તે પ્રસન્ન છે. હવે આ બાબતમાં મારે તેના પર બિનાવું પડતું નથી ને હું એને અપ્રિય લાગતો નથી.

: ૨ :

પહેલાં બાળકોના હાથ ધોવરાવવાની ભારે પંચાત પડતી. એક જમીને ભેઠ ને કહેશે: “હાથ ધોવરાવો ને ?” એકને ધોવરાવીએ ત્યાં બીજું કહેશે: “મારા હાથ ધોવરાવો ને ?” બા કહેશે: “હમણાં બધાં ખાઈ રહીએ ત્યાં સુધી એસી રહેા. સૌના હાથ સાથે સાથે ધોવાશે.” બાળકો ઊચાં-નીચાં થાય ને ગડખડ ભચાવે. ખાઈ રહ્યાં હોય એટલે શાકદાળ-રોટલી ચૂંથે. એમ કરવાની ના પાડીએ એટલે કંઈક બહાનું કાઢી ‘એં એં’ શરૂ કરે. બા વઠે એટલે ચૂપચાપ થઈ મોં ચડાવે મારે પોતે હાથ ધોવરાવવા બીજબું પડે. બાળકને હાથ ધરવો પડતો; હું ઘસું ત્યાં સુધી અમણું પડતું. વખતે મારું ધોવું ગમતું ને વખતે ન પણ ગમતું. ન ગમે તો બાળકો રડતાં પૂરા હાથ ન ધૂએ તો એંહું રહે એ કેમ પાલવે ? એમને ટોર જેમ ધમારવા એ પણ કંટાળો આવે. અમે કંટાળયાં. જમીને હાથ ધોઈ લીધા પછી તે લૂવાનું ભારે હુંઘ હતું. વિનુ પેરણે હાથ લૂવે એટલે એની બા વઠે; કુસુમ ધારીએ હાથ લૂવે ને ધારીને હળદરના ડાઘ પાડે; લીલુ એમ ને એમ હાથે જ મોં લૂવે; કમળા જે આવ્યું તેનાથી હાથ લૂવા હોડે. એની બાને એ જરા ચે ન ગમે. તે સૌને ધમકાવે, પોતે ચિડાય ને વખતે કોઈને મારી પણ હે ! કહેશે: “મારે એવા ડાઘ શી રીતે ધોવા ?

હું કંઈ તમારી ધોખણું છું ? હું કયાં ધોવા નવરી છું ?”  
 બહુ બહુ તો બાથી બીજે છોકરાં જમીને પૂછે : “હાથ  
 શેરે લૂધાએ ?” એક હી બા કહેશે : “આલી કાલવાળી  
 ધોવાની ઘાઘરીએ.” બીજે હી કહેશે : “જુઓ ને, પણ એ  
 ચીથરાં પદ્ધતાં છે એનાથી લૂવો.” ત્રીજે હી કહેશે : “ફટીને  
 આપી હેવાનો પેલો સાડલો પડયો છે તેનાથી લૂવો.”  
 છોકરાંએને રોજ નવા મારો ચાલવું પડતું; ગોતમગોતાં  
 થતી ! તેઓ કંઠાળતાં ને અમે પણ કંઠાળતાં.

હમણું એ ફેરફારો દાખલ કર્યો છે. હાથ ધોવા માટે  
 ફળિયામાં એક પવાલું મૂક્યું છે; હાથ લૂવા માટે બારણાની  
 સાંકળે એક રૂમાલ બાંધ્યો છે. કુસુમ જમીને ભાઈ છે ને  
 પવાલા પાસે જાય છે, ને ચકલી જોલી એ હાથ લેગા કરી  
 ઘસીને નિરાંતે હાથમાં ધુએ છે. “ધોવરાવોને ધોવરાવોને ?”  
 એમ કોઈને કહેવું પડતું નથી. સૌ એક પણી એક હાથ  
 ધોવા જાય છે એટલે ગડખડ થતી નથી, ને બાને વઢવું  
 પડતું નથી; છોકરાંનાં મોં પણ ચડતાં નથી, ને મારે જાહેસ  
 કરવી પડતી નથી. બાળકોને હાથ કેમ ઘસવા એ બતાવ્યું  
 છે. પોતે હાથ ઘસી લે છે; કચરો કાઢ છે ને એહું રહેવા  
 હેતાં નથી હાથ ધોઈ રૂમાલે હાથ લૂવા તેઓ જાય છે. એક  
 રૂમાલ રાતો, પીળો, કાળો થાય છે, પણ કોઈનાં ઘાઘરી-  
 પોલકાં બગડતાં નથી; હાથ ચીકણા રહેતા નથી; બા-બાપાને  
 ચિડાવું પડતું નથી. લુગડાના કટકા માટે ગોતાગોત થતી  
 નથી ને જમીને મોં ચડાવવાને બહલે ફૂફતાં ફૂફતાં ને  
 રમતાં રમતાં બાળકો આંટા મારે છે. અમારા મનને  
 કલેશ થતો નથી. બાળકો અમારાથી ને અમે બાળકોથી  
 સ્વતંત્ર થઈ ગયાં છીએ. એક પવાલું અને એક ટુવાલ  
 બાળકોને આશીર્વાદૃપ થઈ પડચાં છે.

: ૧ :

“ વેલિયાને માટે નાતનાતમાં જવા માટે વીશ રૂપિયાનું પીતાંબર લઈ તેના કરતાં તો ફરજિયામાં એક અભાડો કરાવું ને મહીં રેતી પથરાવું એ નહિ સારું ? પીતાંબર પહેરીને વેલિયે। નાતનાતમાં રૂડો હેખાશો, પણ અભાડમાં એલીને તો તે શરીરે રૂડો થશો.”

વેલિયાની બા કહે છે : “ એને એક કંદોરો કરાવી આપો, ને એક કંડું આપો આડોશીપાડોશીનાં છોકરાં સૌને એ ઘરેણાં તો છે ! ” હું કંડું છું : “ ઘરેણાં પહેર્યો વિના વેલિયે। ભૂડો નહિ લાગે પણ આપણે ઘરેણાંના પૈસા ખરચી એ એના કરતાં એને રોજ સવારે અદ્યો શેર ગાયનું હું પિવરાવીએ તો ? ”

વેલિયાની બાને એમ થાય છે : “ આપણે પણ હેરિયાનેઠિયા જેમ રહેવું જોઈએ. એ છોકરાં પાંચદસ રૂપિયાના ઝટાકડા ઝોડે ત્યારે વેલિયાને માટે એ રૂપિયા તો ખરચવા જ જોઈએ ના ? ” મને લાગે છે કે “ એ તો આપણી હેખાદેખી જ થઈ. ઝટાકડા ઝોડીને તો પૈસાનું પાણી કરવાનું ! એને બહલે વેલિયાને એ રૂપિયાનાં કાતર ને રંગષેરંગી કાગળ ન અપાવું કે વેલિયાને કોતરણીકામ ગમે છે તે ધરાઈ ધરાઈ ને કરે ? ”

વેલિયાની હાથી એટલે મારી બા કહે છે : “ બાપુ ! સાત રૂપિયા ઈ લોઢાનાં ચકરડાં ને ચાપડામાં શું કામ નાખ્યા ? સાત રૂપિયામાં તો એક હેલ આવે. ધરમાં એક

રાચ થાય તે ત્રણું પેહી સુધી ચાહે ! ” હું વિચારું છું : “ વૈલિયાને ભિડુનો ગમે છે. તે વડે તે પોતાની યાંત્રિક શક્તિને ખીલવે છે. ઘરમાં બેદું ન હોય ને માટીનાં માટીનાં હોય તો શું એદું ? વૈલિયો યંત્રવિવામાં આગળ વધશે તો એવા રાચની તો હુકાન કાઢશે ! ”

વૈલિયાની બા કહે છે : “ વૈલિયા માટે એ બાબલાં આણો ; જમનાના જીવાએ પણ લીધાં છે. વૈલિયાને એ બહુ ગમે છે ને કન્જિયો કરે છે. ” હું કહું છું : “ ફળિયામાં ખડ થયું છે તે તેથી મર્યાદ થયાં છે, તેથી સૌને વારે વારે તાવ આવે છે. એ બાબલાં લાવું તેના કરતાં એ દાડિયાં ઓલાવીને ખડ ન કઢાવું કે રોગમાંથી બચીએ ? ” એની બાને એ એટો ખરચ લાગે છે. તે કહે છે : “ એ તો ખડ સુકાઈ જશો. આપણે એવા પૈસાદાર કયાનાં કે ખડ કઢાવવા દાડિયાં રાખીએ ? ”

: ૨ :

હું કહું છું : “ વૈલિયાને એના આ જ-મહિવસે કંઈક એલું અપાવીએ કે એને ખૂબ મજાપડે ને લાલ થાય ; ને નાહિનાં ધણું બધાંને લેગાં કરીને અવરાવવા-પિવરાવવાની આએંદ્રા. હિવસ અટઅટ કરીએ ધીએ તે છાડી દઈએ. ” એની બા કહે છે : “ એ વાત મને ગમી. એમાં તો આપણે અડધાં થઈ જઈએ ધીએ, એને વૈલિયાને મન એનું કંઈ નહિ. ”

વૈલિયાની બા કહે : “ ત્યારે આપણે ઓટો ખરચ બંધ કરીએ. આ નકારાં વરસે વરસે ત્રાંબા-પિત્તળાં વાસણો લેગાં કરું છું તે. આ નવા વરસે આપણે રમવા માટે વૈલિયાને કૂરણોલ અપાવીએ. ”

મેં કહ્યું : “ એક લાખ રૂપિયાની વાત . ”

મને થયું : “ દેલિયાની બા સાચું કહે છે કે બજારમાં જઈને રોજ ને રોજ હું પેપરમિન્ટ ને એવું એવું પેટ બગાડે એવું ખવરાવું છું ને પૈસા ફેંકી દઉં છું, એના કરતાં તો છોકરાને માટે એક હીંચકો બંધાવું તો સારું . ”

“ મારો અને દેલિયાની બાનો મત ખરાખર મળતો છે કે છોકરાને લૂગડાં કરાવ્યે જ જવાં ને પછી મેલાં કપડાં પહેરવાનું કહેવું અથવા તો ‘ ઘાણીને પૈસા કચાંથી દૂધએ ? એ તો પૈસાદારનું કામ. રોજ રોજ સાખું કચાંથી કાઢીએ ? ’ એમ કહેવું તે સાવ ઓદું છે. એ કપડાં ચોછાં કરાવીએ ને સાંધીને ચલાવીએ તો સાખુના પૈસા તો તેમાંથી નીકળે ! ”

માત્ર ગમ્મત ખાતર એ-પાંચ મિન્ટોને તો મહિનામાં ખવરાવવું જ જેઠાએ. ઘરમાં શોલા લાગે એટલે મેતીનાં તો રણ્ણનો ખર્ચ તો જેઠાએ ના ? જરા ફેશનેબલ ગણ્ણાવા માટે ફુલાણું સાખું વાપરવો જ જેઠાએ. પણ બાળકો માટે માસિક મંગાવવું છે તો પૈસા નથી; એમને ગાડી કરી ફર ફરનાં સુંદર સ્થળો હેખાડવાં છે તો પૈસા નથી. આ વિચાર માટે જ છે ના ?

મહેમાન આવ્યા તો લાપણી વિના કેમ જમાડાય ? શ્રાવણ માસ આવ્યો તો ઘરમાદામાં તો પાંચ રૂપિયા આપવા જેઠશે. શ્રાદ્ધ આવ્યાં તો પાંચ-પચીશ જણુને ખવરાવ્યા વિના વહેવાર કેમ ચાલે ? પણ છોકરો માંદો પડયો ને દાક્તારને ભોલાવવો છે તો દાક્તારની ઝી કચાંથી કાઢવી ? ગાડીના પૈસા કચાં છે ? છોકરાનું શરીર માયકાંગલું છે તો જરા પૌષ્ટિક હવા કે ઓરાક ખવરાવવો છે, તો “ બાપુ !

ગરીબ માણસને બધું કયાંથી પાલવે ? ” એમ કહેવું, તેનું નામ ઓટી ગરીબાઈ છે.

આરો ભિત્ર કહે છે તે બરાબર જ છે કે “ નાહકનો હું વરધાડો ને અધરણીમાં એટલા બધા પૈસા શા માટે ખરચું ? ” ને ખરચ કરીને ખાલી થાડી ત્યારે શાને કહું કે હું મારા ખરચને હવે આગળ નહિ લણાવી શકું ? ઓટા ઓટા ખરચ કર્યા ને એ દિવસ વાહવાહ બોલાંદ તેમાં ખરચનું શું વળ્યું ? એ બિચારાને તો જીલદું હવેના ઓને વહેવો પડશો ! ”

\*

[ ૩૪ ]

બચી

બધાં બહારથી કરીને આવ્યાં ને બાએ કહ્યું : “ ચાલો, છાકરાંઓ ! પગ ધોએ ર્યો. રસ્તાની ધૂળ લાગી હશે. ”

આ આરોગ્યની દૃષ્ટિએ નાની નાની બાબતોની સારી કાળજી રાખતાં. રોજના મહાવરાથી બાળકો પણ ગંઢકી ને સ્વચ્છતાને તક્ષાવત સમજ્યાં હતાં, અને તેમને પણ કેટલીએક ગંઢી બાબતો ગમતી નહિ.

ખરુએ કહ્યું : “ આ રસુનું જરા મેં ચણ ધોવરાવજે. એને કાકીએ એમને ત્યાં ગયાં હતાં તે બચી લીધી હતી. કાકીને તાવ આવતો હતો. ”

રસુએ કહ્યું : “ અહીં બચી લીધી હતી; અહીં ધોવું પડશો. ”

બાળકોએ હાથમાં ધોઈ નાખ્યાં. હું એ જેઠને મનમાં  
પ્રસન્ન થયો. ખાસ કરીને મારું ધ્યાન બચુના ઉદ્ગાર તરફ  
ખેંચાયું.

બચુનું કહેલું બરાબર હતું. સાથે મારા મનમાં બાળકોને  
ખરી લેવા ન લેવાની બાબતમાં કેટલાએક વિચારેા આવ્યા.

મને લાગ્યું કે ધર્ણી વાર ગમે તે માણસ સારાં બાળકોને  
ખરી લેવા લક્ષ્યાય છે, ને થોડાએક પરિચય હોય છે ત્યાં  
ખરી લઈ પણ લે છે, આવો તેને અધિકાર છે? સાઝ નહિ.  
કોઈના બાળકને ખરી લેવાનો બીજાને અધિકાર નથી જ.

કોઈનાં રૂપાળાં બાળકોને જેઠને ખરી લેવા કેમ લક્ષ્યા-  
વાયું? આપણી પ્રીતિ કાંઈ એબાળકો ઉપર નથી પણ એમના રૂપ  
ઉપર છે. અને રૂપને જ માત્ર ખરી લેવાની આપણી વૃત્તિનું  
પુથક્કરણ આપણે કરી લેવું જેઠાએ. કાળીમેશ એવી હીકરીને  
મા ખરી લે છે ત્યાં માતુપ્રેમ છે. પણ જ્યાં આપણામાં  
નૈસગિક રનેહસંબંધ નથી છતાં રૂપથી આકર્ષણીય આપણે  
ખરી લેવા હોડીએ છીએ, ત્યાં મનમાં વિચારવું પડે છે. નાનાં  
બાળકોને આપને ખરી લઈએ ત્યાં તેઓ તો નિર્ણય જ છે;  
પણ તેથી આપણે નિર્ણય છીએ કે નહિ તે જેઠ લેવું જેઠાએ.

સગાંસંબંધીએને પણ સગાંવહાલાનાં બાળકોને ખરી  
લેવાનો અધિકાર તો ન જ હોય. પ્રેમના પ્રદર્શન રૂપે  
બાળકોને સગાંએ ખરી લે છે, તેના કરતાં એ એક જાતની  
પ્રેમદર્શનની જોઈ રૂઢિ છે. એવો પ્રેમ સગાંસંબંધીએમાં  
જિલ્ભરાતો ન હોય તો પણ ધર્ણી વાર સગાંએને જણે કે  
ખરી લેવી પડે છે, કેમકે તે એક પ્રકારનું પ્રીતિદર્શનનું  
કાર્ય છે. પરંતુ સગાંસંબંધીએ પણ પોતાની ખરી પાછળ

અજાણું પણે પોતે કેવી માનસિક સ્થિતિમાં છે તે ધીરે ધીરે જાણુતાં શીખવું જેઠુંચે.

બચીનો અધિકાર હોય કે ન હોય, બચી પાછળ વિકૃત માનસ હોય કે ન હોય, છતાં બચી લેતાં પહેલાં આરોગ્યની દર્શિને કહી પણ ભૂલવી ન જેઠુંચે. સગી મા પણ જે પોતાને ક્ષયરોગ હોય તો તે પોતાના બાળકને ભૂલે ચૂકે પણ બચી ન જ લઈ શકે. બચી લઈને પોતાનો રોગ તે બાળકને આપે તેના જેવું અરાબ કામ ફીજું કયું હોઈ શકે? અને બચી દ્વારા રોગો ફેલાય છે એ બાબતમાં આજે દાક્તરાનો મત મજબૂત છે. બાળકોઓ ડેટલા ચે રોગો બચી દ્વારા જ ફેલાય છે.

માબાપનો પ્રીતિનો ઉમળકો બચીથી શરૂ છે. બચી એ એક કુદરતની બક્ષિસ છે, ઊછળતા હૈયાનો આવિલ્લાવ છે, પ્રેમથી હલમલી રહેલા જ્ઞાનતંતુઓનો વિરામ છે, પ્રેમના અંતરની શાંતિ છે, પ્રેમપાત્ર પર અંતરનો અલિષેક છે! દૂંકમાં બચી એ અંતરને અંતર આપવાનો પ્રકાર છે-અને અંતરને અંતરથી ઝીલવાનો પ્રકાર છે. આથી જિલચાતા અંતરવાળી ગાય વાછરડાને ચાટવા લાગે છે; આથી મા પોતાના બાળકને રમતું-હસતું જેઠ હર્ષવીલી થતાં પોતાનો ઉમળકો બાળક ઉપર એક બચી દ્વારા ઢાલવે છે, અને ન કહી શકાય તેવી અંતર-પ્રેમની જાડી કથા અને લાગણી બાળકને કહે છે; અને બાળક પણ જાણે કે સમજુ જઈ તેને જાણે કે શેર લોહી ચહું હોય તેમ તે બચીનો આનંદ લઈ પાછું વધારે રમવા લાગે છે.

આવા સ્વાલાવિક રનેહના પ્રસંગે બચીને અવકાશ છે. એમાં પણ સૂક્ષ્મ વિકૃત અવસ્થા હોય તો પણ તે ક્ષમ્ય છે;

કારણું એ રીતે મનુષ્ય હજુ મનુષ્ય છે. પણ ખચીને માબાપ પણ જ્યારે ફેશન કરે છે, ને ખચીને જ્યારે એક લાલચ અથવા લાંચ બનાવે છે, અથવા ખચીને જોટા લાડનું રૂપ મળી જાય છે, ત્યારે તો ખચી ત્યાજ્ય જ છે. અને જ્યારે માબાપને રોગ હોય છે છતાં તે ખચી લે છે ત્યારે તો તે અજ્ઞાનને લીધે ભયંકર શુંને જ કરે છે. અજ્ઞાનને લીધે જ, એમ એટલા માટે કહેવું પડે છે કે જે માબાપ જણે કે ખચી લેવાથી રોગ ચાટે છે, તો તે ન જ લે; લેવાનું પણ તાન રોકવા તે પ્રયત્ન કરે જ.

ખચી લેવામાં બાળકના શરીરનો તેમ જ માનસનો વિચાર કરવો જેઈએ. બાળક ધણી વાર પ્રેમઘેલું થઈ ખચી લેવરાવવા આવે છે. તેને આપણે બીજી રીતે અંતરાય ન હોય તો સંતોષ આપીએ, તેના અંતરના આવિષ્કરણને વધાવવો જેઈએ. આપણે ખચીની સખત વિરુદ્ધ થઈ બાળકની સાહજિક આપણા પર પ્રેમ ઠલવવાની રીતનો પ્રતિકાર કરીએ તો બાળકને ધજો લાગે છે; તે હિજરાય છે. અનુભવીએને ખખર છે કે જેમ સુખી અને તંકુરસ્ત બાળકને ખુશનુભા રમતું જેઈને મા તેને ખચી લેવા હોડે છે, તેમ જ માને જેઈને બાળકને જુદા જુદા કારણે હેત ચડે છે, ને તે ખચી લે છે. મા એટલે બાળપણ સમજવું. આ હેતને રોકવાથી હેતના પ્રવાહને અટકાવ્યો છે; અને હેતનો પ્રવાહ અટકાવવાથી માણસમાં મંદ્તા, ખિન્તા, નિરાશા અને ડોધ ડોધ વાર ઝીજ અને ધિક્કાર કે તિરસ્કારની લાગળી જન્મે છે. બાળકને પણ માબાપને હેત કરવાનો કુદરતી હક્ક છે. જે કુદરતે માબાપ અને બાળકનો સંબંધ જોડયો છે, જે સ્વીપુરુષના પ્રેમાકર્ષણથી બાળકનું આગમન છે, તે કુદરતી આકર્ષણનો વિરોધ ન કરવો જેઈએ.

પણ બાળકને હમેશાં બચી લેવરાવવી કે લેવી ગમતી નથી. બાળકને ડોઈ ડોઈ વાર બચી લઇએ છીએ ત્યારે તે અત્યંત ત્રાસ પામે છે. એમ જ ડોઈ વાર આપણે તેની પાસે બચી લેવરાવીએ છીએ તો તે ના પાડે છે, ને પરાણે બચી લેતાં તે હિજરાય છે. માટે પરસપરના પ્રેમાકર્ષણને લીધે જ્યારે બચી લેવા પરસપર દોડે ત્યારે જ તેને ખરે અવકાશ છે; ત્યારે જ માણાપને અને બાળકને આનંદઅનુભવ થાય છે. અને છતાં આપણે બાળકને પોતાને ઉમળકો આવે ત્યારે આપણને બચી લઈ લેવાનો હુક્ક આપીએ. કેમકે નકાર કરવાથી તેને કેટલું નુકસાન થશે તે આપણે સમજુએ છીએ. પણ બાળક અણુસમજુ છે માટે તેની લાગણી હુખાય તેવું હોય લ્યારે આપણે તીવ્ર વેગ પણ અટકાવીએ, અને સંયમ વડે આપણી ઉત્કટતા ઊંચે ચડાવીએ.

આ બધું બચીની બાબતમાં વિચારવા જેવું લાગે છે. મથાળે આપેલા નાના એવા પ્રસંગને લીધે આટલું વિચારવાનું સૂઝયું.

એટલામાં તો બાળકોએ હાથમાં ધોઈ લીધાં હતાં, અને નાની રસુ પોતાનો ગાલ ધસીને કૂતી હતી, કેમકે તેને કાકીની બચી માની બચી જેવી મીઠી નહોતી લાગી; તેને તો બચીની હુંક લાગવાને બદલે થુક લાગ્યું હતું !

\*

[ ૩૫ ]

## બાળકો અને મહેમાનો

ધરની નાનીશી હુનિયામાં નાનાં બાળકો સામે નવો માણ્યસ 'મહેમાન' છે. આ મહેમાન બાળકોનું ધ્યાન તુરત જ એંચે છે, બાળકોની કુતૂહલવૃત્તિ જગાડે છે અને બાળકોને તે અભ્યાસ રૂપ થઈ પડે છે. પરિણામે મહેમાન બાળકને જાગૃત કરી જાય છે, સારીમાઠી બાબતોની છાપો પાડી જાય છે, બાળકોના કુમળાં જીવનમાં તાત્કાલિક અને કેટલીએક વાર કાયમી નુકસાનનાં ખીંચે રોપી જાય છે.

બાળકો તેને પોતાનાં માબાપનો જાણીતો, મિત્ર રૂપ, સગો કે સ્નેહી સમજુને તેની પાસે જાય છે, તેની સાથે વાતો કરે છે, તેને પોતાની વાતો કહે છે, ધરની વાતો કહે છે, બા અને બાપાની વાતો પણ કહે છે; ઉપરાંત તેઓ મહેમાનો પાસેથી વાતો સાંભળે છે.

તેઓ જાણ્યતાં નથી કે મહેમાનો જે વર્તન રાખે છે તે ઈષ્ટ છે કે અનિષ્ટ; મહેમાન જે વાતો કહે છે તે સારી ગણ્યાય કે નઢારી; મહેમાન જે રીતે તેમની સાથે વતેં છે તે સારું સારું ગણ્યાય કે નઢારું; કારણુંકે બાળકો મહેમાનોને અત્યાંત વિશ્વાસથી પોતાના ગણે છે. ઉપરાંત 'મહેમાન' એક નવી જ વ્યક્તિ હોવાથી તેનું બધું નહું જ લાગે છે, અને તે નવીનતાને કારણે બાળકો તે જેવા-જાણવા લક્ષ્યાચય છે. અજાણું બાળકોને જ્યાલ નથી હોતો કે બધી નવીનતા સારી નથી હોતી; ઘાણી વાર તો તે જ્યાંકર હોય છે.

મહેમાનો બાળકોને પરાણે પરાણે પાસે બોલાવે છે; તેમનો હાથ પડકે છે, તેમને ગલીપચી કરે છે, તેમને

ઓળામાં એસાડે છે, તેમને કુદાવે છે, નચાવે છે. આ ખંડું તેમના અધિકારની બહાર જ છે એ વાત જુદી છે; પણ લતાં બાળકો એમ માને છે કે જ્યારે બા કે બાપાના આ મહેમાનો છે, મહેમાનો મોટા માણુસ છે, બા અને બાપા તેમને માન આપે છે, ત્યારે તો તેઓ સારા જ હશે. તેઓ જે કરતા હશે તે સારું જ કરતા હશે. તેઓ જે કરે તે ન ગમે તો કોઈને કહેવાય નહિ કે બોલાય નહિ.

બાળકોને ઘણા મહેમાનો ત્રાસરૂપ લાગે છે, તેમને કઢંગા અને જંગલી જેવા લાગે છે. સંસ્કારી બાળકો તેમનાથી ફૂર જ રહે છે. છતાં મહેમાનો તેમને પાસે લે છે, રમાડે છે, ત્યારે તેઓ મૂંગાં રહે છે કે કોઈ વાર રડી પડે છે. આવે વખતે માભાપો જિલટાં બાળકોને કહે છે : “જે, એમ ન થાય. વાત કરો, એટા ! એ તો આપણે ઇલાણું છે. એમ ન થાય. વાત કરો, એટા ! એ તો આપણે ઇલાણું છે. એમ કાંઈ થાય ? એમ ન રડાય.”

પણ માભાપોને બાળકો મહેમાનોની હુર્ગંધ સમજલી શકતાં હોત તો માભાપોની આંખ તુરત બિઘડત, અને તેમનાથી બાળકોને તેઓ બચાવી લેત.

બાળકોને મહેમાનોની વાસ તીવ્રપણે આવે છે. તેઓ સારાનરસા મહેમાનોને ઓળખી કાઢે છે અને તે પ્રમાણે પરિચય લેવા રાણકરાળ હોય છે. છતાં જ્યારે એકવાર તેઓ મહેમાનોની બહીનાં સોગ થઈ પડે છે, ત્યારે તેઓ પણ મહેમાનપ્રિય થઈ જાય છે, અને મહેમાનોને પસંદ કરે છે. પછી તો ઘણા મહેમાનો પાસેથી બાળકો ન સમજે તેમ ચાર્ચિયની હુનતાની ફૂર ફૂરની લયંકરતાનો અસ્પષ્ટ એવો

પરિચય મેળવે છે, અને પોતે ન સમજે તેમ તેનો એક પ્રકારનો આનંદ મેળવે છે.

બધા મહેમાનોનો ઉપરકષ્ટો લાભ નથી મળતો; પણ કેટલા-  
એક હલકા મહેમાનો આવો લાભ આપવા શક્તિવાન હોય છે.

મહેમાનોના વર્ગો પાડીએ તો ભિત્રો, સગાંધીએ, શાલતુ  
આવતાજતા આડતિયાએ, ભલામણુથી આવેલા વટેમાર્ગુએ,  
વગેરે વર્ગો પડે. અંગ્રેજુમાં કહેવત છે કે “ખુદા આપણુંને  
આપણું ભિત્રોથી બચાવે.” એ કહેવત વધારે સારી રીતે  
આપણું એમ સમજવી જોઈએ કે “ખુદા આપણુંનું બાળકોને  
આપણું ભિત્રોથી બચાવે” આપણું ભિત્રો એઠલે વધારે  
નજીકના વધારે હજુ ધરાવનારાએ, વધારે માનનીય માણુસો.  
તેઓ બીડી પીતાં પીતાં બાળકોને રમાડે તો બાળકોએ  
તેમના ધુમાડા સહન કરવા ! તેઓ ગંધાતા મોઢે બાળકોને  
બચી લે તો બાળકોએ તે કણૂલ રાખવી ! તેઓ બાળકોના  
વાંસા થાબડે તો બાળકોએ તે માન્ય રાખવું ! તેઓ તેમને  
એ પગ વર્ચે કે હાથ વર્ચે દાણીને લીંસે તો બાળકોએ તે  
ગમાડવું ! માભાપોએ પોતાના ભિત્રોને આ કુટેવમાંથી  
છાડાવવા જ જોઈએ.

સગાંસંબંધીએ તથા મહેમાનોની લાગણીનો બહુ લાભ  
બાળકોને આપવાની જરૂર નથી. તેઓ બાળકો ઉપર જે  
કૌટુંબિક હજુ ધરાવે છે તેનો પણો હવે પૂરે થયો. છે એમ  
માબાપે વિચારી લેવું. સગાંસંબંધીએ બાળકો માટે આદર્શ  
રૂપ છે એવું બાળકો કઢી ન સમજે તે જોવું. આપણું આવા  
મહેમાનોની ટેવો, વિચારો વગેરે વિષે ઘરમાં ધૂઠથી બાળકો  
સમક્ષ વાતો કરીએ જ. “તારી બા આવી છે; તારી માશી  
તો આવી છે; ફ્લાણીએ ફ્લાણુંને એમ કહ્યું હતું; તું નાનો

હતો કે તું ધાવણી હતી ત્યારે આમ બન્યું હતું ને તેમ બન્યું હતું; તારો બાપ કે બા પરણ્યાં ત્યારે અમે આમ કચ્ચું હતું ને તેમ કચ્ચું હતું." વગેરે વાતો હવેથી સગાંસંબંધીએ બાળકોને કરતાં અટકે તે માટે ખૂબ કાળજી લેવી સગાંસંબંધીએ ઓપણું માન, ભમતા ને આપણી મહેમાનગતીનાં અધિકારી છે; પણ તેઓનો બાળકો સાથે વાતો કરવાનો ચાલુ થયેલો હુક્ક અતિથિસત્કારની યાદીમાંથી કાઢી નાખવો જેઠાએ.

આપણે ત્યાં આવતા-જતા આડતિયાએ વગેરે માણસો અગર વઠેમાર્ગુંએ સાથે આપણું બાળકોને પરિચય હોવો જ ન જેઠાએ. આપણું બાળકોને એમ જ કહી રાખવું ઘટે, કે આપણે તેમની સાથે કામ ન પડાય; આપણે તેમની પાસે જવાની અને ઐસવાની જરૂર ન હોય. બાળકોને એવી રીતે રાખવાં અને મહેમાનોને એવી રીતે ગોડવવા કે તેમની વર્ચયે પરિચય થવાનો અવકાશ ન રહે. ધીમે ધીમે બાળકોમાં મહેમાન મહેમાન વર્ચયેનો તરફાવત સમજવાની સૂક્ષ્મ લેફ્ટવાળી સંસ્કારિતા કેળવવી. બાળકો સાથે વારંવાર વાતો કરવાથી અને તેમનું વર્તન હોરવાથી બાળકોમાં આ સમજણું પેઢા થશે, બાળકો અલિમાની ન થાય, સૂગવાળાં ન થાય, અતિથિ પ્રત્યે ઘૃણાવાળાં ન થાય, તેવી રીતે તેમને જ્યાલ આવવા હેવો કે આપણાથી અસુક માણસો સાથે એકદમ હળાય-મળાય નહિ. અસુક માણસો સાથે ઐસાય-ઉડાય નહિ. બાળકોના પોતાના દરજાથી એ નીચું જ ગણ્યાય એમ તેમના મનમાં ઉતારવું જેઠાએ. આ ઉતારવાની રીત દરેક વિચારી અને સંસ્કારી ભાતાપિતા પોતાની મેળે જ શોધી શકે છે. અને તે તેમણે શોધી કાઢવી.

આડતિયાએ અને વટેમાર્ગ જેવા મહેમાનો આપણા તરફ સ્નેહ કે ઉપકારની લાગણી ભતાવવા બાળકોને રમાડે છે, તેમને લેટ આપે છે; ફરવા લઈ જવા કહે છે. આ બાખતમાં આપણું વલણ ખડું સપણ અને કડક જ રહેલું જોઈએ. આપણે જ મહેમાનોને સ્પષ્ટ ના કુણી દેવી જોઈએ. બાળકોના વલણને તેવે વખતે માન આપવાની જરૂર નથી, કેમકે તે વલણ મહેમાનોએ જિલું કરેલું અને કૃત્રિમ છે. બાળકોને જોઈએ તે આપણે લઈ દઈએ, અગર તેમને ગમે ત્યાં ફરવા લઈ જઈએ; પણ મહેમાનોને તેમ કરવા ન દઈએ. બાળક ઘણી વાર આને લીધે લોલી અને લાલચું બને છે. માબાપો પાસેથી ન મળતું બીજેથી મેળવવા ચંતન કરે છે, અને એમ હલકું બને છે.

આપણાં બાળકો અતડાં દેખાય તેની ચિંતા નહિ; આપણે જરા ગુમાની દેખાઈએ તેની પણ ચિંતા નહિ પણ બાળકોને ગમે તેવા મહેમાનો સાથે હળવામળવા કે રમવારઅળવા છૂટાં તો ન જ મૂકીએ. હા, આપણે બાળકોને મહેમાનોની નાની એવી સેવામાં પ્રસંગોપાત્ર ગોડવી શકીએ. જેમકે તેમને મહેમાનોને પીરસવા રાખીએ, મહેમાનોને માટે તેમની પાસે પાણી કે પાનસોપાની મગાવીએ, મહેમાનોને તેડવા જતાં ડાઈ વાર તેમને સાથે લઈ જઈએ, અને એ રીતે અતિથિભાવના, અતિથિની કિમત આપણે જરૂર તેમની પાસે મૂકીએ. પણ મહેમાનોના લોગ તો બાળકોને ન જ થવા દઈએ.

આપણે સૌ એકખીલને ઘેર મહેમાનો તરીકે જઈએ છીએ. આપણે સૌ એકખીલાંનાં બાળકો તરફના આપણા

હકો અને મર્યાદાએ સમજ લઈએ તો આપણે બાળકોને બચાવી લઈ શકીએ તેમ છીએ. મિત્રોનાં બાળકો પ્રત્યે કે સગાંનાં બાળકો પ્રત્યે આપણને મમતા હોય અને હોવી જેઠું એ; તે પોષવી પણ જેઠું એ. મિત્રોનાં બાળકો ધીમે ધીમે આપણાં બાળકોનાં મિત્રો થાય, એ મિત્રપરંપરા અથવા સગપણપરંપરા જિતરે તે રૂડું છે, અને તે માટે જ આપણાં બાળકોની મૈત્રી બહુ સંભાળથી, બહુ આદરથી, બહુ ચોગ્યતા-પૂર્વક સાધીએ. આપણાથી મિત્રોનાં બાળકો ફર રહે તો તેથી આપણે ઓટું ન લગાડીએ. મિત્રનાં બાળકો કે ખાનદાન કુટુંબનાં આપણા શેઠનાં બાળકો આપણી સાથે રમે, હળેમળે તો આપણને ગમે છે; આપણે તેમાં ચોડીએક મોટાઈ પણ માનીએ છીએ. પણ તે બધું બાળકોના હિત ખાતર છોડી દ્યું એ. આજે બાળકો ખાતર સૌએ જેમ ધણું છોડવાનું છે, બાળકો ખાતર પોતાની ચોગ્યતા વધારવાની છે, તેમ જ આ બાબતમાં પણ અવશ્ય કરીએ.

આપણે માખાપે પણ મિત્રોનો સાચો અને સહૃપદોએ કરીએ. મિત્રોની આવડતનો, બુદ્ધિનો, કલાપ્રિયતાનો ને સંસ્કારિતાનો લાભ આપણાં બાળકોને જરૂર અપાવીએ. એટલા માટે ચોગ્યતાવાળા મિત્રોને ઘરમાં વધારે નજીકનું સ્થાન આપી તેમની વાર્તા, નાટકો, વાતચીત, ખેલો, ગમતો વગેરે સાંભળવા—જેવાનું બાળકો માટે જરૂર ગોઠવીએ. બાળકો માણુસોનાં કેરલેક અંશો ભૂખ્યાં છે; તેઓ બહિર જગતનો મહેમાનો દ્વારા અલ્યાસ કરી શકે છે. પણ તે ભૂખ સારા અને સોજા એરાકથી ટળે તેવું આપણે કાળજીપૂર્વક ગોઠવવું. છતાં સારામાં સારા મહેમાનો વર્ચ્યે આપણાં બાળકોને કેવળ મૂકી હેવાં અને કેવળ ભરોંસે ચલવી લેવું એ બહુ ઠીક નથી. સારી વસ્તુની શોધ માટેની ચીવટ

અને અવિશ્વાસ એ બેમાં તજ્જવત છે. આપણા મહેમાનો આપણા માથા પર છે; પણ આપણી ચીવટ તેથી કભી કરવાની જરૂર નથી.



[ ૩૬ ]

ચંદ્રકાંત પિતા હતો।

ચંદ્રકાંત વિચારવંત પિતા હતો. દાક્તાર હતો. એટલે તે ધણો જ પ્રવૃત્તિમાં રહેતો; તેને પાણી પીવા જેટલી ચે કુરસદનન રહેતી; સવારથી સાંજ સુધી તે દરદીઓની વર્ચે જ જીવતો પણ સાંજ પડતી એટલે ચંદ્રકાંત વેર જ આવતો. સાંજનો એક કલાક તે દાક્તાર મટી જઈ પિતા બની જતો. દાક્તારના ધંધા પેઢે તેણે ડહાપણુથી પિતાનો જાળે કે ધંધ્યા બનાવ્યો હતો, દાક્તાર તરીકે જેમ તે આપેલો સમય ચૂકતો નહિ, તેમ તે બાળકો સાથે એસવાનો કે કરવાનો સાંજનો સમય ચૂકતો જ નહિ. દરદીને તે બહુ કાળજીથી સાચવતો અને ચોતાનુ' કામ ઇતેહમંહ કરવા તે અલ્યાસ અને અનુભવ વધારતો. તેમજ તે બાળકોના પિતા તરીકે સઝણ થવા તે કામનો અલ્યાસ અને અનુભવ વધારતો. એદરકારીથી જેમ દરદી ગુમાવી હેવાશે અને ધંધાને ધજ્જો લાગશે એમ તે માનતો, તેમ જ તે બાળકોની પ્રત્યે એદરકારીથી એમ ગુમાવી એસાશે અને પિતૃત્વના દરજાને કલંક લાગશે એમ માનતો દર સાંજે તે કાં તો છેકારાંઓ સાથે કરવા જતો. બાળમાં જતો તો બાળકોને આડેનાં તથા કૂલેનાં નામો ને જતો કહેતો એકાદ ઝેન્ડસ્ટેન્ડ પાસે એસતો

ત્યારે છોકરાને ત્યાં ખીલા કરી રાખતો નહિ; ધરની ગાડીમાં છોકરાએને બેસારી જ રાખવામાં તે શોભા માનતો નહિ; પોતે મિત્રો સાથે ફરાકા મારવામાં બેસી સાથે આવેલાં બાળકોને કોઈને ભળાવી હઈ તેમને બાગ જેવા મોકલતો નહિ. તે વખતે તે ઉત્તમ પિતા થવા ભારે કાળજી રાખતો હતો બીજી સાંજે એકદંતળાવે બાળકોને લઈ જતો. ત્યાં તેમને પાણીમાં હોડાવી પાણી ઉછાળી ઉછળાવી બાળકોને મજા આપતો; પાણીનાં વહુનો અવલોકાવતો; પાણી ઉપર પવનથી થતી લહરીએ હેખાડતો; સ્થિર પાણી હોય તો તેમાં પડતાં આડ-ટેકરાનાં પ્રતિભિએ તરફ ધ્યાન ચેંચતો, અને સંધ્યાટાણે આથમતા સૂર્યનું બિંબ ટેકરી પાછળ જતાં જતાં કે દૂર ક્ષિતિજમાં અદૃશ્ય થતાં થતાં તળાવના ઉપર કેવી રંગબેરંગી છાયાએ નાખે છે તે બાળકોને ખતાવી હર્ષ પામતો; સાંજ, સૂર્યોરત, સંધ્યાના બદલાતા રંગોના તળાવના પાણીમાં પડતા પડછાયા, કુદરતની શોભા અને સમૃદ્ધિ વગેરે વર્ચ્યે બાળકોને જિલાં રાખી કુદરતની ભવ્ય ગંભીર છાપ તેમના અંતર ઉપર પડવા હતો. વખી ત્રીજી સાંજે બાળકોને જનસમૂહનાં દર્શાન કરાવતો; રેલવે એનિઝન પાસે તેમને જિલાં રાખી એનિઝન અને તેના સંચા હેખાડતો; એનિઝન કેમ ચાલે છે તે સમજાવતો. તે ભૂલી જતો કે પોતે દાક્તાર છે. છતાં દાક્તાર શરીરના ભાગો ખતાવે તેમ તે સંચા ખતાવતો. તે એનિઝનિયર ન હતો પણ પિતા હતો. પિતાનું જીવન સરળ કરવા તેણે પિતાના ધંધાને લગતું પરચૂરણ કામ જાણી લીધું હતું. છોકરાએને પિતા પ્રત્યે ખૂબ આદર રહેતો. તેમના જીવનને નિલય નવી નવી વસ્તુશી લરી હેનાર પિતા જ બાળકોને પિતા લાગે છે. ઘણુંબાળકોને પિતા ફ્રેજફાર લાગે છે, ઘણુંને તે વકીલ

લાગે છે, ધણુંને તે દાકતર લાગે છે. ધણુંને હુકાનહાર વાણ્યિયો. લાગે છે, ધણુંને તે મહેતાજી લાગે છે; પણ ભાગ્યે જ થોડાં બાળકોને પિતા, એ પિતા લાગે છે. ચંદ્રકાંત પોતાનાં બાળકોને જુહે જુહે સમયે જુહે જુહે લાગતો હતો. કોઈ વાર બાગવાન લાગતો હતો, કોઈ વાર સુતાર-ખુહાર લાગતો હતો, કોઈ વાર કવિ કે ચિત્રકાર લાગતો હતો; બધું લાગતો હતો છતાં એકંદરે તે પિતા લાગતો હતો. બાળકોના મન પર એવી છાપ પડતી હતી કે અમારા બાપા, બાપા છે—પિતા છે.

ચંદ્રકાંત દાકતરનાં બાળકો ભાગ્યશાળી હતાં કેમકે તેમને પિતા સાંપર્યો હતો. પોતે પણ ભાગ્યશાળી ગણ્યાય કેમકે પોતે પિતા થઈ શક્યો હતો !



[ ૩૭ ]

અમીદાં

કવિ કલાપીએ એક કાવ્યમાં પેલી જૂની વાત વષ્ટુંવી છે. રાજ હતો તે ક્રવા નીકળ્યો. રસ્તે વાઠ આવ્યો; તરસ લાગી ને અંદર ગયો. એરૂતે મિડી અમૃત જેવો શેરડીના રસનો પ્યાંદો ભરીને રાજને ધર્યો. બાપુ એક પ્યાંદો ગટ-ગટાવી ગયા. બાપુને ટાઢક વળી; કાળજી ઠરીને હિમ થયું. બાપુએ કહ્યું : “એક બીજે કટોરા ભરો.” એરૂત વાઠમાં ગયો, ને શેરડી કાપી કાપીને પ્યાંદો ભરવા લાગ્યો. પણ શેરડીમાંથી રસ જ ન નીકળે ! ધણી મહેનત કરે ત્યારે માંડ

માંડ એ પાંચ ટીપાં પડે. બાપુને ઉતાવળ થઈ ને બાપુ ઐદૂત હતો ત્યાં આવ્યા. બાપુને જેઠ ઐદૂતનું માં વીલું પડી ગયું. શેરડી કાપે પણ ખાલો ભરાય નહિ !

“ બાપુ ! આ નથી સમજાતું, આમ કેમ થાય છે તે. ”

બાપુએ જ કહ્યું : “ એનું કારણ તો હું જ છું. તેં મને શેરડીનો રસ પાયો ત્યારે મને થયું : ‘ અહો ! આ ઐદૂતને ત્યાં આવું અમૃત છે તો એ કેટલો દ્રવ્યવાન હશે ? કેટલો સુખી હશે ? બસ, આની પાસેથી તો કર બમણો-ચોગણો લેવો જેઠએ.’ આ વિચાર થયો. એટલે મારી નીતિ બગડી. મારી રાજાની જે અમીદાદિ જેઠએ તેમાં જેર ભજ્યું; ને એજ આ રસ નથી નીકળતો એનું કારણ છે !”

આ અમીદાદિ એ ભારે મહત્વની વસ્તુ છે.

એતરનો પાક ખાતરપાનથી તો થાય છે, પણ એતરને શેઠ કે માળે બેઠેલો ઐદૂત પોતાના લીલા હરિયાળા એતરને જેઠને મલકાયા કરે છે, અંતરમાં રાજુ રાજુ થાય છે, ને હેંશે હેંશે પક્ષીએ ઉડાડે છે ને પાણી પાય છે, ત્યારે તે ખાતરપાનતું ચે ખાતરપાન-પોતાનું અમીલયું” અંતઃકરણ રૂડે છે. અને તેનાથી તો આએ પાક પોખાય છે.

જેણે પોતાનાં ઉછેરેલાં કૂલઅડો ને કૂલવેલીએની સામે જેઠને જલેલા માળીને જેયો હશે તે કહેશે કે માળી માળે એકવા પાણી ને ખાતરથી બાગ નહિ કરતો હોય; એની મીઠી નજર એનાં કૂલેને હસાવતી હશે, એનો કોમળ સ્પર્શ વેલોના પાંદડીએ પાંદડીએ રસ મૂકતો હશે. માળી કૂલ જેઠને હરખી ઉડે છે. કોઈ કૂલને તોડે તો એનો જીવ કુળીએ કુળીએ કપાય ! પોતે કૂલને તોડે તોપણ કેટલી

સાચવણુથી; વેલને આડ ઉપર ચડાવશે તો પણ રખે ને કંઈ થઈ જય એવી કાળજીથી. આતું નામ માળીની અમીદિ. આ અમીદિમાં કૂલો ખીલે છે ને વેલ પાંગરે છે.

દ્વધ હોહતી વખત ગોવાળને ગાયને ગળે હાથ ફેરવતો આપણે જેણો છે. ગાય ચરીને આવી છે, ખાણ ખાય છે, તેથી તે દ્વધ આપે છે; પણ જ્યાં ગોવાળ ‘ભાપો, ભાપો !’ કરીને હાથ ફેરવે છે ને શીંગડીએ ચળ કરે છે, લ્યાં ગાય કેટલો ચે વધારે પારસો મૂકે છે ! વણું લોકોને તો ખાસ ગોવાળો પાસે જ ગાય હોવરાવવી પડે છે. કહેવાય છે કે ગાય એને હળેલી છે. એનો અર્થ એ કે ગોવાળમાં એવી અમીદિ રહેલી છે કે ગાય તેને લીધે અમૃત જેવા દ્વધને આંગળમાંથી ઊલરાવા હે છે.

અને મા જ્યારે બાળકને ધવરાવવા એસે છે ત્યારે એને જેણે જેઠું હશે, તે જ કહેશે કે બાળક દ્વધથી મોટું થતું હશે કે અમીદિથી. મા મનમાં પોતાને પણ ખખર ન પડે તેમ વિચારે છે : “ આ મારો પ્રાણ, આ મારું ચેતન, આ મારું સર્વસ્વ ! અને હું પ્રાણને પ્રાણ આપું છું. ચેતનથી ચેતન આપું છું. મારો પ્રાણ આ દ્વધ વાટે એનામાં લરું છું. આ દ્વધ દ્વધ નથી પણ અમૃત છે ! ” આ કાંચ નથી; માના હૃદયમાં જે અકૃથ્ય ભાવો છે તે આ જ છે. મા દ્વધ નથી પાતી પણ પ્રેમામૃત પાય છે, ને એનાથી મનુષ્યબાળક જીવંત રહી મોટું થાય છે.

આ બધી અમીદિએ છે. પ્રજા રાજની અમીદિમાં, બાગ માળીની અમીદિમાં, એતર એકૂતની અમીદિમાં ને બાળક માની અમીદિમાં ઊછરે છે ને મોટું થાય છે.

આ અમીદિષિ એટલે વધવાનો, ખીલવાનો ને વિકસવાનો એક અનિવાર્ય નિયમ. આ નિયમ જ્યાં ન પ્રવતે લાં ખીલવણી બંધ પડે, સંકોચ થઈ જાય, શુષ્કતા ને મંદતા આવે, સડહું શરૂ થાય.

આ નિયમ આપણે આપણાં ભાગકો અને આપણી ભાખતમાં વિચારીએ.

ભાગકો આપણાં ધરેના રેખાઓ અગર કૂલાડો છે; તેઓ આપણે તૈયાર કરેલા વાતાવરણુમાં ને ખાતરપાનમાં માટાં થઈ રહ્યાં છે; તેઓ આપણી દિષ્ટિ તળે જીવી રહ્યાં છે. આપણી દિષ્ટિ જીવી કડવીમારી હશે તેવાં ભાગકો થશે. મારી પોતાના જ ભાગનાં કૂલાડોના કચારાઓમાં ધરધરખ પગ દ્યાને ચાલે, ગમે તેમ મરજુ પ્રમાણે ચાલે, કૂલ જોઈને હરખાય નહિ પણ ઠીક છે—થયાં છે એમ સમજે, તો એનો ભાગ પાંગરે નહિ. આપણે ભાગકોની વર્ણે કેવળ તેમની હાજરો પરતે એદરકાર રહીએ, તેમને જડસા જેમ ગમેતેમ હડકોલાવીએ કે ધક્કેલીએ, તેમની કૂણી કૂણી લાગણીએનો વિચાર જ ન કરીએ, તેમને અલિસુખ ન રહેતાં આપણામાં જ પડ્યાં હોઈએ તો ભાગકો ચીમળાશે. તેમને આપણી અમીદિષિનું પોષણ નહિ મળે.

ભાગકો ઘૂંઘ નાગુક છે, નાનાં છે, છતાં તેઓ સૂક્મ સંસ્કારક્ષમ અને લાગણીઓઠી છે. તેઓ આપણી રાજુખુશી-એક્ષામરજુ તુરત એળાએ છે. તેઓ આપણને કડક જોઈને બિડાય છે, ને આપણુને પ્રસન્ન જોઈને જિધડે છે.

જેના ધરમાં માતા અને પિતા અધિકારના બળથી બધાં સાથે કામ લે છે અને ભાગકો પણ તેના લોગ થનું પડે છે, ત્યાં ભાગકો અમીદિષિ વિહોણ્યાં છે.

જેના ઘરમાં બાળકો એટલે નાનાં છોકરાં, કશા ય માનપાન આપવાની લાયકાત વિનાનાં, પડતાં આખડતાં મોટાં થવાવાળાં ગણુાય તે ઘરનાં બાળકો પણ અમીદિષ્ટ વિદોણું હોય છે.

જે ઘરમાં બાળકની સામે જેઠ તેમનાં નાનાં કામો, તેમની નાની વાતો ને તેમના ભાવેને પ્રત્યુત્તર મળતો નથી પણ જીલટું તેમનાં કામો તરફ ઉપેક્ષા અગર અણુગમો હોય છે, ત્યાં અમીદિષ્ટ નથી પણ વિષદૃષ્ટિ છે.

જેના ઘરમાં બાળકોને આચાના સ્વાર્થો અને ઘણી વાર ગંદા વાતાવરણમાં રહેવું પડે છે, ત્યાં અમીદિષ્ટના ખાતરથી જીલટું જ ખાતર મળે છે.

જેના ઘરમાં માબાપોમાંથી સ્વાર્થવૃત્તિ, દ્રેષ્ટવૃત્તિ, વૈરવૃત્તિ, લોભવૃત્તિ, વગેરે હલકી વૃત્તિઓનું પ્રત્યક્ષ અપ્રત્યક્ષ વાતાવરણ બાળકોને મળે છે ત્યાં બાળક અમૃતમાં નહિ પણ હળાહળમાં જીછરે છે.

જે બાળકો માબાપના કલેશકંકાસમાં, સગાંસંબંધીઓની કુથલીઓમાં ને નાતનાતની ખટપટના પ્રપંચોમાં હોય છે, ત્યાં પણ અમૃતપાન તો નથી જ; માત્ર જેરનું પાન છે.

બાળકો ઘરમાં જીછરતા છોડો છે. તેમના ઉપર જેમ હવા-સૂર્ય-પ્રકાશની સારીમાઠી અસર થાય છે, તેમ જ માબાપો અને અન્ય જોનાની સારીમાઠી અસર થાય છે. તે અમૃત જેવી પણ થાય છે, ને જેર જેવી પણ થાય છે.

આપણે જ્યારે ચિંતા કરીએ કે બાળક શરીરથી, મનથી કે નીતિરીતિએ કેમ વિકસનું નથી, કેમ તે જીલટું મંદ અને નિસ્તેજ થતું જાય છે, કેમ તે ભૂલકણું ને પ્રમાહી થતું

જાય છે, ત્યારે આપણે તપાસવું જોઈએ કે આનું કારણ આપણું ટોકડવું તો નથી ? આનું કારણ આપણે એની પ્રવૃત્તિ-એ જોઈને રાજુ નથી થયાં એ તો નથી ? આનું કારણ આપણી સહાનુભૂતિને અભાવ તો નથી ? અમીહિંના અભાવનાં આ બધાં લક્ષણો છે.

અમૃતની દાઢિ અને વિધની દાઢિ જાડી અને જીણી બંને છે. બાળકને પ્રસન્નતાથી જોલાવીએ ને જવાબ આપીએ એ જાડી દાઢિ; બાળક કંઈ કરે અને તે પ્રેમથી નિહાળીને મનમાં ખુશી થઈએ—લલે બાળકને તેની ખબર પણ ન પડે, તે જીણી દાઢિ. બાળક આપણી પાસે ઈનામ નથી માગતું પણ કદર માગે છે; બાળક આપણી પાસે ઈનામ નથી માગતું પણ આપણે રાજુ થયાં છીએ તેટલું તો માગે જ છે. બાળક આપણું કહેતું નથી કે બધું અમારું જોયા કરેા ને પાસે એસી રહેા; તે એટલું જ માગે છે કે આપણે તેની સામે નથી જેતા એમ નથી, પણ તેની સન્મુખ જ છીએ; ને જ્યારે તે આવશે ત્યારે હેતુથી વધાવીશું ને શાંતિથી સરલ ને રનેહાલથોડી ઉત્તર આપશું; મુશ્કેલી હશે તો ફૂર કરીશું અગર ફૂર કરવામાં મદદ કરીશું.

વિધની જાડી દાઢિ એટલે કે આપણે બાળકના પ્રયત્નને હંડધૂત કરીએ, મૂરખ ગણી હસી કાઢીએ વગેરે. વળી, લલે આપણે બાળકને કશું કડવું વેણું કહીએ નહિ, પણ જો આપણી આંખ તેને નિસ્તેજ જણ્ણાય, આપણો ચેહારો તેને આદર ન આપતો હોય, આપણી વાણી તેને ઢંડી ને સૂકી લાગતી હોય, આપણું વર્તન તેને સમજાતું ન હોય, આપણી રીતલાત ખડખચડી તેમ જ અવગણુનાલરી હોય, તો બાળકને તે બધું હુંઘર્ઝ થાય છે. એ બધું આપણે ત્યારે જ કરીએ

છીએ અગર થાય છે કે જ્યારે આપણી દિલ્હી બદલાય છે,  
જ્યારે આપણી દિલ્હી અમૃતની મટી વિષની થાય છે.

બાળકો દિલ્હીનો લેદ તુરત સમજે છે. પાડેશીની બાઇએ  
ખાળક પર કેવી દિલ્હી ફેંકી અગર નાના કાકાએ જીવી ફેંકિના  
ફીકરા પર કેવી નજર હેખાડી તે બાળક પકડી શકે છે, ને  
માબાપને કહી પણ શકે છે. આ આપણો સામાન્ય અનુભવ  
છે. આપણે બાળકોને અમીદિષ્ટથી ઉછેરીએ અને આપણી  
પાસેથી, આપણાં ઘરામાંથી ને આસપાસમાંથી આપણાં  
બાળકોનું જીવન મીઠું કરવા કરવી દિલ્હી હાંકી કાઢી સઘણે  
અમીદિ પાથરીએ.

આપણું અને બાળકોનું—ઉલયનું એમાં જ કદ્યાણું છે.

नानाभाई लहड़ना द्ये विशिष्ट प्रकाशनो  
भारतीय संस्कृतिनो। शिरोमणि अंथ

## श्रीमहे लोक भागवत

लाग : १-२ लेखक : नानाभाई लह  
किंमत रु. ४५-००

## लोक भारत-लोक रामायण-सेट

स्व. नानाभाई-ध. स. १६३० थी १६४४ वर्षे  
महाभारतना पात्रो-तथा रामायणना पात्रो लघेला-  
भाई अम दक्षिणामूर्ति संस्था आंबलामां स्थपाया  
पछी रामायण-महाभारत जेवा महाअंथाने लोक सुगम  
करवाना हेतुधी तणपही भाषामां ‘लोक भारत’ ने नामे  
(महाभारतना पात्रो-१२) तथा ‘लोक रामायण’ ने  
नामे (रामायणना पात्रो-६) प्रगट करेल - तेनी नवी  
छेली आवृत्ति.

लोक रामायण (१ थी ६) रु. २०/-

लोक भारत (१ थी १२) रु. २५/-

---

### आचितस्थान


---

## अंबकार आउट्य मांडिर

पो. बो. नं. ३४ : भावनगर (सौराष्ट्र)







દરેક બાળમંહિરમાં....અને હવે તો પ્રત્યેક ધરમાં  
જેની પ્રાથમિક આવશ્યકતા બેખવામાં આવે છે તે

## બાળગીતો ભાગ ૧-૨-૩નો સેટ

સંપાદક : સોમાભાઈ ભાવસાર

આ બાળગીતોના સંપાદક શ્રી સોમાભાઈ  
ભાવસાર પોતે પણ બાળગીતોના સફળ રચયિતા  
તરીકે જાણીતા છે. ગુજરાતના અનેક કવિઓના  
રચેલાં બાળગીતોમાંથી આ વણે નાનકડા સંઘર્ષમાં  
સોમાભાઈએ કમબદ્ધ રીતે ૧૮૬ ગીતો, પસંદ કરીને  
આપ્યાં છે. બાળકવાળા કોઈપણ ધરમાં કે બાળ-  
મંહિરોમાં આ બધાં ગીતો બાળકોને આનંદ ને  
ખિલખિલાટ આપશે. ગીતોની જેમ જ થોડા સમયમાં  
બાળવાતો આપવામાં આવશે.

આ પુસ્તકો મેળવવાં તથા અન્ય ભાહિતી માટે લખો :



: પ્રાપ્તિસ્થાન :

## સંરક્ષાર સાહિત્ય મંહિર

પોસ્ટ ઓફિસ નંબર : ભાવનગર ૩૬૪ ૦૦૧

રાધેશ્યામ પ્રિન્ટિંગ પ્રેસ, બેખડાનજર, ભાવનગર.